

JINDAL WORLDWIDE LIMITED**FY 2017-2018****Lists of Dates of Publication in Western Times Newspaper**

Sr. No	Particulars of Agenda	Gujarati	English
1	Notice BM	23rd May 17	23rd May 17
2	Results	31st May 17	31st May 17
3	AGM Notice	6th Sept 17	5th Sept 17
4	Notice BM	8th Sept 17	8th Sept 17
5	Results	16th Sept 17	16th Sept 17
6	Candidature	21st Sept 17	20th Sept 17
7	Notice Postal Ballot	10th Nov 17	9th Nov 17
8	Notice BM	5th Dec 17	5th Dec 17
9	Results	14th Dec 17	14th Dec 17
10	Record Date	14th Dec 17	14th Dec 17
11	Notice BM	06th Feb 18	06th Feb 18
12	Results	15th Feb 18	15th Feb 18

Jaitley to open India-Africa Cooperation sessions at AfDB meet

Gandhinagar, As part of the annual meeting of the African Development Bank (AfDB) that begins here from Monday, Finance Minister Arun Jaitley will open the India-Africa Cooperation sessions to discuss ways of boosting mutual cooperation, industry chamber CII said in a statement here.

The session will cover areas such as trade and investment, agriculture, renewable energy and manufacturing, IT and ITes, among others, it said.

This is the first time the AfDB is holding its annual meeting outside the African continent. The five-day meeting will be inaugurated by Prime Minister Narendra Modi on May 23.

During the meetings, India is also eyeing cooperation with Africa on the International Solar Alliance (ISA) initiative, of which France and India are the co-chairs.

Total trade between India and Africa increased almost five-fold between 2005-06 and 2015-16, and stood at \$52 billion at the end of the fiscal 2016-17.

India's exports to Africa increased from \$14 billion in 2007-08 to \$23 billion in

2016-17, at a compound annual growth rate of 5.6 per cent.

Indian imports from Africa increased from \$20 billion in 2007-08 to \$28 billion in 2016-17, accounting for 7.5 per cent of total Indian imports.

Heads of states from Benin and Rwanda and other African countries as well as Vice-Presidents from Comoros and Cote d'Ivoire, and AfDB president Akinwumi Adesina are expected to address the sessions.

The government is also planning an exhibition to showcase the capabilities of Indian companies in terms of technology, innovation, and start-ups, which could be relevant to African countries.

During the India-Africa Forum Summit 2015, the announcement of \$10 billion Line of Credit marked a new beginning in India's approach to engage with African countries in a more constructive manner.

India joined the African Development Fund in 1982 and the AfDB in 1983, initiating a long history of cooperation spanning over 30 years.

Bank of India narrows net loss to Rs 1,045.54 cr

Mumbai, The state run lender Bank of India on Monday reported a standalone net loss of Rs 1,045.54 crore in the quarter ended March 31, 2017 as compared to Rs 3,587.11 crore of net loss incurred in the year-ago period.

Its total income in the quarter under review stood at Rs 12,335.71 crore, up by 8.35 per cent from Rs 11,384.91 crore in the corresponding period of previous financial year.

The bank's operating profit at Rs 3127.48 crore in the fourth quarter of the last fiscal was up 11 per cent from Rs 1464.19 crore in the year-ago quarter of the previous fiscal.

The lender reduced the provisions for bad loans to Rs 4,483.53 crore in January-March quarter as against Rs 5,441.67 crore a year ago.

The lender in the country also reported that its gross NPAs (non-performing assets) figured at Rs 52,044.52 crore in the March quarter as against Rs 49,879.12 crore in the year-ago. As on March 31, 2017, the bank's return on asset remained negative.

Lava Z25 smartphone: Not an easy road ahead

New Delhi, With Chinese smartphone makers having captured 49 per cent of the market in the first quarter of 2017 and threatening to wipe out domestic players, Lava has just launched what can be described as a truly mid-segment premium device from an Indian player.

Priced at Rs 18,000, the Z25 is a design-oriented device and aims to give Xiaomi Redmi Note 4, Lenovo Z2 Plus and Honor 8 Lite decent competition in the same price category.

Let us see what works for the device.

Encased in a unibody metal design, the Z25 boasts of premium looks. Its curved design and slim body will appeal to youngsters.

The fingerprint sensor at the back is ergonomically placed and opens the device in a jiffy -- holding true the company's claim of unlocking the device in a mere 0.16 seconds.

Sporting a 5.5-inch, 2.5D-curved HD IPS display, the dual-sim device is powered by an octa-core processor, supported by 4GB RAM

and 32GB on-board memory that can be expanded up to 128GB.

Running on the Android Marshmallow 6.0 operating system, the device handled multi-tasking well with no signs of slowing down.

Users will not be discomfited by any sudden jamming of the device while shuffling between multiple apps or heavy gaming.

The device has a 13MP rear camera with "Sony Exmor RS" feature. The rear camera supports the "Bokeh Mode" feature that claims to make objects stand out from the background and gives photos a DSLR-like effect.

The 8MP front shooter is equipped with spotlight flash.

The 3020mAh battery with two power saver modes -- "Power Saver mode" and "Super Power Saver mode" -- extended the battery backup by five hours and 20 mins and 18 hours, respectively.

What does not work for the device?

The HD display is not very sharp and produces average colours while playing games or streaming videos.

Though it features a 13MP rear camera, the photos lacked detail and appeared dull. The "bokeh effect" did not achieve its full potential.

Conclusion: Z25 has a tough competition in Chinese devices in the same price band and needs to improve itself. However, the device is still a good effort from an Indian smartphone player and users can give it a chance if the price doesn't bother them.

Business Brief

Key Indian equity indices trade in green

Mumbai, The key Indian equity indices on Monday was trading higher in the morning session.

The 30-scrip Sensitive Index (Sensex), was trading 200.02 points or 0.66 per cent higher soon after opening. The wider 51-scrip Nifty of the National Stock Exchange (NSE) was also trading 61.05 points or 0.65 per cent higher at 9,488.95 points. The Sensex of the BSE, which opened at 30,638.88 points, was trading at 30,664.94 points (at 9.21 a.m.), higher 200.02 points or 0.66 per cent from the previous day's close at 30,464.92 points. The Sensex touched a high of 30,712.15 points and a low of 30,638.88 points in the trade so far.

Positive global cues lift Indian equities, FMCG stocks gain

Mumbai, Positive global cues and healthy buying in FMCG, consumer durables and capital goods stocks lifted the Indian equity markets during the mid-afternoon trade session on Monday.

Around 12.50 p.m., the wider 51-scrip Nifty of the National Stock Exchange (NSE) rose by 19 points or 0.20 per cent to 9,446.90 points.

The 30-scrip Sensitive Index (Sensex) of the BSE, which opened at 30,638.88 points, traded at 30,574.27 points (at 12.45 p.m.) -- up 109.35 points or 0.36 per cent from its previous close at 30,464.92 points.

The Sensex has so far touched a high of 30,712.15 points and a low of 30,569.62 points.

However, the BSE market breadth was bearish -- with 1,462 declines and 1,042 advances.

"The equity benchmark indices started off the first day of the week on a positive note and witnessed gap-up opening, tracking firm global cues.

Appreciation of the rupee against the US dollar in initial trades also supported the firm opening," Dhruv Desai, Director and Chief Operating Officer of Tradebulls, told IANS.

"FMCG sector stocks witnessed strong buying support, led by ITC and Marico. Aviation sector stocks traded with bearish sentiments tracking higher crude oil prices."

On Friday, the benchmark indices closed on a flat note after a volatile trade session, as investors booked profits. The NSE Nifty closed at 9,427.90 points, while the BSE Sensex closed at 30,464.92 points.

System failure cause flight delays in Australia, New Zealand

Canberra, A failure of the global passport control systems on Monday caused major delays for international passengers at Australian and New Zealand airports.

"Airlines experiencing difficulty checking-in travellers for international services due to outage of Advanced Passenger Processing system," the Melbourne

airport operator said on its Twitter account.

The Sydney airport operator, which also issued a similar message on Twitter, said that the service has now resumed as normal.

The Australian Department of Immigration and Border Protection said in a statement it was "aware of an external system outage with the Society Interna-

tional Telecommunications Aeronautiques (SITA) system". The problems were caused by crashes in the Passenger Service System program, a mandatory process in Australia for international airlines, which has forced several airlines to check-in passengers manually. Officials believe that failures have occurred in the globally used pas-

port control system, meaning passports could not be read electronically thus slowing down the check-in process. In New Zealand, Auckland and Wellington airports experienced similar problems due to failures in the national system used by the country's Immigration Ministry, according to the New Zealand Herald newspaper.

IT industry sees 24% fall in hiring in April: Survey

New Delhi, With top IT firms laying off professionals, the IT-software industry was hit the most with a 24 per cent fall in hiring in April this year as compared to April 2016, according to a survey by job site Naukri.com.

"The overall job market saw an 11 per cent fall in new jobs, with IT-software industry most hit. IT-software industry was hit the most with a 24 per cent decline in hiring in April as compared to April 2016," the Naukri Job Speak Index said. April jobs index saw year-on-year fall in major metros -- Delhi/NCR, Mumbai, Bengaluru and Chennai, it added. Hiring activity saw a fall in telecom, BPO, insurance and construction sectors during April as compared to April 2016. Key industries like construction and BPO/ITES saw a 10 per cent and 12 per cent fall, respectively, while banking saw a 11 per cent increase in hiring during April 2017 as compared to April 2016, it said. Commenting on the report, V. Suresh, Chief Sales Officer, Naukri.com said: "As predicted earlier, job market

continues to be volatile and the Jobspeak index in April has shown a negative growth of 11 per cent (YOY)." "Though major negative impact seems to be in sectors like IT/BPO/telecom/insurance and construction, there seems to be an air of caution across all sectors and this volatility is likely to continue for a few more months before the markets could move north again."

AREX INDUSTRIES LIMITED

(CIN: L99999GJ1989PLC012213)
Regd Office: 612, GIDC Estate, Chhatral, Tal.: Kalol, Dist.: Gandhinagar-382 729.
Phone: +91 2764 233636 Email: mail@arex.co.in Website: www.arex.co.in

Statement of Standalone Audited Financial Results For the Quarter and Year ended on 31st March, 2017 (Rs. In Lacs)

Sr. No.	Particulars	3 months ended (31.03.2017)		Preceding 3 months ended (31.12.2016)		Corresponding 3 months ended (31.03.2016) in the previous year		Year to date figures for current period ended (31-03-2017)		Previous year ended (31.03.2016)	
		Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited
Part-1											
1	Revenue From Operations										
	Revenue from operations (Net of Excise Duty)	874.05	816.59	831.69	3493.59	3215.52					
	Other income	6.21	0.98	4.56	7.65	5.67					
	Total Revenue	880.26	817.57	836.25	3501.24	3221.19					
2	Expenses										
	(a) Cost of materials consumed	247.79	217.04	264.2	1007.38	927.14					
	(b) Purchases of stock-in-trade	13.18	24.34	1.57	46.01	2.87					
	(c) Changes in inventories of finished goods, work-in-progress and stock-in-trade	21.68	-8.54	29.32	8.15	16.72					
	(d) Employee benefit expense	228.53	192.96	222.12	829.48	775.82					
	(e) Finance costs	29.37	24.09	22.04	101.55	71.83					
	(f) Depreciation and amortisation expense	73.00	59.00	47.59	251.00	253.9					
	(g) Other Expenses	165.17	234.5	161.00	767.64	721.78					
	Total expenses	778.72	743.39	747.84	3011.21	2770.06					
3	Profit before exceptional and extraordinary items and tax	101.54	74.18	88.41	490.03	451.13					
4	Exceptional items	0	0	0	0	0					
5	Profit before extraordinary items and tax	101.54	74.18	88.41	490.03	451.13					
6	Extraordinary items	0	0	0	0	0					
7	Profit before tax	101.54	74.18	88.41	490.03	451.13					
8	Tax Expense										
	Current tax	33.11	22.45	45.56	156.41	159.29					
	Deferred tax	3	3.00	1.33	12.00	5.30					
	Total tax expenses	36.11	25.45	46.89	168.41	164.59					
9	Net Profit Loss for the period from continuing operations	65.43	48.73	41.52	321.62	286.54					
10	Profit (loss) from discontinuing operations before tax	0	0	0	0	0					
11	Tax expense of discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00					
12	Net profit (loss) from discontinuing operation after tax	0.00	0.00	0.00	0.00	0.00					
13	Profit (loss) for period before minority interest	0.00	0.00	0.00	0.00	0.00					
14	Share of profit (loss) of associates	0.00	0.00	0.00	0.00	0.00					
15	Profit (loss) of minority interest	0.00	0.00	0.00	0.00	0.00					
16	Net profit (Loss) for the period	65.43	48.73	41.52	321.62	286.54					
17	Details of equity share capital										
	Paid-up equity share capital	395.87	395.87	395.87	395.87	395.87					
	Face value of equity share capital	10.00	10.00	10.00	10.00	10.00					
17	Details of debt securities										
	Paid-up debt capital	0	0	0	0	0					
	Face value of debt securities	0	0	0	0	0					
18	Reserves excluding revaluation reserve	0	0	0	1744.43	1422.81					
19	Debiture redemption reserve	0	0	0	0	0					
20	Earnings per equity share										
	Basic earnings (loss) per share from continuing and discontinued operations	1.65	1.23	1.05	8.12	7.24					
	Diluted earnings (loss) per share from continuing and discontinued operations	1.65	1.23	1.05	8.12	7.24					

STATEMENT OF ASSETS & LIABILITIES AS AT 31ST MARCH, 2017 (Rs. in lakhs)

Sr. No.	PARTICULARS	AS AT 31.03.2017 (Audited)		AS AT 31.03.2016 (Audited)	
		(Audited)	(Audited)	(Audited)	(Audited)
A. EQUITY AND LIABILITIES					
1.	Shareholders' Funds:				
	(a) Capital	395.87	395.87		
	(b) Reserves and Surplus	1744.43	1422.81		
	Sub-total of Shareholders' Funds	2140.30	1818.68		
2.	Non-current Liabilities				
	(a) Long-term borrowings	808.67	627.33		
	(b) Deferred tax liabilities (net)	92.40	80.40		
	Sub-total of Non-current Liabilities	901.07	707.73		
3.	Current Liabilities				
	(a) Short-term borrowings	358.23	335.73		
	(b) Trade payables	51.37	50.71		
	(c) Other current liabilities	324.88	250.68		
	(d) Short-term provisions	0.00	184.42		
	Sub-total of Current Liabilities	734.48	821.54		
	TOTAL - EQUITY AND LIABILITIES	3775.85	3347.95		
B. ASSETS					
1.	Non-current Assets				
	(a) Fixed assets	2014.94	1948.20		
	(b) Non-current investments	102.61	102.61		
	(c) Long-term loans and advances	336.98	156.61		
	Sub-total of Non-current Assets	2454.53	2207.42		
2.	Current Assets				
	(a) Inventories	405.47	356.37		
	(b) Trade receivables	787.27	707.37		
	(c) Cash and cash equivalents	71.12	33.83		
	(d) Short-term loans and advances	41.80	29.93		
	(e) Other current assets	15.66	13.03		
	Sub-total of Current Assets	1321.32	1140.53		
	TOTAL - ASSETS	3775.85	3347.95		

Notes:

- The above results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meetings held on 22.05.2017
- The Board of Directors recommended Final Dividend @ 20% i.e. Rs.2/- per equity share for the year 2016-17
- The figures for the quarter ended 31st March 2017 and 31st March 2016 are the balancing figures between audited figures in respect of the full financial year & the year to date figures upto the third quarter of the respective financial year
- The Company does not have more than one reportable segment.

For, AREX INDUSTRIES LTD.
Dinesh Bilgani
(DIN: 00096099)
Managing Director & CFO
Place : CHHATRAL
Date : 22-05-2017

Gujarat Water Supply & Sewerage Board
E-Tender Notice No. 02 Year :- 2017-18

Tender invited through e-tendering By The Executive Engineer, Public Health Works Division, (G.W.S. & S. Board), "Jai Bhavan", Rajkot Road, New Circuit House, Surendranagar 363 001. Phone No. (02752) 284 598 Mo:- 99784 06824 from the Government Register Contractor having financial and technical criteria.

N. o	Name of Work	Tender ID	Estimated cost in Lakh Rs.	EMD Rs.	Tender Fee in Rs.	Class of Registration
1	Operation, Maintenance and repairing and regular Water Supply work for NCD-4 Group-8, Project for 24 Month Tal-Dhrangadhra Dasada & Lakhtar Dist. Surendranagar as per tender.	260848	77.82	77826/-	2400	"D" Class & Above

Tender documents can be seen, down loaded and submitted on website <http://www.nprocure.com>. The last date of submission of tender is **01.06.2017**, Up to 18.00 Hours. The Physical document must be submitted by R.P.A.D. within (7) days of last for submission of tender without fail. Next Amendment should be uploaded on this website interested agencies will have to see the same and it should be bounded concerns. Any additional information of the tender will be available at above mentioned office all right reserved to reject any or all tenders without assigning any reasons therefor.

Executive Engineer

મહિતી/સુરેન્દ્રનાગર/૮૬/૧૭-૧૮

પથરીની સારવાર
ઓપરેશન વગર

લીઝોટ્રીપ્સી દ્વારા
સમગ્ર ગુજરાતમાં સૌથી સોછા દરે
પારંગત-પારદર્શક-વિશ્વસનીય સારવાર

પરિમલ હોસ્પિટલ (Estd.-1982)
પુનીતમર્ગ, ઝઘડીયા ડિગ્રા પાર્ક, મહિનગર, સમઘવાડા-૮.
Ph: 84600 65008, 98240 19394

JINDAL WORLDWIDE LIMITED
Regd. Office: "Jindal House", Opp. D-Mart, I.O.C. Petrol Pump Lane, Shivranjan, Shivranjan, 132 P Ring Road, Satellite, Ahmedabad, Gujarat 380015
CIN: L17110GJ1986PLC008942 Ph: 079-71901500 Website: www.jindalworldwide.com

NOTICE
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the 2nd Meeting of the Board of Directors of the Company will be held on **Monday, 29th May, 2017 at 4.30 P.M.** at the Registered Office of the Company inter-alia, to consider and approve the Audited Financial Statements (both Standalone & Consolidated) alongwith the Auditors' Report thereon of the Company for the quarter and Financial Year ended on 31st March 2017 and to consider and recommend the final dividend, if any. The said information is available on the website of the Company (www.jindalworldwide.com), BSE Limited (www.bseindia.com) and NSE Limited (www.nseindia.com).
By order of the Board of Directors
Sd/- (Dr. Yamnashree Agrawal)
Chairman & Director (DIN: 00242192)
Date : 22nd May, 2017
Place : Ahmedabad

Disclaimer
Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

CHANGE OF NAME
I have changed my old name from **ARZUBANU MOHAMEDAMIN MEMON** to New Name **AARZOOBANU MOHAMEDAMIN MEMON**
Add. : 693, Gani Chhipa Chawal, Shah-E-Alam Ahmedabad
5113

CHANGE OF NAME
I have changed my old name from **IRSHADBHAI AHMEDBHAI SHEKH** to New Name **MOHAMMAD IRSHAD AHMEDBHAI**
Add. : 276/9, Shaheri Garib Awas Yojna Quarters, Vatva, Ahmedabad-382440
5112

CHANGE OF NAME
I have changed my old name from **NIMITKUMAR MANHARLAL GANDHI** to New Name **NIMITBHAI MANHARLAL GANDHI**
Add. : RAJVI, 17- SHARDA SOCIETY, JINTAN EROAD, VADHWAN
M059

CHANGE OF NAME
I have changed my old name from **PATEL RAJIBAHEN P**



સૌરાષ્ટ્ર

કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ જિલ્લાના સમાચારો

પોરબંદરના યુવાનને કમર બેલ્ટ રૂ. ચાર હજારનો પડ્યો !

ઓનલાઇન છેલરપિડીનો ભોગ બનતા પોલીસ ફરિયાદ

પોરબંદર, મળશે. જે છોડાવાનું રહેશે અને તેના માટે તમારે બેંકમાં કોઈ રૂપિયા ભરવાના રહેશે નહીં. પોસ્ટ ઓફિસમાં પાસવલ મળે ત્યારે જ રૂપિયા ભરવાના રહેશે. આથી ભાવેશ ઉઠાવવાનું પોસ્ટ ઓફિસમાં જઈને પાસવલ માટેની ડીપોઝિટ રકમ ભરી હતી અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. પાસવલ મળ્યું ત્યારે આ મોબાઈલ નંબરની પસંદગી કરવામાં આવી છે. તમને ૧૬૦૦૦ રૂપિયાનો સેમસંગ જે સેવન પ્રાઈમ મોબાઈલ માત્ર ૪૦૦૦ રૂપિયામાં આવશે તેનું પાસવલ તમને પોસ્ટ ઓફિસમાંથી મળશે.

માળિયા મિયાણાના નાનાં રણમાં માટે જમીન ફાળવતાં માછીમારોની માઠી બેઠી

માછીમારોએ વિરોધ નોંધાવવું આવેલન પત્ર કલેક્ટરને આખું : કેટલાક ઉદ્યોગપતિઓએ જાજસરની જમીન મીઠા માટે માગી લેતાં માછીમારોનો રોજીરોટી છીનવાઈ છે તેમાં માછલી સારી એવી મળી રહે છે. અને તેના આધારે કચ્છના રણમાં જૂંપડા બાંધીને રહેતા માછીમારોનું ગુજરાન ચાલે છે. જો હવે આ પાછીમાં અગર બનાવી દેવાય તો માછીમારો હેરાન થઈ જાય અને ન છૂટકે માછીમારી સુકીને મીઠાના અગરમાં કામ કરવાનો વારો આવે. દરમિયાન કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આ વિસ્તારમાં મીઠાના અગર બનાવવા હિલચાલ કરવામાં આવી રહી છે. અને જો મીઠાના અગર બનશે તો માછીમારી થઈ શકશે નહીં. આ વિસ્તારના માછીમારોએ કલેક્ટરને આવેલન આપીને કચ્છના નાના રણમાં મીઠાના અગર બનાવવા સામે વિરોધ નોંધાવતું આવેલન પત્ર પાઠવ્યું છે.

મોરબી પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ વિરૂદ્ધ કોંગ્રેસી સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

મોરબી, કાયમી વિવાદમાં રહેતી મોરબી નગરપાલીકા કુલ ૧૩ બેઠીના પર સદસ્યો પૈકી કોંગ્રેસના ૨૨ સભ્યે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. પાલિકાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને પર પૈકી ૩૨ બેઠીઓ મળી હતી અને ભાજપના હાથમાંથી સત્તા છીનવી લીધી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના આંતરિક જૂથવાદને લીધે વિવાદના બીજા રોપાયા હતા. કોંગ્રેસના જ ૧૨ સભ્યોએ પક્ષથી અલગ થઈ વિકાસ કમિટીની રચના કરી હતી. જેમાં મોરબી નગરપાલીકા કુલ ૧૩ બેઠીના પર સદસ્યો પૈકી કોંગ્રેસના ૨૨ સભ્યે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. પાલિકાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને પર પૈકી ૩૨ બેઠીઓ મળી હતી અને ભાજપના હાથમાંથી સત્તા છીનવી લીધી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના આંતરિક જૂથવાદને લીધે વિવાદના બીજા રોપાયા હતા. કોંગ્રેસના જ ૧૨ સભ્યોએ પક્ષથી અલગ થઈ વિકાસ કમિટીની રચના કરી હતી. જેમાં

હવે પ્રમુખને ફરિયાદ બોર્ડ બોલાવવું પડશે : ૩૩ ટકા સભ્યોનો ટેકો નહીં મળે તો ભણેનું રાજકીય ભવિષ્ય અદ્યરતાલ

બસ સુવિધાના અભાવે બાળાઓ અભ્યાસ છોડવા મજબૂર

ગુજરાત સરકાર શહેરોની સાથે ગામડાના વિકાસની મોટી-મોટી વાતો કરે છે. પરંતુ કોડીનાર તાલુકાના કેટલાક ગામડાઓમાં આગામી આઠવા વર્ષો બાદ પણ બસની સુવિધા મળતી નથી. “સબકા સાથ સબકા વિકાસ”ના નારા હેઠળના ભાજપ સરકાર કોડીનાર તાલુકાના નાની ફાંફણી, મોટી ફાંફણી, જમનવાડા, રાજપરા વિગેરે ગામોમાં આજની તારીખે પણ તાલુકા મથકે પહોંચવા માટે બસની સુવિધા ઉપલબ્ધ નથી. નાની-મોટી ફાંફણીના અનેક બાળકો બસ સુવિધાના અભાવે પોતાનો અભ્યાસ પડતો મુકી રહ્યા છે. જેમાં પણ ખાસ દીકરીઓ ભણવાને બદલે ઘર કામ, ખેતી કામ તેમજ મજૂરીમાં જોતરાઈ જાય છે. ત્યારે “બેટી બચાવો બેટી પઢાવો” સૂત્રને સાર્થક કરવા માટે નાની-મોટી ફાંફણી ગામને દિવસ દરમિયાન ત્રણ બસો ફાળવવી જરૂરી છે. આ બસો ખાસ શાળામાં ભણતા બાળકોના અનુકૂળ સમય એટલે કે સવારે ૬.૩૦ બપોરે ૧૨.૩૦ અને સાંજે ૬.૦૦ કલાકે દોડાવવી જોઈએ. તેવી માંગ શાસ્ત્રિકો કરી રહ્યા છે તેમજ જો ઉપર મજબૂતી સુવિધા નહીં આપવામાં આવે તો વધુ ૩૫ દીકરીઓને અભ્યાસ છોડવાની ફરજ પડશે. ત્યારે આ ગંભીર મુદ્દે સરકારે ધ્યાન આપવું આવશ્યક બન્યું છે.

જામનગરમાં ટ્રાફિક નિયમનના ઉલાળિયાથી ઠેરઠેર થતા જામ

જામનગરમાં જાહેર ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક નિયમનોની એસી તેસી થતી હોય તેવી પરિસ્થિતિ અનેક બાબતોમાં પ્રવર્તે છે. એ માટે પુલ ટ્રાફિક પોલીસની બામોશી અને અમલવારીમાં બેરદસ્તી નિમિત્ત બની રહી છે. આમાં ઠેર-ઠેર છોડે ચોક-બેરોડકોટ થતા વન-વે ભંગની બાબત પણ સંકળાયેલી છે આ સ્થિતિ અનેક વાહન વખત સરકારી- અર્થ સરકારી વાહનો અને જામની બની છે. વન-વે ના જાહેરનામા અને ટ્રાફિક નિયમનના ઉલાળિયાના કારણે વાહન ચાલકો અકબાઈ ઉઠે છે અનેક ઠેકાણે આડેધક અવર-જવરથી ટ્રાફિકજામના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. શહેરના મોટાભાગના માર્ગો કે ટ્રાફિક આઈલેન્ડ આ સ્થિતિમાંથી બાકાત નથી. જેમાં ઘણી વખત સરકારી- અર્થ સરકારી વાહનો પણ વન-વે ભંગ કરીને હંકારી જવાય છે. રોંગ સાઈડમાં પાર્કિંગ પણ થાય છે. આ સ્થિતિના કારણે નિયમ મુજબ અને વન-વે ના જાહેરનામા મુજબ જ જે વાહન ચાલકોને ભારે માનસીક તાસ અનુભવવો પડે છે. વન-વે ભંગના કારણે

ટ્રાફિક પોલીસની બામોશીથી અકબાઈ તમામ પ્રકારના વાહન ચાલકો : કિમતી ઈંધણ અને સમયની ભરબાદી

કાંગશિયાળી પાસેથી ૭.૮૦ લાખનો દારૂ ભરેલો મિનિટ્રક ઝડપાયો

રાજકોટ, રાજકોટ શાપર વેરાવળ પોલીસ મથકની હદમાં આવતા કાંગશિયાળી-લોહરાના રસ્તેથી દારૂ ભરેલો મિનિટ્રક પસાર થવાનો હવાની રાજકોટ આર.આર.સેવના પોલીસમેન શીવાજીભાઈ ખાચરને મળેલી બાતમીના આધારે ફોજદાર કુશાલ પટેલ, વિરમભાઈ કલોતરા, સંદીપસિંહ રાઠોડ સહીત રા.૭.૮૦ લાખનો દારૂ મળી આવતા ટ્રક સહીત રૂ. ૧૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ટ્રકવાળા અને જંગલેશ્વરનો બંસીર નામના શખસો નાસી છુટ્યા હતા. પોલીસે હાથધરેલી તપાસમાં બંસીર કુખ્યાત બુટલેગર ફીરોડ સંધીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. બંસીર નામનો શખ્સ પડકાર્યા બાદ જંગી દારૂનો જથ્થો મંગાવવા અને સંચાલન કરનાર કોણ-કોણ છે તે સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાચીન સ્મારકોમાં જરૂરી બાંધકામ કરવા આડેના અંતરાયો આખરે દૂર

જૂનાગઢ, ઐતિહાસિક ધરોહર સમા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી અંગે જૂનવાણી કાયદાને કારણે મોટાભાગે ખંડેર જેવા બની ગયા છે. ત્યારે સરકારે કાયદામાં સુધારો કરી નવનિર્માણ અને બાંધકામ માટે મંજૂરીના દારૂ પોલ્યા છે. પુરાતત્વીય વિભાગ હસ્તકના સ્મારકોની અંદર નવનિર્માણ થઈ શકતું નહોતું. આ માટે જૂનવાણી કાયદાને કારણે કેન્દ્ર સરકાર મંજૂરી આપતી નહોતી. પણરિશામે આવા પ્રાચીન સ્મારકો જજીટીલ બન્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળએ પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષો (સુધારણા) ખરડો ૨૦૧૭ને સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. આમાં મંજૂરી આપી છે. તેથી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર કામો અને પ્રોજેક્ટ માટે આવશ્યક કામગીરી પૂરતા મર્યાદિત નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો છે. પુરાતત્વીય કાયદાના નવા સુધારામાં કલમ-૨૨માં જાહેર કાર્યોની નવી વ્યાખ્યા આપવામાં આવી છે. અને કાયદાની કલમ-૨૦-એમાં સુધારો કરવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગ કે ઓફિસને કેન્દ્ર સરકારની મંજૂરી મળશે. આ અંગે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષોના કાયદા ૧૯૫૮ (વર્ષ ૨૦૧૦માં સુધારા મુજબ) કેન્દ્ર સરકાર દ્વારા સંશ્લિષ્ટ કરીને સ્મારક કે સ્થળના પ્રતિબંધિત વિસ્તારની અંદર નવનિર્માણ માટે મંજૂરી આપાતી નહોતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અનેક પુરાતત્વીય સ્મારકો આવેલા છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય પુરાતત્વ હેઠળના છે. જૂના કાયદાને પરિણામે વિકાસ અટકી પડ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કરતા હવે જૂનાગઢમાં આવેલી બોધ ગુફાઓ, ઉપરકોટ, અશોક શિલાલેખ, રાખેંગાર વાવ, મકબરા સહિતના સ્થળોના વિકાસનો માર્ગ ખુલ્લો થયો છે. આ અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી વિકાસ કરી શકાશે.

કાયદામાં સુધારો : નવનિર્માણ માટે મંજૂરી મળશે

જૂનાગઢમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરીમાં પ્રજાજનોની ઉદાસીનતા

જૂનાગઢ મહાનગરમાં જૂની રાંગના બહારના વિસ્તારમાં મોટા પાયે વિકાસ થયો છે. આમાં અંદાજે ૧ લાખ ૮૩ હજાર મિલકતોની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવનાર છે. આ એજન્સીને ૪૮૮૫૭ મિલકતોની માપણી કરાઈ છે. જૂનાગઢ સિટી સર્વે અને લેન્ડ રેકર્ડ કચેરીની દેખરેખ હેઠળ ચાલતી કામગીરીમાં ખામશ્રોળ, ટીબાવાડી અને ભવનાથ વિસ્તારની મિલકત ધારકોને નોટિસ મોકલીને લોકો પાસેથી મિલકતના પુરાવાઓ માંગવામાં આવ્યા છે. ૧.૯૩ લાખ મિલકતોમાંથી ૮૫૭ની માપણી પૂર્ણ આ કામગીરી અંતર્ગત ખામશ્રોળ વિસ્તારની ૬૮૦૦ મિલકતો માટે નોટિસો પાઠવી પરંતુ લોકોની ઉદાસીનતાને કારણે માત્ર ૩૮૦૦ મિલકતોના જ પુરાવા આવ્યા છે. સમય મર્યાદા વીતી ગઈ છે છતાં હજુ ૩૦૦૦ લોકો પુરાવા રજૂ કરી શક્યા નથી. આ અંગે ઈન્ચાર્જ સીટી સર્વે સુપ્રી. ડાબીએ જણાવ્યું કે મિલકત ધારકો પુરાવા રજૂ ન કરે તો આગામી કામગીરી થઈ શકે નહીં. મકાન, ઓફિસ, દુકાન, ખુલ્લા પ્લોટ કે અન્ય કોઈપણ મિલકતધારકોને આવી નોટિસ ન મળી હોય તો સાત દિવસમાં કચેરીનો સંપર્ક કરવો તેમ છતાં

ગીર-સોમનાથ જિલ્લામાં ખેલમહાકુંભ ૨૦૧૬ના વિજેતા ખેલાડીઓ બેગ

ગીર-સોમનાથ, જિલ્લામાં ખેલમહાકુંભ ૨૦૧૬ અંતર્ગત એથલેટિક્સ, જુડો, કબડ્ડી, ખો-ખો, તેમજ વાલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જ અંતર્ગત ૨૦૧૬ અને ૨૦૧૭ નોટિસો અને બહેનોને ખેલો ઈન્ડિયા અંતર્ગત રોકડ પુરસ્કાર આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છેજિં અરમતોના વિજેતા ખેલાડીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાના અં. ૧૪ અને અં. ૧૭ વયજૂથના ભાઈઓ અને બહેનોની એક એકાઉન્ટની વિગત જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી લખ્ય તુલસી સોસાયટી, ગૌશાળાની સામે, હવેલી રોડ, વેરાવળ ખાતે મોકલી આપવી. ખેલાડીની બેંક પાસબુકની એરોક્ષ (શરતભ) કોડ સાથે અથવા ચેક ફરજિયાત જોડવા જીલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવાયું છે.

ભાવનગરમાં ૨૦ કોથળા સરકારી દવાનો જથ્થો રખડતો મળ્યો

ભાવનગર, કેબલ સ્ટેડ પુલ પાસેના વિસ્તારમાં બિન ઉપયોગી દવા ફેંકી દેવાના બનાવો વધી રહ્યા છે વધુ એક ઘટના આજે સામે આવી છે. નિર્જેર ખાર વિસ્તારમાં દવાનો મસમોટો જથ્થો પડ્યો હોવાની જાણ સ્થાનિક અગ્રણી ભાવુદાસ સુડાસનાએ મહાપાલિકાના સુડાસના વેસ્ટ વિભાગને કરતા કાફલો દોડી ગયો હતો. મ્યુ. અધિકારીઓએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં આ તમામ દવાનો જથ્થો ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત-નોટ ફોર સેલ’ લખાયેલું જોવા મળ્યું હતું. પરથી ૨૦ કોથળા ભરીને દવાનો જથ્થો હાથ લાગ્યો છે તેમણે ઉમેર્યું હતું કે, નવાઈની વાત એ છે કે ફેંકી દેવાયેલ આ તમામ દવા હજુ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. એટલે કે એક્સપાયર થઈ નથી ! આમ સરકારી દવાખાનાઓમાં કાળવાણી આ દવાનો મોટો જથ્થો કોણ ફેંકી ગયું તે મોટો પ્રશ્ન છે. આ જથ્થામાં ગભવની મહિલાઓ માટેની ટેબલેટ, ટયુબ, સીરિસ અને સીડીઝ વિગેરેનો સમાવેશ થાય છે. મ્યુનિ. અધિકારીએ સર તખ્તસિંહજી હોસ્પિટલ, જીપીસીબી સહિતના તંત્રને આ દવાના જથ્થા અંગે જાણકારી હતી જે કે કોઈએ રસ નહીં દાખવતા અને આ દવાની તારીખ વિતી ગઈ હોય તેનો નાશ નહી કરી આ દવાનો જથ્થો સાચવીને સંગ્રહ કરવામાં આવ્યો છે.

www.westerntimes.co.in
વેસ્ટર્ન ટાઇમ્સ ગ્રુપ ઓફ પબ્લીકેશન્સના અંગ્રેજી દૈનિક અને ગુજરાતી દૈનિક આવૃત્તિઓ હવે ઈન્ટરનેટ પર કોઈપણ વ્યક્તિને વિશ્વમાં કોઈપણ સ્થળે ઉપલબ્ધ છે.
gujarati@westerntimes.co.in

પોરબંદરમાં રમેશભાઈ ઓઝાના હસ્તે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

પોરબંદર, પોરબંદરમાં સંત રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે. ઉદ્દેશનીય છે કે રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્તુત ગુરુપૂજિમાની પૂર્વસંધ્યાએ સૌરાષ્ટ્ર કચ્છના ૧૧ જિલ્લાઓ પૈકી દરેક જિલ્લામાંથી ત્રણ પ્રાથમિક, ત્રણ માધ્યમિક અને એક આચાર્યને તેની શૈક્ષણિક ફરજ ઉપરાંત નિષ્ઠા અને શિક્ષણના મૂલ્યોને જાળવીને વિદ્યાર્થીને પોતાના સંતાનોની જેમ પ્રેમ અને લાગણી સાથે શિક્ષણ કરાવતા શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. પસંદગી સમિતિ દ્વારા પસંદ થનારા શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યનું ભાઈશ્રીના હસ્તે ગુરુપૂજિમાની પૂર્વ સંધ્યાએ ગુરુપૂજન કરવામાં આવશે. પોરબંદર જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક શિક્ષકો અને આચાર્યને ભાવપૂર્ણ માટે તેઓની ફરજ ઉપરાંત શિક્ષણ જગતમાં ઈતર પ્રવૃત્તિઓ, ગણિત, વિજ્ઞાન-ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલાં કાર્યોની વિગત અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા યોજાવા પ્રકલ્પો સાથેની વિશેષ માહિતી મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટીમાં મુસાફરોને સખ

ગોંડલ, ઉભી રહેતી હોવાથી અમદાવાદ જતા મુસાફરોને ૫૬-ઉત્તર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ બધા સ્ટેશનો પર ટ્રેનનું રોકાણ કમસેકમ સ્ટેશને માત્ર એક જ મિનિટનો સ્ટોપ અપાયો છે. જ યા ૨ ભકિતનગર સ્ટેશને અડધો-અડધો કલાક ગોંધી રાખવામાં આવતી હોય અમદાવાદ જતા યાત્રિકોની મુસાફરી કંટાળાજનક અને યાતનામય બની જાય છે. આ સમસ્યા નિવારવા ભાવનગર-રાજકોટના ડી.આર.એમ. આગળ આવે તેવી રેલ યાત્રિકોની માગણી છે. સોમનાથ-વેરાવળ-અમદાવાદ ટ્રેન વેરાવળથી લઈ ગોંડલ સુધીના સ્ટેશનોએ ફક્ત એક-બે મિનિટ જ

ગામે ગામના સમાચાર

ભાવનગરમાં છાત્રોને વિનામૂલ્યે કુલસ્કેપ ચોપડાનું વિતરણ ભાવનગર : મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ગુલાબભારતી બાપુના આશીર્વાદથી તથા શ્રી સદગુણસ્થોના સહયોગથી જરૂરિયાતમંદ કુટુંબો માટે સ્વામી વિવેકાનંદજીના ૧૫મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે તો.૯ થી ૧૨ તથા કોલેજ સુધીના ૬૦ ટકા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦,૦૦૦ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ તા.૨૨-૨૫થી દરરોજ સવારે ૧૦ થી ૧૨ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ.આઈ.જી. ૨૧૬, મંગળાપા સરસંગ હોલ, સોમનાથ મંદિર પાસે, આનંદનગર ભાવનગર ખાતે વિતરણ થશે.

માળિયાહાટીનામાં લોહાણા જ્ઞાતિનું વાલી સંમેલન

માળિયાહાટીના : અનેની લોહાણા મહાજાન વાડીમાં તા.૧૧.૬ને રવિવારે બપોરે ૧ થી ૫માં પ્રથમ જ વાર લોહાણા સમગ્રણ માહિતી કેન્દ્ર- પોરબંદર દ્વારા ૨૧મું વાલી સંમેલન યોજાશે.

ખંભાળિયા : સ્વદુર્ગશી માતા-પુત્રી રસોઈ શોમાં ચમકશે

ખંભાળિયા : ખંભાળિયાના લેડી એલ.આઈ.સી.એન્જ-ટ શ્રીમતી દિયાબેન દિનેશભાઈ પટેલ તથા તેમની સુપુત્રી કું. હેલી પોપટ જાણીતી ગુજરાતી ચેનલ કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતા “ફલેવર્સ ઓફ ગુજરાત”ના રસોઈ શોમાં મંગળવાર તા.૨૩મીના રોજ જોઈ સાડા છાત્ર સાત વાગ્યા સુધી આવશે. કાર્યક્રમનું પીપીટ ટેલીકાસ્ટ બુધવાર તા.૨૪મીના રોજ બપોરે દોઢીથી વાગ્યા સુધી પ્રસારિત થશે.

ઉપલેટામાં આંશ દિવસ યોગ શિબિર

ઉપલેટા : અહીંના બાપુના બાવલા ચોકમાં આવેલ ભગવતસિંહજી કન્યા શાળા ખાતે તા.૨૨ થી ૨૮ મે શાંતિકુંજ આશ્રમ હરિદાર દ્વારા આયોજિત યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે જેમાં સવારે ૫.૩૦ થી ૭ તથા સાંજે ૬ થી ૭ એક સપ્તાહ સુધી વિવિધ આસના, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા વગેરેનું પ્રેક્ટીકલ તથા થિયરીકલ જ્ઞાન અપાશે.

૨૪મીએ મોહન ખખે-ગાભાબાપુનો ઉર્સ ઉજવાશે

ગઢડા (સ્વામી), તા.૨૦.૫.૨૦૧૭ને બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના જાણીતા અને “મોબત ખખે” (સૌ સાથે પ્રેમ ભાવ)નો સંદેશ આપનાર મસ્ત ઓળિયા કંકિર ગાભાબાપુનો ઉર્સ બીજે મુબારક શાનો શોકનથી ઉજવવામાં આવશે. મંગળવારે રાતે ૮મીથી ૨૫મી સુધી આશ્રમ હરિદાર દ્વારા આયોજિત યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે જેમાં સવારે ૫.૩૦ થી ૭ તથા સાંજે ૬ થી ૭ એક સપ્તાહ સુધી વિવિધ આસના, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા વગેરેનું પ્રેક્ટીકલ તથા થિયરીકલ જ્ઞાન અપાશે.

ઉના : સગીરાને ભગાડી ગયાના બે બનાવ

ઉના : ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલા ડુકાને વિસ્તારમાં રહેતી સગીરાને અહીંની સુગર ફેક્ટરી પાછળ ખોડિયારનગરમાં રહેતો શૈલેષ ઉર્ફે લાલો રમેશભાઈ વાજા (ઉ.૨૨) ગત તા. ૧૨ના રોજ સગીરાના ઘરે આવી, બેઠકામ કરવાના ઈરાદે, લલચાઈ ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ પોલીસ ફક્ટરે સગીરાની માતાએ નોંધાવી છે.

JOLLY PLASTIC INDUSTRIES LIMITED

Regd. Off. : 407, Sudarshan Commercial Complex, Limda Chowk, Rajkot-360001 (Gujarat)
CIN NO: L70100GJ1981PLC004932, EMAIL: jollyplasticindltd@gmail.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/ YEAR ENDED 31ST MARCH, 2017

S. No.	Particulars	Standalone			
		Quarter Ended Mar'17 (Audited)	Quarter Ended Mar'16 (Audited)	Year Ended Mar'17 (Audited)	Year Ended Mar'16 (Audited)
1	Total Income from Operations (Net)	12.05	20.29	25.05	25.19
2	Net Profit / (Loss) from ordinary activities after tax	0.67	1.98	2.95	0.22
3	Net Profit / (Loss) for the period after tax (after extraordinary items)	0.67	1.98	2.95	0.22
4	Paid-up equity share capital (Face Value of Rs. 10/- each)	667.64	667.64	667.64	667.64
5	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year*)	16.10	13.16	16.10	13.16
6	Earnings Per Share (EPS) (before extraordinary items) (Face Value of Rs. 10/- each)	0.0001	0.0034	0.040	0.003
a	Basic	0.0001	0.0034	0.040	0.003
b	Diluted	0.0001	0.0034	0.040	0.003

Note:
The above is an extract of the detailed format of the financial results for the Quarter / Year ended 31st March, 2017 filed with the Stock Exchanges. The full format of the financial results for the Quarter / Year ended 31st March, 2017 is available on the website of the Stock Exchange www.bseindia.com and on Company's website www.jollyplasticindltd.com
Place: Gujarat
Date: 30th May, 2017
For Jolly Plastic Industries Ltd
SD/-
Director

TYPHOON FINANCIAL SERVICES LIMITED

[CIN: L65923GJ1990PLC014790]
Regd. Off. : 35, Omkar House, Near Swastik Cross Roads, C.G. Road, Ahmedabad 380 009. Tel: (079) 2644 9515 Email: info@typhoonfinancial.com; info@gujaratcraft.com Website: www.typhoonfinancial.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED ON 31ST MARCH, 2017

PARTICULARS	(Rs. In Lakhs)		
	Quarter ended on 31-03-2017 (Unaudited)	Year ended on 31-03-2017 (Audited)	Quarter ended on 31-03-2016 (Unaudited)
Total income from operations (Net)	2.50	12.52	2.76
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.81	2.63	0.62
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.81	2.63	0.62
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.59	1.90	0.61
Equity Share Capital	300.06	300.06	300.06
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	10.72 (as on 31-03-2017)	8.82 (as on 31-03-2016)	8.82
Earnings Per Share (before extraordinary items) (Face value of Rs.10/- each) Basic & Diluted (in Rs.):	0.02	0.06	0.02
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs.10/- each) Basic & Diluted (in Rs.):	0.02	0.06	0.02

NOTES:
1 The above is an extract of the detailed format of Annual / Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Annual / Quarterly Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com.

For TYPHOON FINANCIAL SERVICES LIMITED
ASHOK CHHAJER
MANGING DIRECTOR
Date : 30th May, 2017
Place : Ahmedabad

AMRAPALI INDUSTRIES LTD

CIN: L9110GJ1988PLC010674
Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009
Phone: +91-79-26581329/30, +91-79-26575105/06 Fax: +91-79-26579169/26584313
Email: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2017

PARTICULARS	(Amt. In Lacs except per share value)		
	Quarter Ended 31.03.2017	Year to date 31.03.2017	Quarter Ended 31.03.2016
Date of start of reporting quarter	01.01.2017	01.04.2016	01.01.2016
Date of end of reporting quarter	31.03.2017	31.03.2017	31.03.2016
Whether results are audited or unaudited	Audited	Audited	Audited
Nature of report standalone or consolidated	Standalone	Standalone	Standalone
Total income from operations (net)	1,52,758.83	4,93,487.87	52,206.37
Net Profit / (Loss) from ordinary activities after tax	330.94	164.36	375.28
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	330.94	164.36	375.28
Equity Share Capital	2,570.53	2,570.53	2,570.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-
Earnings Per Share before extraordinary items (of Rs 5/- each) - Not Annualised			
Basic :	1.29	0.32	0.73
Diluted:	1.29	0.32	0.73
Earnings Per Share after extraordinary items (of Rs 5/- each) - Not Annualised			
Basic :	1.29	0.32	0.73
Diluted:	1.29	0.32	0.73

Note:
Note: The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on May 30, 2017.
The Company has only one segment of activity.
The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the Bombay Stock Exchange (BSE Ltd.) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Bombay Stock Exchange Website at www.bseindia.com.

By and on behalf of Board of Directors
AMRAPALI INDUSTRIES LTD.
YASHWANT THAKKAR
(Managing Director)
DIN - 00071126
Date : May 30, 2017
Place : Ahmedabad.

JINDAL WORLDWIDE LIMITED

Regd. Off. "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • CIN: L17110GJ1986PLC008942 • Ph: 079-71001500 • Website: www.jindaltextiles.com
Statement of Standalone & Consolidated Audited Financial Results for the Quarter and Financial Year Ended 31st March, 2017 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. In Lakhs)

S.No.	Particulars	Quarter Ended (Standalone)		Year Ended (Standalone)		Year Ended (Consolidated)	
		3 months ended	Corr. 3 months ended in P.Y.	Year to date figures for C.Y. ended	Year to date figures for P.Y. ended	Year to date figures for C.Y. ended	Year to date figures for P.Y. ended
		31/03/2017 (Audited)	31/03/2016 (Audited)	31/03/2017 (Audited)	31/03/2016 (Audited)	31/03/2017 (Audited)	31/03/2016 (Audited)
1	Total income from operations (net)	36961.40	29069.05	115785.26	100905.59	115785.26	100905.59
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	3142.42	1450.07	8099.92	5438.62	8100.92	5438.73
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3142.42	1450.07	8099.92	5072.43	8100.92	5072.54
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	2396.95	1161.33	6656.16	4027.27	6656.86	4027.31
5	Total Comprehensive income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2396.95	1161.33	6656.16	4027.27	6658.35	4028.67
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year	0.00	0.00	0.00	0.00	0.00	0.00
8	Earnings per share (of Re. 10/- each) (for continuing and discontinued operations)						
1. Basic :		11.95	5.79	33.19	20.08	33.21	20.08
2. Diluted :		11.95	5.79	33.19	20.08	33.21	20.08

Notes: (1) The above is an extract of the detailed format of Annual Audited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company.
For Jindal Worldwide Limited
Sd/- (Dr. Yamunadutt Agrawal)
Chairman / Director : DIN: 00243192
Date : 29th May, 2017
Place: Ahmedabad

Vision keeps developing until mid-life

Toronto, Challenging current belief that our vision matures in the first few years of life, researchers have found that the visual cortex, the human brain's vision-processing centre, actually continues to develop until some time in the late 30s or early 40s.

For the study, researchers examined post-mortem brain-tissue samples from 30 people ranging in age from 20 days to 80 years.

The visual cortex of the brain reaches maturity until about age 36, plus or minus 4.5 years, showed the findings published in the Journal of Neuroscience. The finding was a surprise to the researchers, who had expected to find that the cortex reached its mature stage by 5 to 6 years, consistent with previous results from animal

samples and with prevailing scientific and medical belief.

"There's a big gap in our understanding of how our brains function," said lead researcher Kathryn Murphy, Professor at McMaster University in Hamilton, Ontario, Canada.

"Our idea of sensory areas developing in childhood and then being static is part of the challenge. It's not correct," Murphy said.

Treatment for conditions such as amblyopia or "lazy eye", for example, have been based on the idea that only children could benefit from corrective therapies, since it was thought that treating young adults would be pointless because they had passed the age when their brains could respond, Murphy said.

Though the research is isolated to the visual cortex, it suggests that other areas of the brain may also be much more plastic for much longer than previously thought.

ISRO and Amul entered in MOU for fodder acreage estimation using space technology

Anand, Ahmedabad together took a forward step for the benefit of dairy farmers by signing a Memorandum of Understanding for "Fodder acreage assessment using satellite observation and space technology". The main objective of this MOU is identification/discrimination between food crops & fodder crops at village level and identifying suitable areas of current fallows & cultivable wastelands at village level for green fodder cultivation. This is for first time in the world where Space research Organization and dairy cooperatives are together using satellite technology for fodder acreage estimation. Amul is procuring around 150 lakh litres of milk daily from around 35 lakh milk producer members from more than 18500 villages under Amul Model.

The milk producer farmers of Gujarat will get benefit of fodder cultivation

by using this technology. AMUL believes that the development and growth of dairy animals are highly associated with the scope of availability of fodder from cultivable land, forest, pastures and grazing lands which are crucial input for enhancing milk production and also for survival of the bovine population. Amul has distinguished the importance of the fodder crop estimation and Space Application centre (SAC, ISRO), Ahmedabad has developed space based remote sensing for fodder crop assessment using satellite observation and space technology. Amul and SAC, ISRO have jointly carried out pilot and found that it is feasible to assess green fodder availability for dairy livestock at district and village level through remote sensing. Fodder acreage estimation would act as a decision making tool for monitoring and planning of fodder development activities by all the stakeholders in the dairy sector.

Man strangulates victim with leather belt, arrested

New Delhi, One person has been arrested for strangulating a man to death with his belt to take revenge, police said on Monday.

The accused has been identified as Pradeep, 32, of Delhi and the belt with which he strangled Marshal, 24, has been recovered, police said.

The motive for the murder was to take revenge as his wife once had run away with Marshal's brother, police said. "The accused has accepted of committing the

crime during interrogation and also disclosed that his brother helped him in the murder," said Deputy Commissioner of Police, Surender Kumar. According to police, Pradeep with the help of his brother Deepak strangled Marshal in a car and later dumped the body in a street in sector 16B of Dwarka in west Delhi. Police has recovered the Swift car used in the crime, clothes Pradeep was wearing at the time of murder and the leather belt used to strangle Marshal.

West Bengal likely to receive heavy rainfall

Kolkata, The coastal districts in West Bengal might receive heavy rainfall along with strong winds for the next 24 hours due to the presence of cyclonic storm 'Mora' in the Bay of Bengal, the Met office said on Monday. The storm, presently situated approximately 500 km southeast of West Bengal coastline and around 330 km southwest of Chittagong in Bangladesh, is expected to hit the neighbouring country by Tuesday afternoon, a weather official said. "Some coastal districts of West Bengal including North 24 Parganas, South 24 Parganas and Nadia would see heavy rainfall as the storm passes by.

GUJCHEM DISTILLERS INDIA LIMITED
Regd office: Office No. 6, 2nd Floor, National Chambers, Near City Gold, Ashram Road, Ahmedabad - 380 009.
CIN : L24230GJ1939PLC002480 website : www.gujchemdistillers.com email : gujchemdistillers@gmail.com Tel : 079-26580893

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2017 (Rs. In Lakhs)

Particulars	For the Quarter Ended		For the Year ended	
	31-03-2017	31-03-2016	31-03-2017	31-03-2016
Total income from operations (net)	-	-	-	-
Net Profit / (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items#)	(25.82)	(17.19)	(45.14)	(41.16)
Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extra ordinary items#)	(25.82)	(25.19)	(45.14)	205.31
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items#)	(26.52)	(36.19)	(46.38)	194.31
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10.23	10.44	35.37	29.81
Equity Share Capital	16.34	16.34	16.34	16.34
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year)	-	-	459.34	505.71
Earnings Per Share (of Rs. 10/- each)				
(a) Basic	(16.38)	(22.36)	(28.65)	120.03
(b) Diluted	(16.38)	(22.36)	(28.65)	120.03

* Reserves excluding Revaluation Reserve as shown in the balance sheet of previous year.

Notes: 1. The above is an extract of the detailed format of Quarter / Year end Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter / Year end Financial Results are available on the Stock Exchange websites i.e www.bseindia.com and on the website of the Company i.e www.gujchemdistillers.com.
2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30th May, 2017.
For Gujchem Distillers India Limited
Hem Manish
Managing Director
(DIN 01428688)
Date: 30th May, 2017
Place: Ahmedabad

SAANVI ADVISORS LIMITED

Regd. Off. : 112, F.F.S. NO. 318/7/1, M.V. House, Opp. Hajipura Garden, Shahibaug Road, Shahibaug, Ahmedabad-380004, Ph.No. : 079-25620456
Email:saptharishifin@gmail.com, Website:www.saptharishi.in CIN:L74140GJ1981PLC084205

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2017 (in Rs.)

PARTICULARS	Quarter ended on 31/03/2017 (Audited)	Year ended on 31/03/2017 (Audited)	Corresponding 3 months ended in the Prev. year 31/03/2016 (Audited)
Income from Operation (net)	90,000.00	6,50,000.00	2,20,750.00
Other Income	1,54,592.75	15,18,743.00	0.00
Total income from operations (net)	2,44,592.75	21,73,743.00	2,20,750.00
Net Profit/(Loss) from ordinary activities after tax	-4,60,209.26	6,86,278.00	1,91,326.00
Net Profit/(Loss) for the period after tax (after extraordinary items)	-4,60,209.26	6,86,278.00	1,91,326.00
Paid-up equity Share Capital	2,01,05,000	2,01,05,000	1,85,05,000
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	Nil	-2,46,522.00	Nil
Earnings per Share (EPS) for the period (before and after extra ordinary items)(of Rs. 10/- each)			
-Basic	-0.23	0.34	0.10
-Diluted	-0.23	0.16	0.09

Note:-
The above is an extract of the detailed format of Annual Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Annual Financial Results are available on the stock Exchange website-www.mse.in & on company's website-www.saptharishi.in.

For SAANVI ADVISORS LIMITED
Jasmin Majithia
Company Secretary
Place : Ahmedabad.
Date : 30-05-2017

OMKAR INDUSTRIES LIMITED

Regd. Office: 260, New Cloth Market, Out Side Raipur Gate, Raipur, Ahmedabad - 380 002.
Website : www.omkarindustries.co.in, Ph No. : (079) 22120022;
E-Mail ID : naroda@omkargroup.com, CIN : L51909GJ1985PLC007702

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2017 (in Rs Lakh.)

PARTICULARS	Quarter ended on 31/03/2017 (Audited)	Year ended on 31/03/2017 (Audited)	Corresponding 3 months ended in the Prev. year 31/03/2016 (Audited)
Income from Operation (net)	424.14	1467.40	389.24
Other Income	0.00	0.00	0.00
Total income from operations (net)	424.14	1467.40	389.24
Net Profit/(Loss) from ordinary activities after tax	0.49	1.69	0.55
Net Profit/(Loss) for the period after tax (after extraordinary items)	0.49	1.69	0.55
Paid-up equity Share Capital	24.50	24.50	24.50
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	22.33(As on 31-03-2017)	22.33(As on 31-03-2017)	19.21 (As on 31-03-2016)
Earnings per Share (EPS) for the period (before and after extra ordinary items)(of Rs. 10/- each)			
-Basic	0.20	0.69	0.22
-Diluted	0.20	0.69	0.22

Note : The above is an extract of the detailed format of Annual Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Annual Financial Results are available on company's website at www.omkarindustries.co.in

For and on behalf of the board of
OMKAR INDUSTRIES LIMITED
SUBHASHCHANDRA O. AGARWAL
DIRECTOR & CEO
DIN: 00356977
Place : Ahmedabad
Date : 30-05-2017

GUJARAT CONTAINERS LIMITED

Corporate Office : 201-202, B-Wings, Alkapuri Arcade, Opp. Welcome Hotel, R.C Dutt Road, Vadodara
CIN- L28120GJ1992PLC017081 E mail ID- cs@gujaratcontainers.com Ph No. +91 0265 2341265
Reg. Office : Plot No. 488 / 489 , At.& PO. Tundav, Tal. Savli., Dist. Vaddodra.
Website : www.gujaratcontainers.com Email : info@gujaratcontainers.com
Ph. : 0265-2341265, Fax. : 0265-2331965

Extract of Statement of Audited Financial Results for the Quarter and Year ended 31st March'2017 (Rs. in Lakhs except EPS)

Sr. No.	Particular	Quarter Ended 31st March, 2017 Audited	Quarter Ended 31st March, 2016 Audited	Year Ended 31st March, 2017 Audited	Year Ended 31st March, 2016 Audited
1	Total Income from Operations (Excluding Excised Duty)	1387.12	1070.74	4980.29	5044.36
2	Net Profit / (Loss) for the Period (before Tax, Exceptional and/or Extra -ordinary Items	70.06	74.21	347.64	330.05
3	Net Profit / (Loss) for the Period before Tax(after Exceptional and/or Extra -ordinary Items	15.46	1.34	117.89	70.11
4	Net Profit / (Loss) for the Period after Tax(after Exceptional and/or Extra -ordinary Items	15.46	1.34	82.48	51.41
5	Total Comprehensive Income for the Period (Comprehensive profit / (Loss) for the Period after Tax)and other Comprehensive Income (After Tax)	15.46	1.34	82.48	65.31
6	Equity Share Capital	565	565	565	565
7	Reserves (Excluding Revaluation Reserve as shown in Balance Sheet of Previous year)	451.3	368.82	451.3	368.82
8	Earning Per Share (of Rs. 10/-each) (for continuing and Discontinued Operations)				

JOLLY PLASTIC INDUSTRIES LIMITED

Regd. Off. : 407, Sudarshan Commercial Complex, Limda Chowk, Rajkot-360001 (Gujarat)
CIN NO: L70100GJ1981PLC004932, EMAIL: jollyplasticindia@gmail.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/ YEAR ENDED 31ST MARCH, 2017

S. No.	Particulars	Standalone			
		Quarter Ended Mar'17 (Audited)	Quarter Ended Mar'16 (Audited)	Year Ended Mar'17 (Audited)	Year Ended Mar'16 (Audited)
1	Total Income from Operations (Net)	12.05	20.29	25.05	25.19
2	Net Profit / (Loss) from ordinary activities after tax	0.67	1.98	2.95	0.22
3	Net Profit / (Loss) for the period after tax (after extraordinary items)	0.67	1.98	2.95	0.22
4	Paid-up equity share capital (Face Value of Rs. 10/- each)	667.64	667.64	667.64	667.64
5	Reserve (excluding Revaluation Reserve as per balance sheet of previous accounting year)*	16.10	13.16	16.10	13.16
6	Earnings Per Share (EPS) (before extraordinary items) (Face Value of Rs. 10/- each)				
a	Basic	0.0001	0.0034	0.040	0.003
b	Diluted	0.0001	0.0034	0.040	0.003
7	Earnings Per Share (EPS) (after extraordinary items) (Face Value of Rs. 10/- each)				
a	Basic	0.0001	0.0034	0.040	0.003
b	Diluted	0.0001	0.0034	0.040	0.003

Note: The above is an extract of the detailed format of the financial results for the Quarter / Year ended 31st March, 2017 filed with the Stock Exchanges. The full format of the financial results for the Quarter / Year ended 31st March, 2017 is available on the website of the Stock Exchange www.bseindia.com and on Company's website www.jollyplasticindia.com

Place: Gujarat
Date: 30th May, 2017

For Jolly Plastic Industries Ltd
SD/-
Director

TYPHOON FINANCIAL SERVICES LIMITED

[CIN: L65923GJ1990PLC014790]

Regd. Off. : 35, Omkar House, Near Swastik Cross Roads, C.G. Road, Ahmedabad 380 009. Tel: (079) 2644 9515 Email: info@typhoonfinancial.com; info@gujaratcraft.com Website: www.typhoonfinancial.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED ON 31ST MARCH, 2017

PARTICULARS	(Rs. In Lakhs)		
	Quarter ended on 31-03-2017 (Unaudited)	Year ended on 31-03-2017 (Audited)	Quarter ended on 31-03-2016 (Unaudited)
Total income from operations (Net)	2.50	12.52	2.76
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.81	2.63	0.62
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.81	2.63	0.62
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.59	1.90	0.61
Equity Share Capital	300.06	300.06	300.06
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		10.72 (as on 31-03-2017)	8.82 (as on 31-03-2016)
Earnings Per Share (before extraordinary items) (Face value of Rs.10/- each)			
Basic & Diluted (in Rs.):	0.02	0.06	0.02
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs.10/- each)			
Basic & Diluted (in Rs.):	0.02	0.06	0.02

NOTES:
1 The above is an extract of the detailed format of Annual / Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Annual / Quarterly Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com.

For TYPHOON FINANCIAL SERVICES LIMITED
ASHOK CHHAJER
MANGING DIRECTOR

Date : 30th May, 2017
Place : Ahmedabad

AMRAPALI INDUSTRIES LTD

CIN: L91110GJ1988PLC010674
Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009
Phone: +91-79-26581329/30, +91-79-26575105/06 Fax: +91-79-26579169/26584313
Email: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2017

PARTICULARS	(Amt. In Lacs except per share value)		
	Quarter Ended 31.03.2017	Year to date 31.03.2017	Quarter Ended 31.03.2016
Date of start of reporting quarter	01.01.2017	01.04.2016	01.01.2016
Date of end of reporting quarter	31.03.2017	31.03.2017	31.03.2016
Whether results are audited or unaudited	Audited	Audited	Audited
Nature of report standalone or consolidated	Standalone	Standalone	Standalone
Total income from operations (net)	1,52,758.83	4,93,487.87	52,206.37
Net Profit / (Loss) from ordinary activities after tax	330.94	164.36	375.28
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	330.94	164.36	375.28
Equity Share Capital	2,570.53	2,570.53	2,570.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-
Earnings Per Share before extraordinary items (of Rs 5/- each) - Not Annualised			
Basic :	1.29	0.32	0.73
Diluted:	1.29	0.32	0.73
Earnings Per Share after extraordinary items (of Rs 5/- each) - Not Annualised			
Basic :	1.29	0.32	0.73
Diluted:	1.29	0.32	0.73

Note:
Note: The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on May 30, 2017.
The Company has only one segment of activity.

The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the Bombay Stock Exchange (BSE Ltd.) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Bombay Stock Exchange Website at www.bseindia.com.

By and on behalf of Board of Directors
AMRAPALI INDUSTRIES LTD.
YASHWANT THAKKAR
(Managing Director)
DIN - 00071126

Date : May 30, 2017
Place : Ahmedabad.

JINDAL WORLDWIDE LIMITED

Regd. Off: "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • CIN:L1710GJ1986PLC008942 • Ph:079-71001500 • Website: www.jindalworldwide.com

Statement of Standalone & Consolidated Audited Financial Results For the Quarter and Financial Year Ended 31st March, 2017

S.No.	Particulars	(Rs. in Lakhs)					
		Quarter Ended (Standalone)		Year Ended (Standalone)		Year Ended (Consolidated)	
		3 months ended 31/03/2017 (Audited)	Corr. 3 months ended in P.Y. 31/03/2016 (Audited)	Year to date figures for C.Y. ended 31/03/2017 (Audited)	Year to date figures for P.Y. ended 31/03/2016 (Audited)	Year to date figures for C.Y. ended 31/03/2017 (Audited)	Year to date figures for P.Y. ended 31/03/2016 (Audited)
1	Total income from operations (net)	36961.40	29069.05	115785.26	100905.59	115785.26	100905.59
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	3142.42	1450.07	8099.92	5438.62	8100.92	5438.73
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3142.42	1450.07	8099.92	5072.43	8100.92	5072.54
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	2396.95	1161.33	6656.16	4027.27	6656.86	4027.31
5	Total Comprehensive income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2396.95	1161.33	6656.16	4027.27	6658.35	4028.67
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year	0.00	0.00	0.00	0.00	0.00	0.00
8	Earnings per share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)						
	1. Basic :	11.95	5.79	33.19	20.08	33.21	20.08
	2. Diluted :	11.95	5.79	33.19	20.08	33.21	20.08

Notes: (1) The above is an extract of the detailed format of Annual Audited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company.

For Jindal Worldwide Limited
Sd/- (Dr. Yamunadutt Agrawal)
Chairman / Director : DIN: 00243192

Date : 29th May, 2017
Place: Ahmedabad

દયાદરાની સીમમાં થયેલ ચુપકની હત્યાનો ભેદ ઉકેલાયો
પ્રેમિકા તેનો પતિ અને રીક્ષા ચાલક મિત્રની અટકાયત કરી છે.

ભરૂચ તાલુકાના દયાદરા ગામની સીમમાંથી વિલાયતના વેપારીનો હત્યા કરાયેલ મૃતદેહના કિસ્સામાં પોલીસે મૃતકની પ્રેમિકા તેનો પતિ તથા મિત્ર મળી કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.



દયાદરા ગામની સીમમાંથી મૂળ કરજણનો અને દયાદરામાં રહેતા અને દુકાન ચલાવતા જાકીર કુદરનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા તેના ત્રણ મોબાઇલ ટ્રેસીંગ કયાં હતા જેના આધારે મૃતક જાકીરના આડા સબંધ બાકરોલીની ગીતા સાથે હતા. જે દરમ્યાન જાકીરે ગીતા સાથે મળવા ન આવવા બાબતે ઝઘડો થતા પોતાના પતિ સહદેવને વાત કરતા પતિ-પત્ની અને સહદેવનો આકોટમાં રહેતો મિત્ર ધર્મેન્દ્ર સાથે પ્લાન બનાવી જાકીરને દયાદરા ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. જાકીરે આવતા પ્લાન મુજબ ગીતા તેની સાથે વાતાલાપ કરી રહી હતી તે દરમ્યાન સહદેવ અને ધર્મેન્દ્ર કુહાડી અને લોખંડના સળિયા સાથે તૂટી પડી જાકીરને મોતને ઘાટ ઉતારી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. દયાદરાના હત્યાના પ્રકરણમાં પોલીસ તપાસમાં વધુ શુ બહાર આવે છે તે જોવું રહ્યું. ★

ભિલોડામાં ઓવરલોડ રેતી-કપચી ભરેલી બે ટર્બો ટ્રકો મામલતદાર ધ્વારા ઝડપાઈ

ભિલોડા, ભિલોડામાં ઓવરલોડ રેતી-કપચી ભરેલી બે ટર્બો ટ્રકો મામલતદાર જી.કે.પટેલ ધ્વારા ઝડપાઈ છે. બે નંબરનો બની જ ચોરીનો ધંધો કરતા બે નંબરીયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. રોયલ્ટી પાસ પરમીટથી વધુ રેતી-કપચીનો જથ્થો ભરેલો બે ઓવરલોડ ટ્રકોમાંથી ઝડપાતાં કાયદેસરની કાર્યવાહી મામલતદારએ હાથ ધરી છે. ભિલોડા મામલતદાર જી.કે.પટેલએ જણાવ્યું હતું કે હાથમતી પુલ પાસેથી ઓવરલોડ કપચી ભરેલી ટર્બો ટ્રક નંબર.જી.જે.૦૮.એ.વી.૮૦૬૪ના ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ પરમીટ માંગતા પરમીટથી વધુ ઓવરલોડ કપચી ભરેલી ટર્બો ટ્રક માલિક સુરેશભાઈ પટેલ રહેવાસી પીપ્લીકા, તા.હિંમતનગર દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભિલોડા તાલુકાના ભેટાલી ગામ પાસેથી પસાર થતી ટર્બો ટ્રક નંબર.જી.જે.૦૮.એ.વી.૦૦૮૬ ના ડ્રાઈવર પાસે રોયલ્ટીનો પાસ પરમીટ માંગતાં પરમીટથી વધુ ઓવરલોડ રેતી ભરેલી ટર્બો ટ્રક માલિક પ્રભુદાસભાઈ રહેવાસી. નવા વેણપુર દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભિલોડા મામલતદારએ ઓવરલોડ રેતી-કપચી ભરેલી બે ટર્બો ટ્રકો ઝડપી બંને ટર્બો ટ્રકોનું પંચનામું કરી મામલતદાર કચેરી કંપાઉન્ડમાં ટ્રકો મુંકી દેવાતાં રેતી-કપચીનો ધીકતો ધંધો કરતા બે નંબરીયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકામાંથી પસાર થતી હાથમતી નદી, યુદ્ધેલી નદી, ઈન્દ્રાસી નદી સહિત વાઘાં-કોતરો અને તળાવોમાંથી બની જ માફીયાઓ કાયદાની એસી-ટેસી કરી બિન્દાસ્ત બની જ ચોરી મોટાપાયે કરી રહ્યા છે. ખાણ-ખનીજ વિભાગ અને વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ધ્વારા ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પાયે ખનીજચોરીનું કોભાંડ ઝડપાઈ શકે તેમ લોકમુખે ચર્ચા છે. ★

ભરૂચના દહેગામ પાસે સુમો ગાડીને ડમ્પરે ટક્કર મારતા ચાલકનું મોત

ભરૂચ, ભરૂચના દહેગામ પાસે ઉભેલી સુમો સાથે પાછળથી ધસી આવેલ ડમ્પરે ટક્કર મારતા સુમો ચાલકનું મોત થયું હતું. જયારે અન્ય એકને ઈજા થઈ હતી.



ભરૂચ ના ૧૧ ઈન્ડો સેન્ટરના પ્રોગ્રામ ઓફીસર અલ્કેશ પંડયા અને ભરૂચના દાંડીયા બજારમાં રહેતા ઠાક વર્ષીય શૈલેષભાઈ રાણા સુમો ડ્રાઈવર સુવા ગામે પ્રોગ્રામ હોવાથી ભરૂચથી રવાના થયા હતા. આ દરમ્યાન દહેગામ પાસે જ ડીઝલ પુરૂ થઈ જતા શૈલેષભાઈ રાણા ગાડીના પાછળના ભાગે રહેલ ડીઝલનો કારબો લાવી ડીઝલ પુરી પાછળ હતા તે દરમ્યાન અચાનક માતેલા સાંઢની જેમ ડમ્પર ચાલકે અચાંતા સુમો ચાલક શૈલેષભાઈ રાણાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થવા પામ્યું હતું જયારે સુમોમાં સવાર પ્રોગ્રામ ઓફીસર અલ્કેશ પંડયાને પણ ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.

હતાં. અકસ્માતની જાણ થતા ઈન્ડોના અધિકારીઓ તેમજ સ્ટાફ સહિત મૃતકના પરિવારજનો પણ સીવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. ★

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

GUJCHEM DISTILLERS INDIA LIMITED
Regd office: Office No. 6, 2nd Floor, National Chambers, Near City God, Ashram Road, Ahmedabad - 380 009.
CIN : L24230GJ1939PLC002480 website : www.gujchemdistillers.com email : gujchemdistillers@gmail.com Tel : 079-26580893

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2017
(Rs. In Lakhs)

Particulars	For the Quarter Ended		For the Year ended	
	31-03-2017	31-03-2016	31-03-2017	31-03-2016
Total income from operations (net)	-	-	-	-
Net Profit / (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items#)	(25.82)	(17.19)	(45.14)	(41.16)
Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extra ordinary items#)	(25.82)	(25.19)	(45.14)	205.31
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items#)	(26.52)	(36.19)	(46.38)	194.31
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10.23	10.44	35.37	29.81
Equity Share Capital	16.34	16.34	16.34	16.34
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous year)	-	-	459.34	505.71
Earnings Per Share (of Rs. 10/- each)				
(a) Basic	(16.38)	(22.36)	(28.65)	120.03
(b) Diluted	(16.38)	(22.36)	(28.65)	120.03

* Reserves excluding Revaluation Reserve as shown in the balance sheet of previous year.

Notes: 1. The above is an extract of the detailed format of Quarter / Year end Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter / Year end Financial Results are available on the Stock Exchange websites i.e www.bseindia.com and on the website of the Company i.e www.gujchemdistillers.com.
2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30th May, 2017.

For Gujchem Distillers India Limited
Hem Manish
Managing Director
(DIN 01428688)

Date: 30th May, 2017
Place: Ahmedabad

SAANVI ADVISORS LIMITED

Regd. Off. :- 112, F.F.S. NO. 3187/1, M.V. House, Opp. Hajipura Garden, Shahibaug Road, Shahibaug, Ahmedabad-380004, Ph.No.: 079-25620456
Email:sapharishifin@gmail.com, Website:www.sapharishi.in CIN:L74140GJ1981PLC084205

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2017

PARTICULARS	(in Rs.)		
	Quarter ended on 31/03/2017 (Audited)	Year ended on 31/03/2017 (Audited)	Corresponding 3 months ended in the Prev. year 31/03/2016 (Audited)
Income from Operation (net)	90,000.00	6,50,000.00	2,20,750.00
Other Income	1,54,592.75	15,18,743.00	0.00
Total income from operations (net)	2,44,592.75	21,73,743.00	2,20,750.00
Net Profit/(Loss) from ordinary activities after tax	-4,60,209.26	6,86,278.00	1,91,326.00
Net Profit/(Loss) for the period after tax (after extraordinary items)	-4,60,209.26	6,86,278.00	1,91,326.00
Paid-up equity Share Capital	2,01,05,000	2,01,05,000	1,85,05,000
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	Nil	-2,46,522.00	Nil
Earnings per Share (EPS) for the period (before and after extra ordinary items)(of Rs. 10/- each)			
-Basic	-0.23	0.34	0.10
-Diluted	-0.23	0.16	0.09

Note:-
The above is an extract of the detailed format of Annual Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Annual Financial Results are available on the stock Exchange website-www.mse.in & on company's website-www.sapharishi.in.

For, SAANVI ADVISORS LIMITED
Jasmin Majithia
Company Secretary

Place : Ahmedabad.
Date : 30-05-2017

OMKAR INDUSTRIES LIMITED

Regd. Office: 260, New Cloth Market, Out Side Rajpur Gate, Rajpur, Ahmedabad - 380 002.
Website : www.omkarindustries.co.in, Ph.No. : (079) 22120022;
E-Mail ID : naroda@omkargroup.com, CIN : L51909GJ1985PLC007702

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2017

PARTICULARS	(in Rs Lakhs)		
	Quarter ended on 31/03/2017 (Audited)	Year ended on 31/03/2017 (Audited)	Corresponding 3 months ended in the Prev. year 31/03/2016 (Audited)
Income from Operation (net)	424.14	1467.40	389.24
Other Income	0.00	0.00	0.00
Total income from operations (net)	424.14	1467.40	389.24
Net Profit/(Loss) from ordinary activities after tax	0.49	1.69	0.55
Net Profit/(Loss) for the period after tax (after extraordinary items)	0.49		

GALAXY BEARINGS LIMITED
CIN: L29120GJ1990PLC014385
T-18, Vikram Chambers, Ashram Road, Ahmedabad 380009
Email: investor.gbl@gmail.com • Website: www.galaxybearings.com
Telephones: 079-27546020, Fax: 079-027546535

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION
Notice is hereby given that the 27th Annual General Meeting (AGM) of the Company is scheduled to be held on Friday, 29th September, 2017 at 12:00 noon at Shree Sardar Patel Seva Samaj, Beside Central Bank of India, Near Mithakhali Six Road, Ellis Bridge, Ahmedabad - 380006, to transact the business as set out in the Notice of the 27th AGM as displayed on the website of the Company (www.galaxybearings.com) as well as on the website of CDSL (www.evotingindia.com).

In compliance with section 101 and 136 of the Companies Act, 2013 (the "Act") and Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, the Annual Report for the year ended 31st March, 2017 together with the Notice of 27th AGM and Audited Financial Statement for the said financial year has been sent to the members via electronic mode whose e-mail IDs are registered either with the Company/Depository(s) and physical copies of the same has been dispatched through the permitted mode to all other Members whose e-mail IDs are not registered with the Company/Depository(s). The e-communication/dispatch of the same has been completed on 1st September, 2017.

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company has provided the facility of voting (including remote e-voting and voting at AGM) to the members. Further, it is informed that:

- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. 22nd September, 2017 are entitled to vote (including remote e-voting) at the 27th AGM.
 - The Company has engaged Central Depository Services (India) Ltd. (CDSL) as the authorized agency to provide the E-voting facility.
 - The remote e-voting period will commence on Tuesday, 26th September, 2017 at 09:00 a.m. and ends on Thursday, 28th September, 2017 at 05:00 p.m., forthwith which the facility shall be blocked and e-voting beyond the said date and time shall not be allowed.
 - For the purpose and manner of e-voting, members shall refer to the instructions mentioned at Note number 12 in the Notice of 27th AGM.
 - Once the vote on a resolution is casted, it cannot be changed subsequently or cannot be casted again.
 - A member may participate in the AGM even after exercising the right to vote through remote e-voting but shall not be allowed to vote again.
 - At the AGM, the facility for voting through Ballot Paper will be available to the members who have not availed the remote e-voting facility.
 - If a person acquires shares of the Company after the date of dispatch of Notice and has a holding as on the cut-off date i.e. 22nd September, 2017, shall be entitled to exercise his/her vote either electronically i.e. remote e-voting or through the Poll Paper at the AGM by following the procedure mentioned in a notice which is placed on Company website i.e. www.galaxybearings.com as well as CDSL website i.e. www.evotingindia.com.
 - Mr. Krunal Hirapara, Practicing Company Secretary has been appointed as the Scrutinizer to scrutinize the process of voting (including remote e-voting and voting at AGM) in a fair and transparent manner.
 - In case of any queries or issues regarding e-voting, the Members may refer to "Frequently Asked Questions" (FAQs) and e-voting manual available at www.evotingindia.com under the help section or Members may contact at toll free number 1800-200-5533 or write an email to helpdesk.evoting@cdslindia.com or contact the Compliance Officer of the Company at its Registered Office or write an e-mail to designated email ID viz. investor.gbl@gmail.com
- Date: 2nd September, 2017 For, GALAXY BEARINGS LIMITED
Bharat Kumar K. Ghodasara
Place: Ahmedabad (Whole Time Director) DIN: 00032054

ANAR INDUSTRIES LIMITED
CIN: L29199GJ1992PLC018047
Reg. Office: 4th Floor, Karm Corporate House, Opp. Vikramnagar, Nr. New York Timber Mart, Ambli Bopal Road, Ahmedabad - 380059, Gujarat. Phone No.: 079-26936006, Website: www.anar.co.in E-mail ID: info@anar.co.in

NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES
NOTICE is hereby given that the Annual General Meeting (AGM) of the members of the Company will be held on Wednesday, 27th September, 2017 at 11:00 a.m. at registered office of the Company. The Notice of AGM along with the Annual Report, inter alia, including the remote e-voting instructions, Attendance Slip and proxy form has been e-mailed to the members whose e-mail addresses have been registered with the Company or with Depository Participants and sent by permitted mode to all other members at their registered addresses.

Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 24th September, 2017 to the 27th September, 2017 (Both days inclusive).

REMOTE E-VOTING:
In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice of the AGM through the remote e-Voting Services provided by CDSL.

The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:

- Cut-off date for the purpose of remote e-voting is 20th September, 2017.
- Period of e-voting: E-voting starts from 9:00 AM on 24th September, 2017 and ends at 5:00 PM on 26th September, 2017. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.
- Notice of AGM is available on website of the Company (www.anar.co.in) as well as website of CDSL (www.cdslindia.com)
- Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e. 20th September, 2017, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of AGM.
- A person, whose name appears in the Register of Members/Beneficial owners as on cut-off date i.e. 20th September, 2017 shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM. However, if the person is already registered with CDSL for remote e-voting, then the existing User ID and Password can be used for casting votes. The first time user are requested to refer the instructions given in the notice for creation of User ID and Password.
- Members may participate in the General Meeting even after casting their vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.
- The facility for voting through Poll paper shall also be made available at the AGM and Members who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the AGM. In case Members cast their votes through both the modes, voting done by e-voting shall prevail and vote cast through poll paper shall be treated as invalid.
- In case of any query relating to e-voting, members/beneficial owners may refer the frequently asked questions and e-voting user manual available at www.evotingindia.com or write on email to helpdesk.evoting@cdsl.com
- Members are requested to submit duly filled in Attendance Slip along with proof of identification.

By order of the Board of Directors
For, Anar Industries Limited
SD/-
Place: Ahmedabad Narendra S Ayer - Director
Date: 04.09.2017 DIN: 00116992

ON-LINE TENDER NOTICE NO.: 1 FOR 2017-18
Executive Engineer, Bhavnagar Irrigation Division, Panwadi, Bhavnagar Phone No. 0278-2515737 invites on-line tenders for 1 Nos. Esti. cost Rs.1346.75 lakhs.
Tender Documents downloading end 28.09.2017
Date for Sr.No. 1
EMD Tender Fee & other documents (In physical form). By R.P.A.D./Speed Post only 04.10.2017
Opening of tenders (on line) "P.Q. Bid". 05-10-2017
Tender Documents downloading from web site: www.nprocure.com and also on Information Department web site: www.statetenders.com Pre Bid Meeting held on dtd. 11.09.2017 at 15:00 PM in the office of the S.E., Bhavnagar Irrigation Project Circle, S-3 Jilla Seva Sadan-2, Bhavnagar-364001 for below mention Sr.No. tender works.
DDI/BVN/550/17

BHARAT SANCHAR NIGAM LTD.
(A Govt. of India Enterprise)
O/o. CGMT, BSNL, 3rd Floor, Telephone Bhavan, Navrangpura, Ahmedabad - 06
NOTICE INVITING E-TENDER
NIT no. CO/GENL/Tender Sty. Items/2017-18 dated 05/09/2017.
AGM (Admn) O/o CGMT Tel. 26481822/1717, on behalf of CGMT of Gujarat Circle invites E- tender for Procurement of Copier papers & Stationery items in O/o CGMT BSNL Telephone Bhavan, Navrangpura Ahmedabad and other offices under CGMT in Ahmedabad. The last date of submission of E- Tender for is 26/09/2017 up to 11.00 hrs. and it will be opened on the same day at 12.00 hrs.
For details, visit www.gujarat.bsnl.co.in and follow the link "E- tenders(Gujarat Circle)" or www.tenders.bsnl.co.in

Gujarat Water Supply & Sewerage Board
Tender Notice No. 8 to 10 and 14 / 2017-18
Tenders are invited through Two bid E-Tendering for Limbdi taluka villages following work under Adimjuth Programme by the Executive Engineer P.H. W. Dn. Limbdi Opp. Milk Dairy Limbdi (Phone 02753-260667) from the Government Registered Contractors.

Sr. No.	Name of work	Tender ID	Estd. Cost in Rs. Lakhs	EMD Rs.	Tender Fee Rs.	Class of Regi.
1	Const. of Sump Pump room & ESR Laying & Jointing at vill. Rajol	273750	25.93	26000/-	1500/-	E-1 & above
2	Const. of Sump Pump room & ESR and Lowering Laying & Jointing at vill. Parali	273761	23.00	23100/-	900/-	E-1 & above
3	Const. of Sump & ESR at VII Nani Kathechi	273765	18.33	18400/-	900/-	E-1 & above
4	Const. of Sump ESR and Lowering Laying & Jointing at vill. Anandpur Jasmalpur and Pamaia	273768	6.86	6800/-	900/-	E-2 & above

Tender documents can be seen, down-loaded and submitted on website https://www.nprocure.com. The last date of submission of tenders is 12.9.2017 up to 18.00 Hours. Any additional information of the tender will be available at above mentioned office. All right is reserved to reject any or all tenders without assigning any reasons therefor.
માહિતી/સુચનક્રમ/306/18-1૯

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivrangani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • E-Mail ID: csjindal@jindaltextiles.com Website: www.jindaltextiles.com • Ph: 079-71001500-557(Ext.) CIN: L17110GJ1986PLC008942
NOTICE OF 31ST ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE
Notice is hereby given that:
1. DATE & TIME OF AGM:
The 31st Annual General Meeting (AGM) of the Members of Jindal Worldwide Limited (the 'Company') will be held at "206, Chikwadia, Sajpur, Gopalpur, Ahmedabad-382445 (Gujarat)" on Wednesday, 27th September, 2017 at 5.00 p.m. to transact the Ordinary and Special Business, as set out in the Notice convening the AGM.
2. DISPATCH:
Electronic & Physical copies of the Notice of AGM and Annual Report for Financial Year 2016-2017 have been sent to all the members whose email IDs are registered with the Company/RTA and to other members at their registered address in the permitted mode, respectively. Physical copies of Annual Reports will be provided to the Shareholders, as and when requested to whom the Annual Report has been sent through e-mail. The Notice of AGM is available on the website of BSE Ltd. i.e. "www.bseindia.com" & NSE Ltd. i.e. "www.nseindia.com" and the Annual Report along with Notice of AGM is available at the Company's Website i.e. "www.jindaltextiles.com" and the same can also be obtained by writing to the Company at "csjindal@jindaltextiles.com".
The dispatch of Notice of AGM has been completed on Saturday, 2nd September, 2017.
3. BOOK CLOSURE:
The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Thursday, 21st September, 2017 to Wednesday, 27th September, 2017, (both days inclusive) for the purpose of the AGM and for determining entitlement for dividend.
4. E-VOTING: (Pursuant to Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015, and pursuant to Regulation 44 of SEBI (LODR) Regulations, 2015)-
Members holding shares either in Physical form or in dematerialized form, as on the cut-off date of Wednesday, 20th September, 2017, may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through voting system of Central Depository Service (India) Limited (CDSL) from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that:-
i. The Ordinary and Special Business as set out in the Notice of AGM may be transacted through voting by electronic means;
ii. The remote e-voting will commence on Sunday, 24th September, 2017 (9:00 a.m.) and ends on Tuesday, 26th September, 2017 (5:00 p.m.).
iii. The cut-off date for determining the eligibility of members to vote by electronic means or at the AGM through ballot Paper is Wednesday, 20th September, 2017.
v. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and up to the cut-off date, may obtain the Login ID and password by sending a request at "helpdesk.evoting@cdslindia.com" or "csjindal@jindaltextiles.com". If a person is already registered with CDSL for e-voting then existing user ID and password can be used for casting vote.
vi. The facility for voting through ballot paper shall be made available at the AGM;
vii. Members may note that:
a) the remote e-voting module shall be disabled by CDSL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
b) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again and
c) a Member as on cut-off date shall only be entitled for availing the Remote e-voting facility or vote, as the case may be, in the General Meeting.
viii. In case of queries, Members may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available on "www.evotingindia.com" under help section or write an email to "helpdesk.evoting@cdsl.com" or "csjindal@jindaltextiles.com".
Date: 4th September, 2017
Place: Ahmedabad
On Behalf of the Board of Directors
Sd/- (Amit Agrawal) Managing Director - DIN:00169061

CIRCUIT SYSTEMS (INDIA) LIMITED
[CIN: U74140GJ1995PLC024524]
A-1001-1002, Titanium Square, Thaltej Cross Road, S. G. Highway, Ahmedabad - 380 054
NOTICE FOR 22ND ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING
NOTICE is hereby given that the 22nd Annual General Meeting (AGM) of the Members of Circuit Systems (India) Limited ('the Company') will be held on Friday, the 29th September, 2017 at 4.00 p.m. at A-1001-1002, Titanium Square, Thaltej Cross Road, S. G. Highway, Ahmedabad - 380 054, to transact the business as set out in the Notice dated 24th August, 2017 convening the AGM.
The Notice of the 22nd AGM and Annual Report for the financial year 2016-17 have been sent to all members at their registered address in the permitted mode.
NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, the 22nd September, 2017 to Friday, the 29th September, 2017 (both days inclusive), for the purpose of 22nd AGM of the Company.
As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under:

1. Date of completion of dispatch of Notice of AGM	4th September, 2017
2. Date & Time of commencement of Remote e-voting	9.00 a.m. on 26th September, 2017
3. Date & Time of end of Remote e-voting	5:00 p.m. on 28th September, 2017
4. Cut-off date for determining rights of entitlement of Remote e-voting	22nd September, 2017
5. Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM.	
6. Remote e-voting shall not be allowed beyond	After 5:00 p.m. on 28th September, 2017
7. Manner of casting vote on resolutions at the venue of AGM	The facility of voting through 'Ballot Paper' shall be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.
8. Notice of 22nd AGM is available on Company's website & on CDSL website	www.myscl.com ; www.evotingindia.com
9. Contact details of person responsible to address the grievances connected with remote e-voting	Ms. Sreepriya K. M/s. Cameo Corporate Services Limited 'Subramaniam Building' No. 1, Club House Road, Chennai- 600002, Email :- investor@cameoindia.com Tel. : 91-44- 2846 0390

By Order of the Board,
FOR CIRCUIT SYSTEMS (INDIA) LIMITED,
PARESHA VASANI
MANAGING DIRECTOR
Place : Ahmedabad
Date : 4th September, 2017

Solving this chess puzzle could net you a \$1 mn prize

London, Computer programmers who can find a solution to a "simple" chess puzzle stand a chance to win a \$1 mn prize, but providing a solution to the problem could be so hard that it could take them thousands of years, say researchers.
Any computer programme capable of solving the famous "Queens Puzzle" efficiently, would be so powerful, it would be capable of solving tasks currently considered impossible, such as decrypting the toughest security on the internet, the team of researchers from University of St Andrews in Britain.
In a paper published in the Journal of Artificial Intel-

ligence Research, the team said the rewards to be reaped by such a programme would be immense, not least in financial terms with firms rushing to use it to offer technological solutions, and also a \$1m prize offered by the Clay Mathematics Institute in the US.
"If you could write a computer programme that could solve the problem really fast, you could adapt it to solve many of the most important problems that affect us all daily," said Professor Ian Gent.
"This includes trivial challenges like working out the largest group of your Facebook friends who don't know each other, or very important ones like crack-

ing the codes that keep all our online transactions safe," Gent added.
Devised in 1850, the Queens' Puzzle originally challenged a player to place eight queens on a standard chessboard so that no two queens could attack each other.
This means putting one queen in each row, so that no two queens are in the same column, and no two queens in the same diagonal. Although the problem has been solved by human beings, once the chess board increases to a large size no computer program can solve it.
The team found that once the chess board reached 1000 squares by 1000, computer programs

could no longer cope with the vast number of options and sunk into a potentially eternal struggle.
The reason these problems are so difficult for computer programmes, is that there are so many options to consider that it can take many years.
"In practice, nobody has ever come close to writing a programme that can solve the problem quickly. So what our research has shown is that - for all practical purposes - it can't be done," Peter Nightingale said. "There is a \$1,000,000 prize for anyone who can prove whether or not the Queens' Puzzle can be solved quickly so the rewards are high," Christopher Jefferson said.

પાણીજન્ય શુભલેખ રોગોથી બચવાનો એક માત્ર સરળ ઉપાય
બેકટાફી ટેબલેટ
કરે સમગ્ર પરિવારની સુરક્ષા
બેકટાફી-૧૦ ૧ ટેબલેટ
૧૦ લિટર પાણી માટે (માટલી, કેરબી માટે)
બેકટાફી-૧૦૦૦ ૧ ટેબલેટ
૧૦૦૦ લિટર પાણી માટે (રાંકી માટે)
પાણીનો સ્વાદ જરા પણ બદલાતો નથી બેકટાફી ટેબલેટ
પાણીને રાખે જંતુમુક્ત, શરીરને રાખે તંદુરસ્ત
બેકટાફી ટેબલેટ સંચરેલ પાણીમાં તેમજ પાષણવાદનમાં થતી લીલને નિયંત્રિત કરે છે. બેકટાફી ટેબલેટ નાખેલ પાણી એટલે પ્રાણીજન્ય રોગોથી મુક્તિ. માટે આજે જ લઈ આવો. બેકટાફી ટેબલેટ
૦૯૯-૨૬૬૩૧૭૪૪.

Polish tech firm RTB House extends operations in India

Mumbai, Poland-based global ad tech company RTB House on Monday expanded its operations in India and appointed Kshitiz Randhir Shori, former Director of Sales for Criteo, as its new Country Manager.
"The Indian digital economy has the potential to become the world's third largest within the next decade.
E-businesses will grow manifold and will require our innovative digital mar-

keting solutions in order to tap into the next billion digital natives," said Jakob Ratajczak, Managing Director APAC, in a statement.
The company's expansion in India comes close on the heels of a record-breaking year in 2016 for the company that saw it bolster the workforce by more than 40 per cent, launch operations in Australia and New Zealand and also increase revenue by over 140 per cent.
"I am really excited to join RTB House and to be an integral part of the ad-tech eco system where the sacrosanct focus is on delivering actual sales for our advertisers with the help of next generation technologies like deep learning and artificial intelligence," Shori added.
RTB House is one of the few companies to have developed and implemented its own proprietary technology for purchasing advertisements in the RTB model (real-time bidding) -- a solution in which buyers participate in real-time advertising space auctions.

પથરીની સારવાર
ઓપરેશન વગર
લીઝોટ્રીપ્સી દ્વારા
સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછા દરે
પારંગત-પારદર્શક-વિશ્વસનીય સારવાર
પરિમલ હોસ્પિટલ (Estd.-1982)
પુનીતમાર્ગ, ઠાકડીયા ઢિંગા પાસે, મહિનગર, અમદાવાદ-૬.
Ph: 84600 65008, 98240 19394

TENDER NOTICE No.9 OF 2017-18 (SECOND ATTEMPT)
Tenders are invited by Executive Engineer, Ahmedabad Medical (R&B) Division, C-4, Bahumali Bhavan, Vastrapur, Ahmedabad-380052 (P.No. 079-27910414) for 5 (Five) works costing Approx. Rs. 3.32 Lakhs to 4.99 Lakhs for Housing keeping Work from contractors registered in appropriate class, G.S.T. No., Pan No., same type work experience, Solvency Certificate. Tender documents of these works can be issue upto Dt. 08.09.2017. Tenders can be Submitted R.P.A.D./Speed Post upto Dt. 14.09.2017 at 18.00 hrs. Detailed Tender Notice can be seen on www.statetenders.com and office Notice Board. Interested Contractors are requested to contract personally at above office in working days for information.
No. INF/ABD/1007/2017-18

ADARSH PLANT PROTECT LIMITED
Regd. Office : 604, GIDC Estate, V.U. Nagar-388121, Anand, Gujarat
CIN : L29210GJ1992PLC017845 TEL NO. : 02692-236705
Fax: 02692-236704 Website: www.adarshplant.com
NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a Meeting of the Board of Directors of the Company will be held on Monday, 11th September, 2017, inter alia to consider and approve, the Unaudited Financial Results of the Company for the quarter ended 30th June, 2017.
The said Notice is available on website of the Company i.e. www.adarshplant.com and also on the website of BSE Limited i.e. www.bseindia.com.
For Adarsh Plant Protect Limited
Date : 04.09.2017 Shweta B. Phondba
Place : V.U. Nagar Company Secretary

MINAXI TEXTILES LIMITED
Regd. Office: Plot No. 3311, Phase-IV, GIDC Industrial Estate, Village: Chhatral, Taluka: Kalol, District: Gandhinagar (N.G.)
CIN : L17119GJ1995PLC025007
NOTICE OF BOARD MEETING
Notice, pursuant to Regulation 29 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, is hereby given that a meeting of Board of Directors of the Company will be held on Tuesday, 12th day of September, 2017, at 11:00 A.M. at Registered Office of the Company inter - alia to take note of and approval of the Unaudited Standalone Financial Results of the Company for the quarter ended on 30th June, 2017.
Pursuant to Regulation 47 the said Notice may be accessed on the website of the company www.minaxitextiles.com and may also be accessed on the website of the Stock Exchange on which the shares of the company are listed i.e. www.bseindia.com.
For, MINAXI TEXTILES LIMITED
Bharatbhai P. Patel
Managing Director
DIN : 00161825
Place : Chhatral
Date : 02-09-2017

TRANSWIND INFRASTRUCTURES LIMITED
Registered Office: 74 Newyork Tower-A, Opp. Jain Derasar, S. G. Highway, Thaltej, Ahmedabad - 380054.
CIN: U45203GJ1997PLC032347, Phone: 079-26854899, E-mail: cs@transwind.in | www.transwind.in
NOTICE OF ANNUAL GENERAL MEETING
NOTICE is hereby given that the 20th (Twentieth) Annual General Meeting of Transwind Infrastructures Limited will be held at Hotel Kells, Newyork Tower- A, Opp. Jain Derasar, Thaltej, Ahmedabad - 380054, on Friday, September 29th, 2017, at 04:00 pm to transact the business as set out in the Notice of the Meeting. The Register of Member and Share Transfer Books shall remain close from 22nd September, 2017 to 29th September, 2017 (Both Days inclusive) for the purpose of Annual General Meeting.
By order of Board
For, Transwind Infrastructures Limited
Sd/- Jaydev Shukla
Company Secretary
Date : 04-09-2017
Place : Ahmedabad

WESTERN TIMES
Disclaimer
Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

CHANGE OF NAME
I have changed my old name from BAROT NAYANABEN PRAHLADBHAI to New Name BRAHMBHATT NISHA UPENDRA Add. : 9, Rameshnagar, Harshad Colony Road, Bapunagar, Ahmedabad

CHANGE OF NAME
I have changed my old name from SAFIK SHAUKATBHAI KHEDAWALA to New Name SAFIK SHOKATBHAI KHERADAWALA Add. : 982, Kherwalnagar, Dehlu, Jamalpur, Ahmedabad-1

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION
CONTRACT FOR POH OF EOG NON LHB AC COACH
E-Tender No. BVPP-2017-18-AC-EOG-01-R2: Name of Work: Contract for "POH of EOG Non-LHB AC Coach at Bhavnagar Para Workshop" for 12 months. Estimated Cost: ₹ 64,27,084/-
The bidders have to apply on line through link i.e. www.reps.gov.in only. For further details please visit website www.reps.gov.in. Last date for online apply 09-10-2017 will be date of opening up to 15:00 hrs.
Follow us on twitter.com/WesternRly

LINK PHARMA CHEM LIMITED
Regd. Off: 162, GIDC Estate, Nandesari - 391 340 Dist. Vadodara
CIN: L24239GJ1984PLC007540. Web: www.linkpharmachem.co.in
Phone No. 0265-3065000 | Email Id: linkpharmacs@gmail.com

NOTICE OF THE 32ND ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE
NOTICE is hereby given that the 32nd Annual General Meeting (AGM) of the Company is scheduled to be held on Thursday, 28th September, 2017 at 11.00 a.m. at NIA Hall, Plot No. 134/1, GIDC Estate, Opp. Shopping Centre, Nandesari - 391 340, Dist. Vadodara to transact the business as set out in the Notice calling AGM. Notice is also given pursuant to the Provision of Section 91 of the Companies Act, 2013 and Regulation 42 & 47 of the SEBI (LODR) Regulations, 2015, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 22nd September, 2017 to Thursday, 28th September, 2017 (both days inclusive) for the purpose of the said AGM of the Company. The Company is pleased to provide its members with the facility to exercise their right to vote by electronic means and the business may be transacted through e-voting services provided by Central Depository Services (India) Limited (CDSL). The e-voting period commences on Monday, 25th September, 2017 at 10.00 a.m. and ends on Wednesday, 27th September, 2017 at 05.00 p.m. The e-voting module shall be disabled for voting after 05.00 p.m. on Wednesday, 27th September, 2017. Once the vote on resolution is cast by the shareholder, the shareholder shall not be allowed to change it subsequently. The voting rights shall be as per the number of equity shares held by the member(s) as on Thursday, 21st September, 2017 (cut-off date). Members are eligible to cast vote electronically only if they are holding shares as on that date. The procedure of electronic voting is available in the notice of AGM. In case of any queries/issues regarding e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at <https://www.evotingindia.com> under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact at CDSL helpline number.

FOR LINK PHARMA CHEM LIMITED
SATISH G THAKUR
MANAGING DIRECTOR

Date: 06.09.2017
Place: Vadodara

B. NANJI ENTERPRISES LIMITED
CIN: L45201GJ1982PLC005148
Regd. Office: "Moorti Bungalows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015. Ph: 079-65214174 / 64502351
Email id: bnanji@hotmail.com Website: www.bnanji.com

NOTICE
NOTICE is hereby given that the 35th Annual General Meeting of the members of the Company will be held on **Thursday, 28th September, 2017** at 10.30 a.m. at the Registered Office at "Moorti Bungalows", 5, Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015 to transact the business as set out in the Notice of the said Annual General Meeting.

Notice of the AGM together with Annual Report for the F.Y. 2016-2017 has been sent to all members by permitted mode at their address registered with the company and/ or electronically to those members who have registered their email address registered with the company or their respective Depository. The notice of AGM inter alia indicating the process and manner of E-Voting process can be also downloaded from the website of CDSL at www.evotingindia.com.

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of Companies (Management and Administration) Rules 2014 and Regulation 44 of SEBI (Listings Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide e-voting services by Central Depository Services (India) Limited (CDSL). Members holding shares on cut-off date i.e. 21st day of September, 2017 may cast their vote electronically. Voting through electronic mode shall commence on 25th September, 2017 at 09.00 A.M. and end on 27th September, 2017 at 6.00 P.M.

The Board of Directors of the Company has appointed Mr. Gaurang R. Shah, Practising Company Secretary as Scrutinizer to scrutinize the e-voting procedure in a fair and transparent manner.

The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2017 to 28th September, 2017 for the purpose of Annual General Meeting of the Company.

For, B. Nanji Enterprises Ltd.
SD/-
Mr. Fakhruddin Jadaliwala
Company Secretary

Place: Ahmedabad
Date: 05/09/2017

ADVANCE PETROCHEMICALS LTD.
(CIN L23200GJ1985PLC008013)
Regd. Off: 36, Kothari Market, Kankaria Road, Ahmedabad-380022
Tel: 079 25454795 Fax 079 25710027
Email: info@advancepetro.com website: www.advancepetro.com

NOTICE OF 32nd AGM, REMOTE E-VOTING & BOOK CLOSURE
Notice is hereby given that

- The 32nd Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Friday, 29th September, 2017 at 12.30 p.m. at Plot No. 167, Pirana Approach, Village: Pipej, Ahmedabad: 382405 to transact business as set out in the Notice of the Meeting dated 14th August, 2017.
- Electronic copies of Notice of AGM and annual report for 2017 have been sent to all members whose email id are registered with the Company / Depository Participant (s). The same are also available on the website of the company www.advancepetro.com. Notice of AGM and Annual Report 2017 has been sent to all other members at their registered address in permitted mode. The dispatch has been completed on 04.09.2017. Members are entitled to receive the said Notice and Annual Report in physical form upon sending a request in writing to the Company's registered office and/ or sending an email to info@advancepetro.com.
- In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (LODR), Regulations, 2015, Company is pleased to provide remote e-voting facility to members, to vote from a place other than venue of the AGM. The Company has engaged services of Central Depository Services Ltd (CDSL) for the purpose.
- The Register of Members and Share Transfer Book of the Company will remain closed from 22nd September, 2017 to 29th September, 2017 (both days inclusive).
- All members are informed that
 - The business as set out in the Notice of AGM may be transacted through voting by electronic means.
 - Cut off date for determining eligibility to vote by electronic means or at the AGM is 22nd September, 2017.
 - Remote e voting will start on 26th September, 2017 (9.00 a.m) and will end on 28th September, 2017 (5.00 p.m).
 - The voting rights of members shall be in proportion to their share of paid up equity share capital of the Company as on cut off date i.e 22nd September, 2017.
 - Any person who acquires shares of the Company and becomes a member of the Company after the despatch of notice of AGM and holds shares as of cut off date i.e 22nd September, 2017 may obtain login id and password by sending a request at www.cdslindia.com. However if you are already registered with CDSL for e voting then existing user id and password/PIN for casting vote.
 - Members who have cast their vote by remote e-voting prior to AGM may attend AGM but shall not be entitled to cast their vote again.
 - The facility of voting through ballot paper shall be made available at AGM and the members attending AGM who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at AGM through ballot paper.
 - The Notice of 32nd AGM are also available at website of the Company at www.advancepetro.com and at website of CDSL www.cdslindia.com.
 - For detailed instructions pertaining to E-Voting, members may please refer Notes to Notice of the AGM. In case of any queries or grievances pertaining to E-Voting procedure, shareholders may get in touch with Secretarial Department of the Company at the Registered Office of the Company or the e-mail ID / contact Nos. as mentioned aforesaid.

For ADVANCE PETROCHEMICALS LTD.
SD/-
(Ashok Goenka)
Managing Director
DIN 00086925

Place : Ahmedabad
Date : 07.09.2017

LIPPI SYSTEMS LIMITED
(CIN: L22100GJ1993PLC020382)
Regd. Office : 3rd Floor, Satya complex, Nr. Ashwamegh IV, 132 Ft Ring Road, Satellite, Ahmedabad-15
www.lippiSYSTEMS.com, Ph. no. : (079)26750060/61/62, Email: cs@lippiSYSTEMS.com

NOTICE
Notice is hereby given that Pursuant to Regulation 29 read with Regulation 47(1)(a) of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 that the Board of Directors Meeting of LIPPI SYSTEMS LIMITED will be held on Thursday the 14th day of September, 2017 at the Registered office of the Company at 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-iv, 132ft Ring Road, Satellite, Ahmedabad-380015 at 04:00 P.M to inter-alia consider & take on record the Un-Audited Financial Results for Quarter Ended on 30th June, 2017. Information in this regard is also available on the website of the company i.e www.lippiSYSTEMS.com and on the website of stock exchange i.e www.bseindia.com

For, LIPPI SYSTEMS LIMITED
Sd
Darshan B Shah
(Company Secretary)

Date : 05.09.2017
Place : Ahmedabad.

SHREE BENZOPHEN INDUSTRIES LIMITED
(CIN: L25200GJ1992PLC017838) Regi. Office: Survey No 306, Sakardaa-Bhadarva Road, Village: Moxi, Tal: Savli Vadodara, Gujarat.

VOTING THROUGH ELECTRONIC MEANS
Shree Benzophen Industries Limited is pleased to provide the facility of casting votes using an Electronic Voting System from a place other than the venue of the Annual General Meeting (AGM) ("remote voting") to its shareholders for the AGM of the Company scheduled to be held on Saturday, 30th September, 2017 at 11:00 a.m. at Survey No 306, Sakardaa-Bhadarva Road Village: Moxi, Tal: Savli Vadodara, Gujarat. For the purpose of AGM, the Registrar of Members and Share Transfer Books of the Company will remain closed from 23rd September, 2017 (Saturday) to 30th September, 2017 (Saturday) (both days are inclusive).

In this regard, Notice is hereby given that the Company has completed dispatch of the notice convening the AGM on 05th September, 2017. The businesses mentioned in the said notice may be transacted by electronic means. The shareholders are required to log on to www.evotingindia.com to cast their vote electronically. The detailed procedure for the e-voting is provided in the Notice.

The remote e-voting period commences on 26th September, 2017 at 09.00 a.m. and ends on 29th September, 2017 at 5.00 p.m. The shareholders who have cast their vote by remote e-voting may also attend the meeting but shall not be entitled to cast their vote again. The shareholders of the Company, holding shares as at the cut-off date of 23rd September, 2017, may cast their vote either by remote e-voting or by ballot at the AGM. Any person, who has acquired shares of the Company and becomes member of the Company after dispatch of the notice and is holding shares as on 23rd September, 2017, may obtain the login id and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. The e-voting module shall be disabled by CDSL for voting after 29th September, 2017 (5.00 p.m.).

The Annual Report and AGM Notice along with Attendance Slip and Proxy Form are available for inspection at the registered office. The AGM Notice will also be available on the website of CDSL (www.evotingindia.com).

In case Members have any queries or issues regarding e-voting, they may refer the frequently asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or members may even write to Mrs. Pinkal Shah, Compliance Officer, at Survey No 306, Sakardaa-Bhadarva Road Village: Moxi, Tal: Savli Vadodara, Gujarat; Phone: 0265-2354841; Email: benzophen@hotmail.com regarding the grievances connected with voting by electronic means.

By Order of the Board
For, Shree Benzophen Ind. Ltd
Sd/-
Bharatsinh Sodha
Managing Director

Place: Moxi
Date: 06.09.2017

ADVANCE MULTITECH LTD.
(CIN L51494GJ1979PLC006698)
Regd. Off.: 36, Kothari Market, Kankaria Road, Ahmedabad-22
Tel : (079) 25454795. Fax : 25710027
Email: info@advancemulti.com website: www.advancemulti.com

NOTICE OF 38th AGM, REMOTE E-VOTING & BOOK CLOSURE
Notice is hereby given that

- The 38th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Friday, 29th September, 2017 at 2.30 p.m. at Plot No. 167, Pirana Approach, Village: Pipej, Ahmedabad: 382405 to transact business as set out in the Notice of the Meeting dated 14th August, 2017.
- Electronic copies of Notice of AGM and annual report for 2017 have been sent to all members whose email id are registered with the Company / Depository Participant (s). The same are also available on the website of the company www.advancepetro.com. Notice of AGM and Annual Report 2017 has been sent to all other members at their registered address in permitted mode. The dispatch has been completed on 04.09.2017. Members are entitled to receive the said Notice and Annual Report in physical form upon sending a request in writing to the Company's registered office and/ or sending an email to info@advancemulti.com.
- In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (LODR), Regulations, 2015, Company is pleased to provide remote e-voting facility to members, to vote from a place other than venue of the AGM. The Company has engaged services of Central Depository Services Ltd (CDSL) for the purpose.
- The Register of Members and Share Transfer Book of the Company will remain closed from 22nd September, 2017 to 29th September, 2017 (both days inclusive).
- All members are informed that
 - The business as set out in the Notice of AGM may be transacted through voting by electronic means.
 - Cut off date for determining eligibility to vote by electronic means or at the AGM is 22nd September, 2017.
 - Remote e voting will start on 26th September, 2017 (9.00 a.m) and will end on 28th September, 2017 (5.00 p.m).
 - The voting rights of members shall be in proportion to their share of paid up equity share capital of the Company as on cut off date i.e 22nd September, 2017.
 - Any person who acquires shares of the Company and becomes a member of the Company after the despatch of notice of AGM and holds shares as of cut off date i.e 22nd September, 2017 may obtain login id and password by sending a request at www.cdslindia.com. However if you are already registered with CDSL for e voting then existing user id and password/PIN for casting vote.
 - Members who have cast their vote by remote e-voting prior to AGM may attend AGM but shall not be entitled to cast their vote again.
 - The facility of voting through ballot paper shall be made available at AGM and the members attending AGM who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at AGM through ballot paper.
 - The Notice of 38th AGM are also available at website of the Company at www.advancemulti.com and at website of CDSL www.cdslindia.com.
 - For detailed instructions pertaining to E-Voting, members may please refer Notes to Notice of the AGM. In case of any queries or grievances pertaining to E-Voting procedure, shareholders may get in touch with Secretarial Department of the Company at the Registered Office of the Company or the e-mail ID / contact Nos. as mentioned aforesaid.

For ADVANCE MULTITECH LTD.
SD/-
(Ashok Goenka)
Director
DIN 00086925

Place : Ahmedabad
Date : 07.09.2017

GOLDEN CAPITAL SERVICES LIMITED
Regd. Office: 1st floor, b/177, sector-8, Dwarka, New Delhi - 110075
Corporate Ofc: 1st Floor, Trans House, Near Havmor Restaurant, Navrangpura, Ahmedabad-380009
CIN: U74899DL1994PLC057393 www.goldencapitalservices.in
Ph: 079-65412089 E-MAIL: goldencapitalservicesltd@gmail.com

NOTICE
NOTICE is hereby given that the Annual General Meeting ("AGM") of the Company will be held on Saturday, 30th September, 2017 at 11:00 am at the Registered Office of the Company to transact the business as set out in the notice of the AGM.

NOTICE is further given that, pursuant to Section 91 of the Companies Act 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, and in accordance with Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from, 21st September, 2017 to 30th September, 2017 (both days inclusive) for the purpose of Annual General Meeting. The facility for voting through ballot paper shall be made available at the AGM; (b) a person whose names appear in the Register of Members / List of Beneficial Owners, received from NSDL / CDSL, as on close of business hours on Friday, 18th August, 2017 only shall be entitled to vote at the AGM through ballot papers.

The Annual Report along with the Notice has been dispatched to members by permitted mode. The Notice of the AGM and the Annual Report for 2016-17 are also available on the Company's website www.goldencapitalservices.in

By Order of the Board
Sd/-
Jaiminkumar Shah
Director
DIN: 0690281

Date: 7th September, 2017
Place: Ahmedabad

INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LIMITED
CIN: L65910GJ1990PLC014436
Regd. Office: "Moorti Bungalows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015.
Ph: 079-65214174 / 64502351 Email: ihfci@hotmail.com Website: www.ihfci.com

NOTICE
NOTICE is hereby given that the 27th Annual General Meeting of the members of the Company will be held on Thursday, 28th September, 2017 at 11.30 a.m. at the Registered Office at "Moorti Bungalows", 5, Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015 to transact the business as set out in the Notice of the said Annual General Meeting.

Notice of the AGM together with Annual Report for the F.Y. 2016-2017 has been sent to all members by permitted mode at their address registered with the company and/ or electronically to those members who have registered their email address registered with the company or their respective Depository. The notice of AGM inter alia indicating the process and manner of E-Voting process can be also downloaded from the website of CDSL at www.evotingindia.com.

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of Companies (Management and Administration) Rules 2014 and Regulation 44 of SEBI (Listings Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide e-voting services by Central Depository Services (India) Limited (CDSL). Members holding shares on cut-off date i.e. 21st day of September, 2017 may cast their vote electronically. Voting through electronic mode shall commence on 25th September, 2017 at 09.00 A.M. and end on 27th September, 2017 at 6.00 P.M.

The Board of Directors of the Company has appointed Mr. Gaurang R. Shah, Practising Company Secretary as Scrutinizer to scrutinize the e-voting procedure in a fair and transparent manner.

The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2017 to 28th September, 2017 for the purpose of Annual General Meeting of the Company.

For, International Housing Finance Corporation Ltd.
Sd/-
Mr. Sandip B. Padsala
Managing Director (DIN: 01870595)

Place: Ahmedabad
Date: 05/09/2017

BRIDGE SECURITIES LTD.
CIN : L67120GJ1994PLC023772
17, SUHAS NAGAR SOCIETY, NR DINESH HALL, ASHRAM ROAD, AHMEDABAD, GUJARAT INDIA - 380009
Tel: 079-26758808
E-mail: bridgesecurities@yahoo.co.in
Website: www.bridgesecurities.in

NOTICE OF THE 22nd ANNUAL GENERAL MEETING, EVOTING INFORMATION AND BOOK CLOSURE
Notice is hereby given that the 22nd Annual General Meeting of Bridge Securities Limited will be held on Thursday, 28th September, 2017 at 4.30 p.m. at the RADHE UPVAN, NR RUTURAJ FOUNDATION CLUB, HATHHUAN, MEHMEDABAD ROAD; AHMEDABAD to transact business as contained in the notice of the meeting.

The notice of 22nd AGM setting out the ordinary and special business (es) to be transacted thereat together with the Annual Report for the financial year 2016-17 has been sent to all the members electronically to the email id registered with the Company / Depository Participant and the physical copies has been posted to all the other members individually at the addresses registered with the Company. The physical dispatch / e-mail transmission of Notice and Annual Report has been completed on 6th September, 2017. A member can also download the Notice and Annual Report from the Company's Website i.e. www.bridgesecurities.in. Members may also request for a copy of the same by writing to the Company at bridgesecurities@yahoo.co.in or at the registered office address of the Company.

Further Notice is hereby given that pursuant to Section 108 of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulations 31(1) (b) of the SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members facility to cast their vote electronically to transacting all the business items as mentioned in the Notice of 22nd AGM of the Company through e-voting platform provided by Central Depository Services (India) Limited (CDSL) from a place other than the venue of the Meeting ("Remote e-voting").

Facility for voting through ballot paper shall also be made available at the AGM and the members who have not cast their vote through remote e-voting or ballot form shall be able to vote at the AGM.

Members who have cast their vote through remote e-voting or ballot form prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

The voting period begins on **25th day of September, 2017 at 09:00 a.m. and ends on 27th day of September, 2017 at 05:00 p.m.** The remote e-voting module shall be disabled by CDSL at 5.00 p.m. on 27th Day of September, 2017.

The cut-off date for determining the eligibility of Members for voting through remote e-voting as well as voting at the meeting is Saturday, September 21, 2017. Any person who becomes a member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as on the cut-off date i.e. September 21st, 2017 may obtain user id and password by sending a request at helpdesk.evoting@cdslindia.com or www.bridgesecurities.in.

Members who don't have access to remote e-voting facility, can vote in respect of the resolutions as set out in the Notice of AGM through ballot form which is enclosed with the Notice and also available at Company's Website i.e. www.bridgesecurities.in.

Members can opt for one mode of voting only i.e. remote e-voting or ballot form. In case members cast their votes through both the modes, voting done through remote e-voting shall prevail and votes cast through ballot form shall be treated as invalid.

In case of any queries or issues relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and remote e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

It is further notified that pursuant to Section 91 of the Companies Act, 2013 read with Companies (Management and Administration) Rule, 2014 made thereunder, The Register of Members and Share Transfer Books of the Company will remain closed from 21st September, 2017 to 28th September 2017 (both days inclusive) for the purpose of Annual General Meeting.

By order of the Board
For BRIDGE SECURITIES LTD.
Sd/-
Pragnesh Shah
Managing Director
(DIN : 00144888)

Date : 07th September, 2017
Place : Ahmedabad

BOARD MEETING
REAL NEWS & VIEWS LIMITED
(FORMERLY KNOWN AS REAL REALTY MANAGEMENT COMPANY LIMITED)
The Meeting of the Board of Directors of the Company will be held on 14.09.2017, at the registered office of the Company at 4th Floor, "KARM" Corporate House, Nr. New York Timber, Ambli - Bopal Road, Ahmedabad, Gujarat - 380059 to consider and approve, Unaudited Financial results for the quarter ended 30.06.2017.

ANAR INDUSTRIES LIMITED
The Meeting of the Board of Directors of the Company will be held on 14.09.2017, at the registered office of the Company at 4th Floor, "KARM" Corporate House, Nr. New York Timber Mart, Bopal Road, Ahmedabad, Gujarat - 380059 to consider and approve Unaudited Standalone Financial results alongwith Limited Review Report for the quarter ended 30.06.2017.

GUJARAT NATURAL RESOURCES LIMITED
The Meeting of Board of Directors of the Company will be held on 14/09/2017 at 8, Sigma Corporate, S. G. Highway, Bodakdev, Ahmedabad, to consider and approve the Unaudited Financial Results for the quarter ended on 30.06.2017

LESHA INDUSTRIES LIMITED
The Meeting of Board of Directors of the Company will be held on 14/09/2017 at 7th Floor, Ashoka Chambers, Mithakali Six Roads, Ahmedabad, to consider and approve Unaudited Financial Results for the quarter ended on 30.06.2017

CHANGE OF NAME
I have changed my old name from **RAMCHANDANI MOTU SUGNOMAL** to New Name **RAMCHANDANI MOTUMAL SUGNOMAL**
Add : 39, Old G Word Kubernagar, Ahmedabad

CHANGE OF NAME
I have changed my old name from **EMAR YUNUSBHAI BARAFWALA** to New Name **AHMER YUNUSBHAI MITHAIWALA**
Add : 2903, Khandani Sheri, Jamalpur, Ahmedabad

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House", Opp D-Mart, I.O.C. Petrol Pump Lane, Shivranjan Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad, Gujarat 380015 • CIN: L17110GJ1986PLC008942
Ph: 079-71001505 • E-Mail: cs.jindalworldwide@jswltd.com • Website: www.jindalworldwide.com

NOTICE
Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the 5th Meeting of the Board of Directors of the Company will be held on Thursday, 14th September, 2017 at 4.30 PM. at the Registered Office of the Company inter alia, to consider and approve the Unaudited Standalone Financial Results alongwith the Limited Review Report by the Auditor's thereof, of the Company for the quarter ended on 30th June, 2017 and to transact various other businesses, if any. The said information is available on the website of the Company (www.jindalworldwide.com), BSE Limited (www.bseindia.com) and NSE Limited (www.nseindia.com).
By order of the Board of Directors
Sd/- Mr. Amit Agrawal
Managing Director (DIN:00169061)

Unison Metals Ltd.
CIN No : L52100GJ1990PLC013964
Regd. Office : Plot No. 5015, Phase - IV, Nr. Ramol Cross Road, GIDC, Vatva, Ahmedabad - 382445 • Tel : 079 - 25841512
• E-Mail : unisonmetals@gmail.com • Web : www.unisongroup.net

NOTICE
Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, Notice is hereby given that meeting of Board of Directors of the Company is scheduled to be held on Thursday, September 14th 2017 at the Registered Office of the Company to inter-alia consider, approve and take on record the Unaudited Financial Results of the company for the quarter ended on 30th June 2017.

Further trading window under Securities and Exchange Board of India (Prohibition of insider Trading) Regulations, 2015 will remain closed for the Promoters/ Directors/ Officers/ Designated Employees of the Company from 7th September 2017 to 16th September 2017 (Both Days inclusive). This information will also be available on the website of the company www.unisongroup.net

For, Unison Metals Ltd.
SD/- Mahesh Chhangrani
Director
(DIN : 00153615)

Place : Ahmedabad
Date : 07/09/2017

LIPPI SYSTEMS LIMITED
CIN L22100GJ1993PLC020382
Reg. office; 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-IV, 132ft Ring Road, Satellite, Ahmedabad-380 015, Gujarat
E-mail id: office@lippiSYSTEMS.com, cs@lippiSYSTEMS.com
website: www.lippiSYSTEMS.com

NOTICE OF 24th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES
Notice is hereby given that the 24th Annual General Meeting ("AGM") of the Members of Lippi Systems Limited will be held on Friday, September 29, 2017 at 11:30 A.M. at the Registered Office of the Company situated at 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-IV, 132ft Ring Road, Satellite, Ahmedabad-380 015, Gujarat to transact the business as set out in the Notice of the AGM.

Notice is further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and as per SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from September 23, 2017 to September 29, 2017 (both days inclusive) for the purpose of AGM.

Pursuant to Provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended by the Companies (Management and Administration) amendment Rules, 2015 and Clause 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide members facility to exercise their right to vote at the AGM by electronic means and the business may be transacted through e-voting Services. The Company has engaged the Central Depository Services Limited (CDSL) as the agency to provide e-voting facility, to cast votes from a place other than the venue of the Meeting electronically ("remote e-voting"). All the members are informed that:

- The business as set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means.
- The remote e-voting shall commence on September 25, 2017 (9:00 a.m.)
- The remote e-voting shall end on September 28, 2017 (6:00 p.m.)
- The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is September 22, 2017.
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after the dispatch of AGM Notice and

લીક ડ્રામ ક્રામ લિમિટેડ
 રજી. ઓફીસ: ૧૬૨, જીઆઈડીસી એસ્ટેટ, નંદેસરી-૩૬૧૩૪૦
 CIN: L22300GJ1984PLC007546. Web: www.lippharmachem.com.in
 Phone No. 0265-3065500 / Email: lippharmachem@gmail.com

૩૨મી વાર્ષિક સાધારણ સભાના આયોજન તેમજ ઈ-વોટિંગની જાહેરાત અને બુક ક્લોઝર અંગે સૂચના
 અમે સૂચના આપવામાં આવે છે કે, કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ગુરુવાર, તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગે એનઆઇએલ ઓફ, પ્લોટ નં. ૧૩૪/૧, જીઆઈડીસી એસ્ટેટ, સોલિડ સ્ટેટ્સ સીટી સામે, નંદેસરી-૩૬૧૩૪૦ ખાતે યોજાશે છે. જેમાં એજીએમ યોજવાની સૂચનામાં દર્શાવ્યા પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમે એવી પણ સૂચના આપવામાં આવે છે કે કંપનીઓની ધારા, ૨૦૧૩ની કલમ ૯૧ તેમજ સેબી (એલ.ઓ.ડી.આર) ૨૦૧૫ના નિયમોનો ૪૨ અને ૪૩ની જોગવાઈઓને અનુસરીને સભાસભીનું રજીસ્ટર તેમજ શેર બહારથી રજીસ્ટર શુક્રવાર, તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭થી ગુરુવાર તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ (બંને દિવસો સહિત) સુધી કંપનીની વાર્ષિક સાધારણ સભા ફેલોલર બંધ રહેશે.

કંપની જણાવવા માંગે છે કે તે એજીએમની કાર્યવાહીમાં સભાસભી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઈલેક્ટ્રોનિક સાધનોથી ઈ-વોટિંગની સુવિધાનું આયોજન સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીસીએલ) દ્વારા થશે છે. ઈ-વોટિંગની શરૂઆત સોમવાર તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સવારના ૧૦.૦૦ વાગે થશે અને તેનું સમાપન બુધવાર તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સાંજના ૫.૦૦ વાગે થશે. સભાસભી દ્વારા જે શેર અથવા મત આપી દેશે તે પછી તેને બદલવા દેવામાં નહીં આવે. મતાધિકારની અધિકાર ગુરુવાર તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ (કેટ ઓફ તારીખ)ના રોજ સભાસભી દ્વારા ધરવા જશે. ઈ-વોટિંગની સંખ્યા પ્રમાણેનો રહેશે. જો સભાસભી ઉપરોક્ત તારીખે શેર ધારક કરતા શેરો તે જ તેઓ ઈલેક્ટ્રોનિક સીડીસીએલ દ્વારા અધિકૃત આપશે. એજીએમની સૂચનામાં ઈ-વોટિંગની પ્રક્રિયા જણાવવામાં આવી છે. ઈ-વોટિંગને લગતી કોઈપણ સમસ્યા માટે CDSLના વારંવાર પૂછતા પ્રશ્નોના નેજા હેઠળ માર્ગદર્શન અને CDSLની મદદ વિભાગમાં ઈ-મેઇલ લખીને સમાધાન લાવી શકાય છે.

બોર્ડના કક્ષમાં
 લીક ડ્રામ ક્રામ લિમિટેડ
 સીનિયર ડાયરેક્ટર
 તા. ૦૬-૦૯-૨૦૧૭
 સ્થળ: વડોદરા

GOLDEN CAPITAL SERVICES LIMITED
 Regd. Office: 1st floor, b/177, sector-8, Dwarka, New Delhi - 110075
 Corporate Ofc: 1st Floor, Trans House, Near Hamor Restaurant, Navrangpura, Ahmedabad-380009
 CIN: U74899DL1994PLC057393 www.goldencapitalservices.in
 PH: 079-65412089 E-MAIL: goldencapitalservicesltd@gmail.com

NOTICE
 NOTICE is hereby given that the Annual General Meeting ("AGM") of the Company will be held on Saturday, 30th September, 2017 at 11:00 am at the Registered Office of the Company to transact the business set out in the notice of the AGM.

NOTICE is further given that, pursuant to Section 91 of the Companies Act 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, and in accordance with Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from, 21st September, 2017 to 30th September, 2017 (both days inclusive) for the purpose of Annual General Meeting.

The facility for voting through ballot paper shall be made available at the AGM; (b) a person whose name appears in the Register of Members / List of Beneficial Owners, received from NSDL / CDSL as on close of business hours on Friday, 18th August, 2017 only shall be entitled to vote at the AGM through ballot papers.

The Annual Report along with the Notice has been dispatched to members by permitted mode. The Notice of the AGM and the Annual Report for 2016-17 are also available at the Company's website www.goldencapitalservices.in

By Order of the Board
 Sd/-
 Jaiminkumar Shah
 Director
 DIN: 0690281

Date: 7th September, 2017
 Place: Ahmedabad

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.
-જાહેરખબર મેનેજર

BOARD MEETING
REAL NEWS & VIEWS LIMITED
 (FORMERLY KNOWN AS REAL REALTY MANAGEMENT COMPANY LIMITED)
 The Meeting of the Board of Directors of the Company will be held on 14.09.2017, at the registered office of the Company at 4th Floor, "KARM" Corporate House, Nr. New York Timber Mart, Bopal Road, Ahmedabad, Gujarat - 380059 to consider and approve, Unaudited Financial results for the quarter ended 30.06.2017.

ANAR INDUSTRIES LIMITED
 The Meeting of the Board of Directors of the Company will be held on 14.09.2017, at the registered office of the Company at 4th Floor, "KARM" Corporate House, Nr. New York Timber Mart, Bopal Road, Ahmedabad, Gujarat - 380059 to consider and approve Unaudited Standalone Financial results alongwith Limited Review Report for the quarter ended 30.06.2017.

GUJARAT NATURAL RESOURCES LIMITED
 The Meeting of Board of Directors of the Company will be held on 14/09/2017 at 8, Sigma Corporate, S.G.Highway, Bodakdev, Ahmedabad, to consider and approve the Unaudited Financial Results for the quarter ended on 30.06.2017.

LESHA INDUSTRIES LIMITED
 The Meeting of Board of Directors of the Company will be held on 14/09/2017 at 7th Floor, Ashoka Chambers, Mithakali Six Roads, Ahmedabad, to consider and approve Unaudited Financial Results for the quarter ended on 30.06.2017.

JINDAL WORLDWIDE LIMITED
 Regd. & Corp. Office: "Jindal House", Opp D-Mart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal, 132 Ft Ring Road, Satellite, Ahmedabad, Gujarat 380015 • CIN: L17110GJ1986PLC008942
 Ph: 079-71001500 • E-Mail: cs@jindalworldwide.com • Website: www.jindalworldwide.com

NOTICE
 Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the 5th Meeting of the Board of Directors of the Company will be held on Thursday, 14th September, 2017 at 4.30 P.M. at the Registered Office of the Company inter alia, to consider and approve the Unaudited Standalone Financial Results alongwith the Limited Review Report by the Auditor's Report of the Company for the quarter ended on 30th June, 2017 and to transact various other business, if any.

The said information is available on the website of the Company (www.jindalworldwide.com), BSE Limited (www.bseindia.com) and NSE Limited (www.nseindia.com).
 By order of the Board of Directors
 Sd/- (Mr. Amit Agrawal)
 Managing Director (DIN: 019160661)
 Date: 7th September, 2017
 Place: Ahmedabad

NOTICE : Stock Share Certificate Missing
 NOTICE hereby gives that the certificate(s) in respect of below mentioned Equity shares of the company has / have been lost / misplaced / stolen and the holder(s) of the said shares has / have applied to the company for issue of Duplicate share Certificate(s) in lieu of the original share certificate(s).

SR. NO.	NAME OF SHARE HOLDER	FOLIO NO.	NO. OF SHARES	CERTIFICATE NO.	DISTINCTIVE NO.
1	VISHNU PARSHOTTAM PATEL	V0000873	100	17338 / 339	2643901/14000

Public is cautioned against purchasing or otherwise dealing with the above mentioned share certificates. Any person having claims / objections in the said shares, should communicate to the Company at the Registered office of the company within 15 days from the date of publication of this notice.

Failing which the Company shall proceed to issue Duplicate Share Certificates. For, VADILAL INDUSTRIES LIMITED SD/- COMPANY SECRETARY

B. NANJI ENTERPRISES LIMITED
 CIN: L45201GJ1982PLC005148
 Regd. Office: "Moorti Bungalows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015. Ph: 079- 65214174 / 64502351
 Email id: bnanji@hotmail.com Website: www.bnanji.com

NOTICE
 NOTICE is hereby given that the 35th Annual General Meeting of the members of the Company will be held on Thursday, 28th September, 2017 at 10.30 a.m. at the Registered Office at "Moorti Bungalows", 5, Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad- 380015 to transact the business as set out in the Notice of the said Annual General Meeting.

Notice of the AGM together with Annual Report for the F.Y. 2016-2017 has been sent to all members by permitted mode at their address registered with the company and/ or electronically to those members who have registered their email address registered with the company or their respective Depository. The notice of AGM inter alia indicating the process and manner of E-Voting process can also be downloaded from the website of CDSL at www.evotingindia.com.

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of Companies (Management and Administration) Rules 2014 and Regulation 44 of SEBI (Listings Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide e-voting services by Central Depository Services (India) Limited (CDSL). Members holding shares on cut-off date i.e. 21st day of September, 2017 may cast their vote electronically. Voting through electronic mode shall commence on 25th September, 2017 at 09.00 A.M. and end on 27th September, 2017 at 6.00 P.M.

The Board of Directors of the Company has appointed Mr. Gaurang R. Shah, Practising Company Secretary as Scrutinizer to scrutinize the e-voting procedure in a fair and transparent manner.

The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2017 to 28th September, 2017 for the purpose of Annual General Meeting of the Company.

For, B. Nanji Enterprises Ltd.
 SD/-
 Mr. Fakhruddin Jadaliwala
 Company Secretary
 Place: Ahmedabad
 Date: 05/09/2017

શ્રી બેન્ગલોઝેન ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ
 [CIN: L25200GJ1992PLC017838] રજી. ઓફીસ: સર્વ નં.૩૦૬ સુકદના-બાદરા વોડ, ગામ: મોશી, તાલુકો: સાવલી, જિલ્લો: વડોદરા-૩૬૧૩૦૦, ગુજરાત.

ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મતાધાર
 શ્રી બેન્ગલોઝેન ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ કંપનીની વાર્ષિક સાધારણ સભા (એજીએમ) શનિવાર ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સર્વ નં ૩૦૬ સુકદના-બાદરા વોડ, ગામ: મોશી, તાલુકો: સાવલી, વડોદરા, ખાતે રાખવામાં આવેલ છે. જે માટે કંપની પોતાના શેરહોલ્ડરોને એજીએમ સીવાયના સ્વયંચાલી ઈલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિ ("રીમોટ ઈ-વોટિંગ") દ્વારા મત આપવાની સુવિધા આપતા આનંદ અનુભવે છે. એજીએમ માટે કંપનીનું શેરધારકો નું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક સતીરમ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૭ (શનિવાર) થી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૭ (શનિવાર) (બંને દિવસ સહિત) સુધી બંધ રહેશે. આના સંદર્ભમાં નોટીસ આપવામાં આવે છે કે કંપનીએ એજીએમ માટેની નોટીસ શેરહોલ્ડરોને મોકલવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. ૨૦૧૭ના રોજ પડે છે. આ નોટીસમાં દર્શાવવામાં આવેલ કાર્યો ઈલેક્ટ્રોનિક સાધનોથી હાથ ધરવામાં આવશે. શેરહોલ્ડરોએ ઈલેક્ટ્રોનિક સાધનોથી મતાધાર કરવા માટે www.evotingindia.com પર લોગ ઓન કરવું જરૂરી છે. ઈ-વોટિંગ કરવા માટેની વિગતવાર પ્રક્રિયા નોટીસમાં દર્શાવવામાં આવી છે.

રીમોટ રીમોટ ઈ-વોટિંગનો સમય ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે શરૂ થાય છે અને ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પૂરું થાય છે. જે શેરહોલ્ડરોએ રીમોટ રીમોટ ઈ-વોટિંગ દ્વારા મતાધાર કરવું હોય તેઓ પછા આ સભા માં હાજરી આપી શકશે પરંતુ તેઓ ફરીવાર મતાધાર કરવાનો અધિકાર નહીં વાળે. જેઓ કટ-ઓફ તારીખ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધીમાં કંપનીના શેર ધારકના શેરહોલ્ડરો હોય તેઓ રીમોટ રીમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા મુદ્દતક દ્વારા એજીએમમાં મતાધાર કરી શકશે. કોઈપણ વ્યક્તિ કે જે આ નોટીસ મોકલવા માટે કંપનીના શેર મેળવનાર કંપનીના સભ્ય બન્યા હોય તે helpdesk.evoting@cdslindia.com પર વિનંતી કરીને લોગ ઈન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત કરી શકે છે. આ રીમોટ ઈ-વોટિંગ મોડ્યુલ સીડીસીએલ દ્વારા થતું મતાધાર ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ (સાંજે ૫:૦૦ કલાકે) બંધ કરી દેવામાં આવશે.

કંપનીના વાર્ષિક રીપોર્ટ અને એજીએમની નોટીસ, એટલેક-વ સ્વીપ અને પ્રોક્ષી કાર્ય બંધ રીનિશ્ચય માટે કંપનીની રજીસ્ટર ઓફિસમાં ઉપલબ્ધ છે. એજીએમની નોટીસ સીડીસીએલની વેબસાઇટ (www.evotingindia.com) ઉપર પણ ઉપલબ્ધ થશે.

ઈ-વોટિંગ સંબંધિત સભ્યોને કોઈપણ પ્રશ્નો અથવા મુદ્દાઓ હોય તો તેઓ www.evotingindia.com પર મદદ વિભાગની સંદર્ભ ઉપલબ્ધ પુસ્તિકામાં અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો (FAQs) સંદર્ભ લો અથવા તો helpdesk.evoting@cdslindia.com ઉપર ઈમેલ કરી અથવા તો જે સભ્યોને મોકલેલ બેલેટ અથવા ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા મતાધાર સાથે જોડાયેલ બેલેટની ફરીવાર હોય તો તેઓ પાલન અધિકારી શ્રીમતી કિશ્ક શાહ ને સર્વ નં ૩૦૬, સુકદના-બાદરા વોડ, ગામ: મોશી, તાલુકો: સાવલી, વડોદરા, ગુજરાત, કોન નં. ૦૨૬૫-૨૩૫૪૪૧, ઈમેઇલ benzophen@hotmail.com ઉપર પણ લખી શકે છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના આદેશથી
 શ્રી બેન્ગલોઝેન ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ વતી
 તારીખ: ૦૬.૦૯.૨૦૧૭
 સહી/ ભરતચંદ્ર સોહા મેનેજિંગ ડિરેક્ટર

INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LIMITED
 CIN: L65910GJ1990PLC014436
 Regd. Office: "Moorti Bungalows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad-380015.
 Ph: 079- 65214174 / 64502351 Email id: ihfcd@hotmail.com Website: www.ihfcd.com

NOTICE
 NOTICE is hereby given that the 27th Annual General Meeting of the members of the Company will be held on Thursday, 28th September, 2017 at 11.30 a.m. at the Registered Office at "Moorti Bungalows", 5, Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundervan, Satellite, Ahmedabad- 380015 to transact the business as set out in the Notice of the said Annual General Meeting.

Notice of the AGM together with Annual Report for the F.Y. 2016-2017 has been sent to all members by permitted mode at their address registered with the company and/ or electronically to those members who have registered their email address registered with the company or their respective Depository. The notice of AGM inter alia indicating the process and manner of E-Voting process can also be downloaded from the website of CDSL at www.evotingindia.com.

Pursuant to the provisions of section 108 of the Companies Act, 2013, read with Rule 20 of Companies (Management and Administration) Rules 2014 and Regulation 44 of SEBI (Listings Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide e-voting services by Central Depository Services (India) Limited (CDSL). Members holding shares on cut-off date i.e. 21st day of September, 2017 may cast their vote electronically. Voting through electronic mode shall commence on 25th September, 2017 at 09.00 A.M. and end on 27th September, 2017 at 6.00 P.M.

The Board of Directors of the Company has appointed Mr. Gaurang R. Shah, Practising Company Secretary as Scrutinizer to scrutinize the e-voting procedure in a fair and transparent manner.

The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2017 to 28th September, 2017 for the purpose of Annual General Meeting of the Company.

For, International Housing Finance Corporation Ltd.
 Sd/-
 Mr. Sandip B. Padsala
 Managing Director (DIN: 01870595)
 Place: Ahmedabad
 Date: 05/09/2017

LIPPI SYSTEMS LIMITED
 (CIN: L22100GJ1993PLC020382)
 Regd. Office: 3rd Floor, Satya complex, Nr. Ashwamegh IV, 132 Ft Ring Road, Satellite, Ahmedabad-15
 www.lippiSYSTEMS.com, Ph. no. : (079)26750060/61/62, Email: cs@lippiSYSTEMS.com.

NOTICE
 Notice is hereby given that Pursuant to Regulation 29 read with Regulation 47(1)(a) of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 that the Board of Directors Meeting of LIPPI SYSTEMS LIMITED will be held on Thursday the 14th day of September, 2017 at the Registered office of the Company at 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-IV, 132ft Ring Road, Satellite, Ahmedabad-380015 at 04:00 P.M to inter-alia consider & take on record the Un-Audited Financial Results for Quarter Ended on 30th June, 2017. Information in this regard is also available on the website of the company i.e. www.lippiSYSTEMS.com and on the website of stock exchange i.e. www.bseindia.com

For, LIPPI SYSTEMS LIMITED
 S/d
 Darshan B Shah
 (Company Secretary)
 Date : 05.09.2017
 Place : Ahmedabad.

Unison Metals Ltd.
 CIN No : L52100GJ1990PLC013964
 Regd. Office : Plot No. 5015, Phase - IV, Nr. Ramol Cross Road, GIDC, Vatva, Ahmedabad - 382445 • Tel : 079 - 25841512
 • E-Mail : unisonmetals@gmail.com • Web : www.unisongroup.net

NOTICE
 Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, Notice is hereby given that meeting of Board of Directors of the Company is scheduled to be held on Thursday, September 14th 2017 at the Registered Office of the Company to inter-alia consider, approve and take on record the Unaudited Financial Results of the company for the quarter ended on 30th June 2017.

Further trading window under Securities and Exchange Board of India (Prohibition of insider Trading) Regulations, 2015 will remain closed for the Promoters/ Directors/ Officers/ Designated Employees of the Company from 7th September 2017 to 16th September 2017 (Both Days inclusive)

This information will also be available on the website of the company i.e. www.unisongroup.net

For, Unison Metals Ltd.
 SD/- Mahesh Chhangrani
 Director
 Place : Ahmedabad
 Date : 07/09/2017
 (Din : 00153615)

LIPPI SYSTEMS LIMITED
 CIN L22100GJ1993PLC020382
 Reg. office; 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-IV, 132ft Ring Road, Satellite, Ahmedabad-380 015, Gujarat
 E-mail id: office@lippi.com, cs@lippiSYSTEMS.com
 website: www.lippiSYSTEMS.com

NOTICE OF 24th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES
 Notice is hereby given that the 24th Annual General Meeting ("AGM") of the Members of Lippi Systems Limited will be held on Friday, September 29, 2017 at 11:30 A.M. at the Registered Office of the Company situated at 3rd Floor, Satya Complex, Opp. IOC Petrol Pump, Nr. Ashwamegh-IV, 132ft Ring Road, Satellite, Ahmedabad-380 015, Gujarat to transact the business as set out in the Notice of the AGM.

Notice is further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and as per SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from September 23, 2017 to September 29, 2017 (both days inclusive) for the purpose of AGM.

Pursuant to Provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended by the Companies (Management and Administration) amendment Rules, 2015 and Clause 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide members facility to exercise their right to vote at the AGM by electronic means and the business may be transacted through e-voting Services. The Company has engaged the Central Depository Services Limited (CDSL) as the agency to provide e-voting facility, to cast votes from a place other than the venue of the Meeting electronically ("remote e-voting"). All the members are informed that:

- The business are set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means.
- The remote e-voting shall commence on September 25, 2017 (9:00 a.m.)
- The remote e-voting shall end on September 28, 2017 (6:00 p.m.)
- The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is September 22, 2017.
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after the dispatch of AGM Notice and holding shares as on the cut-off date i.e., September 23, 2017 may obtain login ID and password by sending request at the helpdesk.evoting@cdslindia.com.
- Members voting may note that: a) The remote e-voting module shall be disabled by CDSL beyond 6:00p.m. on September 28, 2017 and once vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) The facility for voting through ballot paper shall be made available at the AGM, for the members who could not exercise their vote through remote e-voting; c) The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility for remote e-voting or voting at the AGM through ballot paper.
- The Company has appointed Mr. Nirav Soni, Practising Company Secretary having Certificate of Practice No. 14695 and Membership No. 39566 as the Scrutinizer to scrutinize the voting and remote e-voting process in a fair and transparent manner.
- The Notice of 24th AGM and full Annual Report is available on the Company's website www.lippiSYSTEMS.com and also on the CDSL's website www.cdslindia.com.
- In case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for the Shareholders and e-voting user manual for Shareholders available at the Downloads section of www.evotingindia.com or contact CDSL by Email ID: helpdesk.evoting@cdslindia.com.

For, LIPPI SYSTEMS LIMITED
 Place : Ahmedabad
 Date : September 04, 2017
 Darshan B Shah
 Company Secretary

એડવાન્સ પેટ્રોકેમિકલ્સ લી.
 (CIN L23200GJ1985PLC008013)
 રજી ઓફીસ ૩૬, કોંક્રીટ માઈટ, હીરાભાઈ માઈટની સામે અમદાવાદ-૨૨
 Tel: 079 25454795 Fax 079 25710027
 Email: info@advanccpetro.com website: www.advancpetro.com

૩૨મી એજીએમની નોટિસ, રિમોટ ઈવોટિંગ અને બુક બંધ થવા અંગે

- આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીના સભ્યોની ૩૨મી વાર્ષિક સામાન્ય સભા શુક્રવાર, તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ બપોરે ૧૨:૩૦ વાગે પ્લોટ નં. ૧૬૭, પિરાણા પ્રોપ્રાયટી, ગામ પીપલજ, અમદાવાદ-૩૮૨૪૦૫ ખાતે, તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૧૭ની સામાન્ય સભાની નોટિસમાં નક્કી કર્યા પ્રમાણે કામકાજ હાથ ધરવા મળશે.
- એજીએમની નોટિસની ઈલેક્ટ્રોનિક નકલો અને કંપનીના ૨૦૧૭ના વર્ષના વાર્ષિક અહેવાલ બધા સભ્યોને કંપનીના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ સાથે નોંધાયેલા ઈમેલથી મોકલવામાં આવ્યા છે. આ બાબતે કંપનીની વેબસાઇટ www.advancpetro.com પર ઉપલબ્ધ છે. એજીએમની નોટિસ અને ૨૦૧૭નો વાર્ષિક રિપોર્ટ પરમીટેડ મોડમાં તેમના રજીસ્ટર્ડ સરનામે અન્ય બધાજ સભ્યોને મોકલવામાં આવ્યા છે. મોકલવાની કામગીરી તા. ૪.૯.૨૦૧૭ના રોજ પુરી કરવામાં આવી છે. સભ્યો આ નોટિસ અને વાર્ષિક અહેવાલ ફીડબેક ફોર્મમાં મેળવવા હક્કદાર છે. તેઓ લેખિતમાં આ અંગે તેમની વિનંતી કંપનીની રજીસ્ટર્ડ ઓફિસે કરી શકે છે. તેમજ ઈમેલ info@advanccpetro.com મોકલી શકે છે.
- કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) ટ્રસ્ટ, ૨૦૧૪ સુધ્યામાં મુજબ અને રેગ્યુલેશન ૪૪ ઓફ સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન ૨૦૧૫ મુજબ નિયમ ૨૦ સાથે વાંચતા કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઈઓના ફોર્મલીયસમાં કંપની આ બધા સભ્યોને એજીએમના સ્થળ કરતા અન્ય સ્થળેથી વોટ આપવા માટે રિમોટ ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડે છે. કંપનીએ આ હેતુ માટે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિ. (સીડીએસએલ)ની સેવાઓ લીધી છે.
- સભ્યોનું રજીસ્ટર અને કંપની શેર ટ્રાન્સફર બુક ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે.
- બધા સભ્યોને જણાવવામાં આવે છે કે
 (૧) એજીએમની નોટિસમાં નક્કીકર્યા મુજબનું કામકાજ ઈલેક્ટ્રોનિક્સ સાધનો દ્વારા હાથ ધરવામાં આવશે.
 (૨) ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા કે એજીએમમાં યોગ્યતા નક્કી કરવાની કટ-ઓફ તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭ છે.
 (૩) રિમોટ ઈ-વોટિંગ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ (સવારે ૯.૦૦) વાગે શરૂ થશે. અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ (સાંજે ૫.૦૦) વાગે પુરુ થશે.
 (૪) સભ્યોના વોટિંગનો અધિકાર કટ ઓફ તારીખ એટલે કે ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ તેમના કંપનીના પેઈડઅપ ઈકવીટી શેર મુડીના શેરના પ્રમાણમાં રહેશે.
 (૫) કોઈપણ વ્યક્તિ. એજીએમની નોટિસ મોકલવા બાદ કંપનીના શેરો પ્રાપ્ત કરે કે સભ્ય બને અને કટ ઓફ તારીખ એટલે કે ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ શેરો ધરાવતી હોય તે www.cdslindia.com તેમની વિનંતી લોગીન આઈડી અને પાસવર્ડથી કરીને તે મેળવી શકે છે. આમ છતાં તેમ સીડીએસએલમાં ઈ-વોટિંગ રજીસ્ટર્ડ કરાવ્યું હોય તો પછી હાલના યુઝર આઈડી અને પાસવર્ડ/પીન નોટ આપવા માટે છે.
 (૬) સભ્યો, જેમણે એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગથી તેમનો વોટ આપ્યો છે, તેઓ એજીએમમાં હાજર રહી શકશે પરંતુ તેઓ ફરીથી તેમનો વોટ આપવા હક્કદાર રહેશે નહીં.
 (૭) બેલેટ પેપરથી વોટિંગની સુવિધા એજીએમમાં ઉપલબ્ધ કરવામાં આવશે. અને એજીએમમાં હાજરી આપતા સભ્યો જેમણે રિમોટ ઈ-વોટિંગથી તેમના વોટ આપ્યો નથી. તેઓ બેલેટ પેપરથી એજીએમમાં તેમના અધિકારનો ઉપયોગ કરી શકશે.
 (૮) ૩૨મી એજીએમની નોટિસ કંપનીની વેબસાઇટ www.advancpetro.com અને સીડીએસએલની વેબસાઇટ www.cdslindia.com પર પ્રાપ્ય છે.
 (૯) ઈ-વોટિંગને લગતી વિસ્તૃત સૂચનાઓ માટે એજીએમની નોટિસમાં નોંધ જોવા વિનંત છે. ઈ-વોટિંગની પ્રોસીજરને લગતી કોઈપણ પુચ્છા કે ફરિયાદોની બાબતમાં શેર હોલ્ડરો કંપનીના રજીસ્ટર્ડ ઓફિસ ખાતે કંપનીના સેક્રેટરીયલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધી શકે છે કે જણાવવા મુજબ ઈ-મેલ આઈડી કોન્ટ્રાક્ટ નંબર પર સંપર્ક કરી શકે છે.

એડવાન્સ પેટ્રોકેમિકલ્સ લીમિટેડ વતી
 સહી/-
 અશોક ગોએલ્ડા
 મેનેજિંગ ડાયરેક્ટર
 તારીખ: ૦૭.૦૯.૨૦૧૭
 સ્થળ : અમદાવાદ
 તારીખ: ૦૭.૦૯.૨૦૧૭

Ola launches Partner World - a one stop shop for all Driver Partners' needs

Bengaluru, India's most popular mobile app for transportation, Ola has announced the launch of Ola Partner World (OPW), a one stop shop for all needs of driver partners registered on the platform. Ola Partner World will cater to their various professional and personal needs in a sprawling ambience with best in class facilities. Spread over 20,000 square feet, the first Ola Partner World was piloted in Bengaluru at Murugeshpalya, earlier this month for select driver partners and has now been opened up to all partners. Ola plans to extend such a facility to other cities in the country over the course of this year. Built and designed with the needs of driver partners in mind, this centre aims to provide a range of value-added services that go be-

yond partner's work-related requirements. Some of the key facilities and services include an in-house pharmacy that enables purchase of medicines at discounted prices, a resident physiotherapist for consultations and treatment at affordable prices as well as regular medical check-ups to ensure the wellbeing of driver partners and their families. Ola Partner World also brings driver partners, access to a wide range of car manufacturers, dealers, financial support, insurers and maintenance centres with best in market price points, all under one roof. As entrepreneurs, every driver-partner will find the Ola Partner World as a place to easily access all services under one roof at a time without having to take the hassle of moving from one place to another.

Commenting on the launch of OPW, Vishal Kaul, Chief Operating Officer, Ola said, "At Ola, over 800,000 driver partners realize their entrepreneurial dream, in our shared mission of building mobility for a billion Indians. Ola Partner World is our dedication to what we think is the largest group of micro-entrepreneurs on any platform in this country to make their professional and personal lives easier. This is also a testament to the scale of the Ola platform, where various service providers see imminent value in serving such a large audience of consumers under one roof. We are thrilled to be enabling professional and personal growth for both our driver partners and their families, by giving them access to best in class support and services, all under one roof."

Sena criticises Modi's bullet train project

Mumbai, Severely criticising the Mumbai-Ahmedabad bullet train project, ruling NDA ally Shiv Sena on Thursday dismissed it as Prime Minister Narendra Modi's "expensive dream" which will "loot the nation of Rs 108,000 crore".

Moreover, the newly-appointed Railway Minister Piyush Goyal -- who is also the BJP treasurer -- has been specifically brought in only for this project, the Sena said, adding "as part of the ruling Bharatiya Janata Party's 'policy of transparency'."

The foundation stone of India's first high-speed rail project was jointly laid in Ahmedabad on Thursday by Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe.

"Japan will bring everything for the project - from nails to rails, manpower to technology and even cement-concrete... The land and money will come from Gujarat and Maharashtra, and Tokyo will rake in all the profits. But, despite the loot and fraud, all are congratulating Modi's pet project," the Shiv Sena said in sharp edits in the party's mouthpieces "Saamana" and "Dopahar Ka Saamana".

The Sena also pointed out that Mumbai's overburdened and unsafe suburban rail network was suffering for lack of funds and improvement, many incomplete rail projects languish

in the state.

"However, bullet trains will now zip between Ahmedabad-Mumbai without anybody even asking for it."

"Bullet Train is not India's ordinary masses' dream... It will cater only to the rich and wealthy classes for which Goyal has been specially chosen... and to give something 'new' to the industrialists of Gujarat where elections are coming up shortly," the Sena pointed out.

Recalling past mega-

Global cues, short-covering buoy equity markets

Mumbai, Broadly positive Asian markets and healthy buying in oil and gas stocks buoyed the Indian equity markets during the early morning trade session on Thursday. According to market observers, healthy buying was witnessed in oil and gas, healthcare and banking stocks. Around 9.40 a.m., the wider 51-scrip Nifty 50 of the National Stock Exchange (NSE) traded higher by 42.70 points, or 0.42 per cent to 10,122 points. The 30-scrip Sensitive Index (Sensex) of the BSE, which opened at 32,289.26 points, traded at 32,306.44 points -- up 120.03 points, or 0.37 per cent, from its previous close at 32,186.41 points.

Madhya Pradesh Today Media Ltd. IPO Opens On 19 September, 2017

Ahmedabad, Madhya Pradesh Today Media Ltd., one of the leading daily newspaper brands with 13 editions and a circulation of around 20 lakhs copies across Madhya Pradesh, Chattisgarh, Maharashtra, Delhi and Uttar Pradesh opens its Initial Public Offering (IPO) on 19 September 2017. The Company's IPO (IPO) is of 21,46,500 equity shares of face value of Rs. 10/- each fully paid up for cash at a price of Rs. 66 per equity share aggregating Rs. 1416.69 lakhs. This would constitute 47.01% of the post issue equity share capital. The shares would be listed on NSE Emerge platform and the IPO will close on 21 September 2017. Mark Corporate Advisors Private Limited is the sole Lead Manager to the Issue.



expansion of business by upgrading unit offices in various cities in Madhya Pradesh and Chattisgarh, working capital requirements, general corporate expenses and Issue expenses. Madhya Pradesh Today Media Ltd. publishes 13 morning daily newspaper editions under the name of 'Pradesh Today' from Bhopal, Indore, Gwalior, Jabalpur, Rewa, Katni, Sagar, Ujjain, Maharashtra, Uttar Pradesh, Delhi, Chhindwara and Raipur besides two evening editions from --- Bhopal and Jabalpur. The

Company also manages an online news portal www.pradeshtoday.com. Pradesh Today was first launched in 2010 in Madhya Pradesh. Madhya Pradesh Today Media Ltd. has clocked the turnover of Rs. 192,755,007, Rs. 152,425,146 and Rs. 154,115,764 for the fiscal year ending 2017, 2016 and 2015 and profits of Rs. 23,302,760, Rs. 6,521,908 and Rs. 4,199,171 respectively. Last year, over 90% of its revenue came from advertising while the rest from the sale of newspaper copies.

Water and Sanitation Management Organization

3rd Floor, Jalsewa Bhawan, Sector 10-A, Gandhinagar - 382 010
Tel.: 079-2324 7170-71, 2323 7075 Fax: 2324 7485 Website: www.wasmo.org e-mail: wasmo@wasmo.org

Walk-in-Interview
Walk-in-interview will be conducted at WASMO as under.

Sr. No.	Name of Post	Tentative Post	Maximum Age limit (as on 31.08.17)	Prefer Districts	Educational Qualification & Experience Criteria	Monthly Fixed Remuneration Rs/-
1.	Content Developer	01	35 Yrs.	Head Office Gandhinagar	Master Degree in any discipline having minimum 5 years of work experience in Rural sector. Candidate having good writing skills in English with research oriented knowledge will be preferred.	Negotiable
2.	Dy. Manager (F&A)	04	40 Yrs.	Dahod, Dang, Godhara, Valsad	CA/ ICWA/ Inter CA/ MBA (Finance) with relevant working experience of minimum 1 year having knowledge of Tally software. (Working Experience in Government Sector will be preferred).	25,000/-

Interested candidates may download application form from WASMO's website www.wasmo.org regarding. Further details of fix remuneration, eligibility criteria, age limit etc. Walk-in-interview will be conducted on 19th September, 2017 at 10.00 am onwards at Staff Training College, Old MLA Quarters, Sector 17, Gandhinagar-382016. Candidates will not be entitled for any TA/DA etc. These posts are purely on 11 months contract basis. Chief Executive Officer, WASMO will be the final authority.

Sd/-
Project Director
WASMO, Gandhinagar

INF/1644/17-18

UNISON METALS LIMITED

(CIN NO. :- L52100GJ1990PLC013964)
Regd. Off. : Plot No. 5015, Phase-IV, Ramol Char Rasta, G.I.D.C., Vatva, Ahmedabad - 382445.
Tel : 079-25841512 • E-mail : unisonmetals@gmail.com • Web : www.unisongroup.net

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017

Sr. No.	Particulars	Rs. In Lacs	
		Quarter ended	Quarter ended
		30/06/2017	30/06/2016
		Unaudited	Unaudited
		(Refer Note No 3)	
1	Total Income from operations	1,845.84	1,512.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	19.27	17.07
3	Net Profit / (Loss) for the period before Tax, (After Exceptional and / or Extraordinary Items)	19.27	17.07
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional and / or Extraordinary Items)	10.02	11.74
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) & other Comprehensive Income (after tax)]	9.80	11.54
6	Equity Share Capital (Face Value Rs.10/- per shares)	320.42	320.42
7	Reserves (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	---	---
8	Earnings Per Share (EPS) Basic & diluted EPS for the period Rs. 10 per share Basic EPS per share Diluted EPS per share	0.31 0.31	0.36 0.36

Notes :
1) Above results have been reviewed by Audit committee and approved by board of directors as on meeting held on 14th September, 2017. The Statutory Auditors of the Company have conducted a "Limited Review" of the above Standalone Unaudited Financial Results for the Quarter ended June 30, 2017.
2) The Company has adopted Ind AS with effect from 1st April, 2017. Therefore, Ind AS transition date is w.e.f. 1st April 2016 and for that purpose comparative figures of 30th June 2016 is restated. Accordingly, the impact of transition has been provided and figures for that period has been restated accordingly. The financial results of the company have been prepared in accordance with Indian Accounting Standards prescribed under section 133 of the companies Act, 2013 read with relevant rules thereunder and in terms with regulation 33 of SEBI (LODR) regulations 2015 and SEBI circular dated 5th July 2016. The company had prepared the reconciliation of net profit for the quarter ended June 2016.
3) Financial results for the corresponding quarter ended 30th June, 2016 are based on the information compiled by the management of the company after making necessary adjustments as per Ind AS and have not been subjected to limited review or audit.
4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Bombay Stock Exchange and Ahmedabad Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the Stock Exchange websites www.bseindia.com as well as on company's website www.unisongroup.net

Place : Ahmedabad. For and on behalf of Board of Directors
Date : 14th September, 2017 FOR, UNISON METALS LTD.
(MAHESH CHANGRANI)
Executive Director

BHARAT SANCHAR NIGAM LIMITED

NOTICE INVITING E-TENDER (2nd call)
The Executive Engineer (E), BSNL Electrical Division-II, 2nd Floor, E-4 BSNL, S. Qtrs., T.E. Bldg Subhanpura Compound, Vadodara - 390 023, invites on behalf of the BSNL sealed item rate tenders for following work :

NIT No. : 01/NIT/EEE BSNL/VDR-II,2016-17 (2nd call)
Dated 14.09.2017
Name of work : Rate Contract for SITC of 80 Nos. 1.5 TR inverter type Split AC units (ISEER rating of minimum 3.5) for various TE Buildings under BSNL Electrical Division-II, Vadodara.
Date of closing of tender: 03.10.2017

For further details kindly visit our web site at www.gujarat.bsnl.co.in and www.tenderbizard.com/bsnl.
"We also under take the deposit works"

Sd/-
Executive Engineer (E)
BSNL, Electrical Division-II,
Vadodara.

GMB Polytechnic, Rajula

(Established by GMB Education Trust, Gandhinagar)
C/o. Govt. Arts and Commerce College, Jafraabad,
Ta: Rajula, Dist: Amreli, Gujarat.

EMPLOYMENT NOTICE

ADVERTISEMNT NO. 01/2017

The Polytechnic invites applications on regular employment as per AICTE/GTU norms for the below mentioned posts of :

Sr.	Name of Post	Posts
1	Principal	01
2	Head of Department	03
3	Lecturer	11
4	Administrator	01
5	Lab Assistant	03
6	Librarian	01
7	Clerk	01

Eligibility norms and other details & formats of application can be downloaded from website www.gmbpolytechnic.ac.in. The on-line application will start on 15.09.2017 by 1:00 pm onwards. The last date of application is 30.09.2017.

Place : Rajula **INF/1659/17-18** **Sd/-**
Dated : 14.09.2017 **I/c. Principal**

GUJARAT WATER SUPPLY AND SEWERAGE BOARD

TENDER NOTICE NO. 03 OF 2017-18

Executive Engineer, P.H. Mech.dn. Lunawada, G.W.S.S.B., 52, Patidar Samaj vadi, Modasa Road, Lunawada Dist: Mahisagar invites on-line-tender from appropriate class of Govt. / GWSSB approved registered experience bidders for the work of Attendance / Repairing and recommissioning of existing Hand Pump in diff. villages of Diff. Taluka of Dist: Mahisagar (for two years). The Estimated cost of (1) Taluka-Santrampur Rs. 50,71,920.00 (2) Taluka-Lunawada Rs.39,97,560.00. The Tender I.D. is (a) Santrampur Tal: 277127 & (2) Lunawada Tal : 275955. The Tender downloading Dt. 25.09.2017 up to 18.00 Hrs. & **Technical Bid Opening on Dt. 26.09.2017 at 12.00 Hrs.** at the office of the S.E.P.H. Mech. Circle, Vadodara. For further details of Tender Notice, Scope of Work & Specification & further any amendments will be disburse please visit Web site log on to www.nprocure.com & Details will also available during office hours at above office address.

INF/Godhra/444/17

GUJARAT WATER RESOURCES DEVELOPMENT CORPORATION LTD. GANDHINAGAR

Executive Engineer (C), Unit-2 (Sujalam Sufalam), Second floor, State Water Data Center, Gandhinagar, Ph/Fax No. 079-23236712 email:- eessunit2@gmail.com

On line Tender Notice No.- 05 / 2017-2018

On-line B-2 tenders for the following work are invited by the Executive Engineer (C), Unit-2 (Sujalam Sufalam), Gandhinagar, from the contractors registered in Class "B" or above in Narmada, Water Resources, Water Supply and Kalpsar department and/or Road and Building Department of Gujarat State and CPWD / Railway / MES and other State Government equivalent to Class "B" or above.

- Name of Work :-** Renovation & Repairing of H.O. Building, GWRDC, Gandhinagar.
- Estimate Cost :-** Rs. 1,56,99,905.00
- Contractors class and tender fee :-** "B" or above, Rs 3,600/-
- Last date / Time for Receipt of Tender On line :-** **Date : 09.10.2017 at 18.00 hrs.**
- Date for submission of Tender fees, EMD & other documents by RPAD / Speed post only to the office of the E.E. Unit-2 (S.S) Gandhinagar from Dt.- 10.10.2017 to Dt.: 13.10.2017, up to 18.00 Hrs.**
- The EMD exception certificate will not be accepted.
- The EMD less than 180 days validity will not be accepted and offer will not be considered.
- The details of work on hand in state and outside state in Annexure-1 is to be provided. Also notarized affidavit on stamp paper of Rs 100/- as per Annexure-2 should be provided by tenderer.
- More details will be available on Corporation/Govt. Web Site www.gwrdc.gujarat.gov.in or www.statetenders.com. Tender will be accepted only on on-line on http://gwrdc.nprocure.com.

INF/1662/17-18

'Indian banks exploring various means of recapitalisation'

New Delhi, Recapitalisation is a major issue for state-run banks owing to the massive non-performing assets (NPAs), or bad loans, accumulated by them and they are now exploring various sources of raising capital, according to a leading public sector bank (PSB).

"Banks' capitalisation is a major issue for PSBs. We have to make high provisions, also now with the NCLT (National Company Law Tribunal) cases," UCO Bank Chief Executive R.K. Thakkar told BTVI channel.

The Reserve Bank of India (RBI) has identified the second batch of large accounts which have defaulted in repayment of loans and has advised banks to resolve them. In June, the RBI had come out with a list of 12 large accounts, which totalled about 25 per cent of the current gross NPAs of the banking system for reference to the NCLT under the Insolvency and Bankruptcy Code (IBC). "We are trying various source to raise capital... We have requested the government for support, but for the balance

beyond the budgetary support we have to go to the market, depending on the appropriate time," Thakkar said.

He said the UCO Bank's capital requirement for the current fiscal is to the tune of Rs 3,000 crore and "with the provisioning required for the NCLT cases the requirement may go up to another Rs 500-600 crore."

The RBI has also advised banks to make higher provisions for the accounts to be referred under the IBC.

This was intended to improve bank provision coverage ratios and to ensure that banks are fully protected against likely losses in the resolution process. Thakkar said that he expected the first tranche of the government support to arrive to the bank in a month's time.

He also said that recapitalisation bonds would be one of the possible instruments to explore in the efforts to supplement the government recapitalisation. The PSBs have accumulated a high ratio of NPAs, going up to 17-18 per cent of their loan portfolio.

JINDAL WORLDWIDE LIMITED				
Regd. & Corp. Off: "Jindal House" Opp. Dmar.L.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad-380015 CIN: L17110GJ1986PLC008942 • Ph:079-71001500 • E-mail: kd.csjindal@jindatextiles.com • Website: www.jindatextiles.com				
STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS)				
For the Quarter Ended 30th June, 2017				
(Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. in Lakhs)				
S.No.	Particulars	Quarter Ended (Standalone)		
		3 months ended (Unaudited) 30th June, 2017	Corr. 3 months ended in P.Y. (Unaudited) 30th June, 2016	
1	Total income from operations (net)	36286.56		27603.08
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary Items)	2194.36		1502.41
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2194.36		1502.41
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1755.46		1342.42
5	Total Comprehensive income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1755.46		1342.42
6	Equity Share Capital	2005.20		2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year i.e 31st March, 2017			26359.05
8	Earnings per share (of Rs. 10/- each)(for continuing and discontinued operations) : 1. Basic : 2. Diluted :	8.75 8.75		6.69 6.69

Notes:
1 The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended on 30th June, 2017 alongwith Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindatextiles.com)
2 The company has adopted Ind-AS for the first time w.e.f 1st April, 2017 and accordingly the said Un-Audited Standalone Financial Results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS-34 - Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and the other accounting principles generally accepted in India and SEBI Circular No.CIR/CFD/FAC/62/2016 dated 5th July, 2016. The Financial results for the corresponding previous quarter ended on 30th June, 2016 have also been presented in accordance with the recognition and measurement principles of Ind AS-34.

For and On Behalf of the Board,
JINDAL WORLDWIDE LIMITED
Date : 14th September, 2017
Place: Ahmedabad
(DR. YAMUNADUTT AGRAWAL) Chairman/Director DIN : 00243192

REAL NEWS & VIEWS LIMITED

(Formerly known as Real Realty Management Company Limited)
CIN: L74110GJ1993PLC019930
Regd Office: 4th Floor Karm Corporate House, Opp. Vikramnagar, Nr. New York Timber Mart, Ambli Bopal Road, Ahmedabad - 380059, Gujarat.

STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017

Particulars	Rs.in lacs		
	Quarter ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year
	30/06/2017 Unudited	31-03-2017 Audited	30-06-2016 Unudited
Total income from operations	0.49	365.92	0.00
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(226.60)	(273.65)	(29.63)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(226.60)	(169.62)	(29.63)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(225.24)	(243.41)	(20.47)
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(225.24)	(243.41)	(20.47)
Equity Share Capital	2000.00	2000.00	480.00
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)			
Basic :	(1.13)	(0.64)	(0.43)
Diluted:	(1.13)	(0.64)	(0.43)
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)			
Basic :	(1.13)	(0.35)	(0.43)
Diluted :	(1.13)	(0.35)	(0.43)

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (http://www.realnewsviews.in/)

By the order of the Board of Directors of
For, Real News & Views Limited
Sd/- Bhavna N. Ayer
(Director) - DIN: 02013477

Place : Ahmedabad
Date : 14-09-2017

LESHA INDUSTRIES LIMITED

Regd. Office : 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad-380 006.
(CIN: L27100GJ1992PLC018607)

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017

Particulars	Rs.in lacs		
	Quarter ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year
	30/06/2017 Unudited	31-03-2017 Audited	30-06-2016 Unudited
Total income from operations	618.03	76.74	67.59
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-4.57	-16.65	-4.82
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-4.57	-16.65	-4.82
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-4.57	-16.65	-4.82
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	-4.57	-16.65	-4.82
Equity Share Capital	113.20	943.36	943.36
Earnings Per Share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised)			
Basic :	-0.40	-0.18	-0.05
Diluted:	-0.40	-0.18	-0.05
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)			
Basic :	-0.40	-0.18	-0.05
Diluted :	-0.40	-0.18	-0.05

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.lesha.in)

For, LESHA INDUSTRIES LIMITED,
Sd/- SHALIN A. SHAH
Director (DIN : 00297447)

Place : Ahmedabad
Date : 14-09-2017

GUJARAT NATURAL RESOURCES LIMITED

Regd. Office : 8, Sigma Corporate, Nr. Mann Party Plot, S.G. Highway, Ahmedabad-59
(CIN: L27100GJ1991PLC016158)

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017
(Rs. in lacs)

Particulars	Quarter ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year
	30/06/2017 Unaudited	31-03-2017 Audited	30-06-2016 Unaudited
Total income from operations	174.27	966.68	248.19
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-68.99	80.05	4.34
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-68.99	80.05	4.34
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-68.99	42.13	4.34
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	-68.99	42.13	4.34
Equity Share Capital	3875.16	3875.16	3875.16
Earnings Per Share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised)			
Basic :	-0.18	0.11	0.01
Diluted :	-0.18	0.11	0.01
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)			
Basic :	-0.18	0.11	0.01
Diluted :	-0.18	0.11	0.01

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.gnrnl.in) For, GUJARAT NATURAL RESOURCES LTD.,
Sd/- SHALIN A. SHAH
Managing Director (DIN : 00297447)

Place : Ahmedabad Date : 14-09-2017

KRIMY BISCUITS AND CHEMICAL INDUSTRIES LTD.

Regd. Off. : 130, VITHAL UDYOGNAGAR, VIA ANAND GUJARAT, Anand 388121
(CIN : L24231GJ1995PLC028889)

NOTICE FOR 22nd ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING
NOTICE is hereby given that the 22nd Annual General Meeting (AGM) of the Members of KRIMY BISCUITS AND CHEMICAL INDUSTRIES LTD. ("the Company") will be held on Friday, 27th September, 2017 at 4.00 p.m. at Registered office of the company at 130, VITHAL UDYOGNAGAR, VIA ANAND GUJARAT, Anand 388121. In order to conduct the business set out in the Notice approved in Board Meeting dated 01st September, 2017 convening the AGM.
The Notice of the 22nd AGM and Annual Report for the financial year 2016-17 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company/Depository Participants and the physical copies of the same have been sent to all other members at their registered address in the permitted mode. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.
NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 23rd September, 2017 to the 29th September, 2017 (both days inclusive), for the purpose of the above referred 22nd Annual General Meeting of the Company.
Any Person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM 23rd September, 2017 and holding shares as of the cut-off date i.e. of 22nd September, 2017 may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com.
As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by "Remote e-voting" (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under:
1. Date of completion of dispatch of Notice AGM: 6th September, 2017
2. Date & Time of commencement of Remote e-voting: 10.00 a.m. on 26th September, 2017
3. Date & Time of end of Remote e-voting: 5.00 p.m. on 28th September, 2017
4. Cut-off date for determining rights of entitlement of Remote e-voting: 22nd September, 2017
5. Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM.
6. Remote e-voting shall not be allowed beyond After 5.00 p.m. on 28th September, 2017
7. Manner of casting vote on resolutions at the venue of AGM: The facility of voting through "Ballot Paper" shall be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.
8. Notice of 22nd Annual Report is available on Company's website & on CD/SL website: www.krimybiscuits.com
9. Contact details of person responsible to address the grievances connected with remote e-voting: Mr. Parveen Sharma Skyline Financial Services Pvt. Ltd. D-153A 1st Floor, Okhla Industrial Area, Phase I, New Delhi - 110024, India. Tel: 26812682 E-mail: info@skylinesoft.com
By Order of the Board
For, KRIMY BISCUITS AND CHEMICAL INDUSTRIES LTD. Sd/- VINODKUMAR FULABHAI PATEL (Managing Director)

Place : Anand Date : 06.09.2017

PARAMOUNT COSMETICS (INDIA) LIMITED

Registered Office: A-1/2211, III Phase, GIDC, Vapi- 396 195, Gujarat
Corporate Office: 902-904, 9th Floor, Prestige Meridian-1, No. 29, M.G. Road, Bangalore-560001
Corporate Identity Number: L24240GJ1985PLC008282;
Tel: 91 80 25320870/71;
Email: compliance.officer@paramount.com; website: www.paramount.com

NOTICE is hereby given that the Thirty Second Annual General Meeting (AGM) of the Company will be held on Friday, the 29th day of September, 2017 at 11:00 a.m. at VIA Hall, Vapi Industrial Association, Plot No. 135, VIA House, GIDC, Vapi - 396 195 to transact the Business, as set out in the Notice of AGM.
The Annual Report of the Company for financial year 2016-17 along with the Notice of the AGM has been emailed to all the members whose email IDs are registered with RTA. Physical copies of the Notice of AGM and Annual Report for 2017 have been sent to all other members at their registered address in the permitted mode. The dispatch of Notice of AGM has been completed on 4th September, 2017.
In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with relevant rules thereunder and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The company is pleased to provide its members the facility to exercise their right to vote by electronic means at the 32nd AGM (Remote E Voting) and the business to be transacted at the aforesaid AGM may be transacted through remote e voting services provided by Central Depository Services Limited (CDSL). Remote E Voting is optional. The facility for voting, through ballot paper, will also be made available at the AGM and the members attending the AGM who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right at the AGM through ballot paper.
The Evoting period commences on Saturday, September 23, 2017 (9.00 a.m. IST) and ends on Tuesday, 26th September, 2017 (5.00 p.m. IST). During this period, Members may cast their vote electronically. The Evoting module shall be disabled by CDSL thereafter.
Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date 22nd September, 2017, may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronic voting system of CDSL from a place other than venue of AGM ("remote e-voting").
Any person, who is a Member of the Company as on September 22, 2017 ("Cut-off date") is eligible to cast vote on all the resolutions set forth in the Notice of AGM using Evoting or voting through Postal Ballot at the AGM.
A person who has acquired shares and become a member of the Company after the dispatch of notice of AGM and holding shares as of cutoff date, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM uploaded at our website www.paramount.com and CDSL website: www.cdslindia.com. However, if the person is already registered with CDSL for remote Evoting then the existing user ID and password can be used for casting vote.
In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Shareholders available at the Help section of www.evotingindia.com or contact at toll free No. 1800-200-5533. In case of any grievances connected with facility for voting by electronic means, please contact Mr. Rakesh Dalvi, Deputy Manager, CDSL, 17th Floor, P J Towers, Dalal Street, Fort, Mumbai-400 001. Email: helpdesk.evoting@cdslindia.com Tel: 022-22723333.
Persons entitled to attend and vote at the meeting, may vote in person or by proxy/through authorized representative, provided that all proxies in the prescribed form/authorization duly signed by the person entitled to attend and vote at the meeting are deposited at the Registered Office of the Company, not later than 48 hours before the meeting.
Pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules thereunder and Regulation 42 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The Register of Members and the Share Transfer books of the Company will remain closed from Saturday, 23rd September, 2017 to Friday, 29th September, 2017 (both days inclusive).
By Order of the Board
For, Paramount Cosmetics (India) Ltd Sd/- HANSRAJ RATHOR Chief Financial Officer

Place : Bangalore Date : 6th September 2017

STERLING GREENWOODS LIMITED

CIN No : L51100GJ1992PLC017646
Sunrise Centre, Opp. Indraprasth Tower, Drive-In Road, Ahmedabad-54. Ph.:26851680/26850935

NOTICE OF THE 25TH ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 25th Annual General Meeting (AGM) of Members of Sterling Greenwood Limited will be held on Friday the 29th September 2017 at the Greenwood Lake Holiday Resort, Chharodi Farm Complex, Off Sarkhej-Gandhinagar Highway, Opp. Village Chharodi Ahmedabad at 2.00 p.m. to transact the Ordinary and Special Business, as set out in the Notice dated 31st August, 2017 convening the AGM. The Notice of AGM, Annual Report and attendance slip have been sent physically to members. The above documents are also available on the Company's website- www.sterlinggreenwoods.com.
Notice is also hereby given pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ("Act") and the applicable rules framed there under that the Register of Members and Share Transfer Book of the Company will remain Closed from 21st September, 2017 to 28th September, 2017 (both days inclusive) for the purpose of AGM.
Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically, through e-voting facility provided by the Central Depository Services (India) Limited (CDSL) on all resolutions set forth in the AGM notice. The voting rights shall be in proportion to the shares held by members as on 22nd September, 2017, being the cut-off date.
The remote e-voting period commence on Monday, 25th September 2017 at 9.00 a.m. and will end on Thursday, 28th September, 2017 at 5.00 p.m. During this period, members, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. 22nd September, 2017, can cast their vote electronically in the manner and process set out in the AGM Notice. The remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the member, the member will not be allowed to change it subsequently. A member can participate in the AGM even after exercising the right to vote through remote e-voting but will not be allowed to vote again at the AGM. Members not opting for remote e-voting will be offered the facility to vote at the venue of the AGM. A member can opt for only one mode of voting i.e. either through remote e-voting or at the AGM venue.
In case of any queries or grievances pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or with an e-mail to helpdesk, helpdesk.evoting@cdslindia.com.

Place: Ahmedabad Date : 14th September, 2017

For, STERLING GREENWOODS LIMITED BHARAT KUMAR LEKHI MANAGING DIRECTOR

JINDAL WORLDWIDE LIMITED

Regd. & Corp. Off: "Jindal House", Opp. Dmart, L.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad-380015
CIN: L17110GJ1986PLC008942 • Ph: 079-71001500 • E-mail: id.csjindal@jindalworldwide.com • Website: www.jindalworldwide.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter Ended 30th June, 2017
(Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. in Lakhs)

S.No.	Particulars	Quarter Ended (Standalone)	
		3 months ended (Unaudited) 30th June, 2017	Corr. 3 months ended in P.Y. (Unaudited) 30th June, 2016
1	Total income from operations (net)	36286.56	27603.08
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	2194.36	1502.41
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2194.36	1502.41
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	1755.46	1342.42
5	Total Comprehensive income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive income (after tax)]	1755.46	1342.42
6	Equity Share Capital	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year i.e 31st March, 2017		26359.05
8	Earnings per share (of Re. 10/- each) (for continuing and discontinued operations) : 1. Basic : 2. Diluted :	8.75 8.75	6.69 6.69

Notes:
1 The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended on 30th June, 2017 alongwith Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com)
2 The Company has adopted IND-AS for the first time w.e.f 1st April, 2017 and accordingly the said Un-Audited Standalone Financial Results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS-34 - Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and SEBI Circular No CIR/CFD/FAC/62/2016 dated 5th July, 2016. The Financial results for the corresponding previous quarter ended on 30th June, 2016 have also been presented in accordance with the recognition and measurement principles of Ind AS-34.
For and On Behalf of the Board,
JINDAL WORLDWIDE LIMITED
(DR. YAMUNADUTT AGRAWAL) Chairman/Director DIN : 00243192
Date : 14th September, 2017
Place: Ahmedabad

KINTECH RENEWABLES LIMITED

Regd. Off. : Kintech House, 8, Shivalik Plaza, Opp. AMA, IIM Road, Ahmedabad - 380 015, Gujarat, Tel. No. : +91 79 26303064; Website: www.kintechrenewables.com; E-Mail: cs@kintechrenewables.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017
(Rs. In Lakhs)

Particulars	STANDALONE	
	Quarter ended 30th June, 2017	Quarter ended 30th June, 2016
Total income from Operations (Net)	40.14	7.47
Net Profit / (Loss) for the period (before Exceptional Items and Tax)	8.61	4.07
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	8.61	4.07
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	6.58	2.82
Total Comprehensive Income for the period [(Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	6.58	2.82
Equity Share Capital	100.00	100.00
Earnings Per Share of Rs 10/- each (for continuing and discontinued operations)		
(a) Basic	0.66	0.28
(b) Diluted	0.66	0.28

Notes:
(1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results is available on the website of Stock Exchange, www.bseindia.com and on the website of the Company www.kintechrenewables.com.
(2) During the quarter, the Company has earned Other Operating Revenue being the interest income of Rs.7.50 Lakh on loan given to the Subsidiary Company, which is also engaged in Renewable Energy business.
(3) The Company has adopted Indian Accounting Standard ("IND-AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly, the Financial Result for the Quarter ended on 30th June, 2017 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India.
(4) The reconciliation of Net Profit or loss reported in accordance with Indian GAAP to total comprehensive income in accordance with IND-AS is given below:

Sr. No.	Particulars	Quarter ended on June 30, 2017
1.	Net Profit after tax as per Indian GAAP	6.58
2.	IND-AS adjustments increasing/(decreasing) net profit	-
3.	Net profit before Other Comprehensive Income/Reserve as per IND-AS	6.58
4.	Other Comprehensive Income	-
5.	Total Comprehensive income for the period	6.58

For and On behalf of the Board of Directors of Kintech Renewables Limited
Sd./- Jigar J. Shah
Chairman
Place : Ahmedabad Date : September 15, 2017
DIN 00385460

UNISON METALS LIMITED

(CIN NO. : L52100GJ1990PLC013964)
Regd. Off. : Plot No. 5015, Phase-IV, Ramol Char Rasta, G.I.D.C., Vatva, Ahmedabad - 382445.
Tel : 079-25841512 • E-mail : unisonmetals@gmail.com • Web : www.unisongroup.net

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2017
(Rs. In Lacs)

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended
		30/06/2017 Unaudited	30/06/2016 Unaudited
1	2	3	4
1	Total Income from operations	1,845.84	1,512.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	19.27	17.07
3	Net Profit / (Loss) for the period before Tax, (After Exceptional and / or Extraordinary items)	19.27	17.07
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional and / or Extraordinary items)	10.02	11.74
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) & other Comprehensive Income (after tax)]	9.80	11.54
6	Equity Share Capital (Face Value Rs.10/- per shares)	320.42	320.42
7	Reserves (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	---	---
8	Earnings Per Share (EPS) Basic & diluted EPS for the period Rs. 10 per share Basic EPS per share Diluted EPS per share	0.31 0.31	0.36 0.36

Notes :
1) Above results have been reviewed by Audit committee and approved by board of directors as on meeting held on 14th September, 2017. The Statutory Auditors of the Company have conducted a "Limited Review" of the above Standalone Unaudited Financial Results for the Quarter ended June 30, 2017.
2) The Company has adopted Ind AS with effect from 1st April, 2017. Therefore, Ind AS transition date is w.e.f. 1st April 2016 and for that purpose comparative figures of 30th June 2016 is restated. Accordingly, the impact of transition has been provided and figures for that period has been restated accordingly. The financial results of the company have been prepared in accordance with Indian Accounting Standards prescribed under section 133 of the companies Act, 2013 read with relevant rules thereunder and in terms with regulation 33 of SEBI (LODR) regulations 2015 and SEBI circular dated 5th July 2016. The company had prepared the reconciliation of net profit for the quarter ended June 2016.
3) Financial results for the corresponding quarter ended 30th June, 2016 are based on the information compiled by the management of the company after making necessary adjustments as per Ind AS and have not been subjected to limited review or audit.
4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Bombay Stock Exchange and Ahmedabad Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the Stock Exchange websites www.bseindia.com as well as on company's website www.unisongroup.net

Place : Ahmedabad Date : 14th September, 2017
For and on behalf of Board of Directors FOR, UNISON METALS LTD. (MAHESH CHANGRANI) Executive Director

STERLING GREENWOODS LTD.

CIN No : L51100GJ1992PLC017646
Sunrise Centre, Opp. Indraprasth Tower, Drive-In Road, Ahmedabad-380054. Ph.:26851680/26850935

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER 30.06.2017
(Rs. in lakh except per share data)

Sr. No.	Particulars	30-06-2017	30-06-2016
		(Unaudited)	(Unaudited)
1	Income from Operations		
	(a) Net Sales/Income from Operations	67.25	176.18
	(b) Other operating income	7.33	3.19
	Total Income from operations	74.58	179.37
2	Expenses		
	(a) Cost of material and Land	7.70	18.22
	(b) Purchase of stock-in-trade	Nil	Nil
	(c) Scheme development expenses	0.63	7.47
	(d) Changes in inventories of finished goods, work-in-progress and stock in trade	Nil	Nil
	(e) Employee benefit Expenses	34.20	38.38
	(f) Finance Costs	18.19	14.82
	(g) Depreciation and amortisation expenses	18.50	17.25
	(h) Other expenses	32.61	48.98
	Total Expenses	111.82	145.12
3	Profit / (Loss) before exceptional items extraordinary items and tax (1-2)	(37.24)	34.25
4	Exceptional items	38.23	2.37
5	Profit / (Loss) before extraordinary items and tax (3-4)	0.98	31.88
6	Extraordinary Item (net of tax expenses)	Nil	Nil
7	Profit / (Loss) before tax (5-6)	0.98	31.88
8	Tax expense		
	Current Tax	0.30	10.01
	Mat Credit Entitlement	Nil	Nil
	Deferred Tax	Nil	Nil
9	Profit / (Loss) for the period from continuing operations (7-8)	0.68	21.87
10	Profit / (Loss) from discontinuing operations Before tax	Nil	Nil
11	Tax expense of discontinuing operations	Nil	Nil
12	Profit / (Loss) from discontinuing operations after tax (10-11)	Nil	Nil
13	Profit/(Loss) before minority interest	0.68	21.87
14	Share Profit / (Loss) of Associates	Nil	Nil
15	Minority Interest #	Nil	Nil
16	Profit/(Loss) for the period (13-14-15)	0.68	21.87
17	Net Profit from continuing operations for the period attributable to :		
	(a) Shareholders of the company	0.68	21.87
	(b) Non controlling interests	Nil	Nil
18	Other Comprehensive Income/(Expenses) (OCI)	Nil	Nil
	Items that will not be reclassified to profit or loss in subsequent periods	Nil	Nil
	Other Comprehensive Income/(Expenses)	Nil	Nil
19	Total Comprehensive income for the period	0.68	21.87
20	"Paid-up equity share capital"(Face value of Rs. 10 each)"	423.96	423.96
21.i	Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)		
	Basic & Diluted	0.02	0.52
21.ii	Earnings Per Share (After extraordinary items) (of Rs. 10/- each) (not annualised)		
	Basic & Diluted	0.02	0.52

applicable in the case of consolidated results
NOTES -

- The Above Standalone Unaudited Financial Results have been reviewed by the Audit committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14th September, 2017.
- The Company adopted Indian Accounting Standards ("Ind AS") from 1st April 2017 and accordingly these financials results have been prepared in accordance with the recognition and measurement Principles laid down in Ind AS 34 Interim Financial Reporting under Section 133 of the Companies Act, 2013 read with the relevant accounting rules issued under and the other accounting principles generally accepted in India.
- The Financial Results for the quarter ended on 30th June 2016 have not been subject to limited review and have been presented based on the information compiled by the company after making necessary adjustments to give a true and fair view of the results in accordance with Ind AS.
- The Statement does not include Ind AS compliant results for the preceding quarter and previous year ended on 31st March 2017 as the same is not mandatory for per SEBI's circular no. CIR/CFD/FAC/2016 dated 5th July 2016.
- The Company has mainly two segment ,Real estate And Resorts & club Membership, as required as per Ind AS 108 , the company has furnish segment wise Revenue Result and

Prataap Snacks to launch IPO on Sept 22



Ahmedabad, Prataap Snacks Ltd., the maker of Yellow Diamond potato chips, said its initial public offering will hit the markets as it looks to expand operations and enter new categories. Prataap Snacks Limited proposes to open on Friday, September 22, 2017, an Initial Public Offering of Equity Shares of face value of Rs. 5 each for cash at a price including a share premium comprising a fresh issue of Equity Shares aggregating up to Rs. 2,000 million and

an offer for sale of up to Equity Shares by the Selling Shareholders, comprising an offer for sale of up to 3,005,770 Equity Shares including up to 369,451 Equity Shares by Sequoia Capital GFIV Mauritius Investment and up to 94,266 equity shares by Sequoia Capital India Growth Investment Holdings. The company to raise fresh issue with price band of Rs. 930 to Rs. 938 per share. The proceeds will be used to repay debt, and for marketing and brand building, according to its pro-

spectus. The company plans to launch sweet snacks" Amit Kumar, managing director and chief executive officer of Prataap Snacks, told during press conference. The Indore-based company is looking to increase penetration in the north and the south, he said. Amit Kumar, MD & CEO told that before 13 years back Company sold 100 packets per day and at present company sold more than 1cr packets per day. Company has 3500 distributors and 218 super stockist in India.

Garment Manufacturer Trident Textofab to enter Capital Market

Surat, Trident Textofab Ltd, Surat based manufacturer and supplier of exclusive range of Garments & Textile Fabrics. Our range comprises of Formal Fabrics, Scarfs & Pareos, Dobbys, Jacquards, Casual Fabrics & Technical Textile Fabrics is entering the Capital Market with an IPO of 11.76 lakhs Equity Shares of Rs. 10 each at a price of Rs. 30. The issue opens on September 21, 2017 and closes on September 26, 2017. Guinness Corporate Advisors Pvt. Ltd. & Indian Overseas Bank are Lead Manager to the Issue and Karvy Computershare Pvt. Ltd. is the Registrar. The company will be listed on BSE-SME segment. The proceeds of the Issue will be utilized for Working Capital Requirements, General Corporate Purposes and Issue Expenses. Trident Textofab Ltd., manufactures multi-product finished, unfinished fabric range includes home furnishing, bedsheets, scarfs, pareos, suiting and shirting and technical textile fabrics, etc. at there state of art, ultra modern manufacturing unit at Surat having latest R&D center. Other range includes Home Furnishing Fabrics, Ladies Dress Material, Scarf Fabrics and Technical Textiles Fabrics are manufactured using quality-approved yarns and basic material. The company has reported excellent results for the year ended march 2017 with revenues increasing from Rs. 6603.29 lakh to Rs. 7619.20 lakh.

Reliance's Unlimit, IBM collaborate to power IoT innovation in India

Mumbai, Reliance Group's Unlimit -- an Internet of Things (IoT) venture for enterprises -- and tech giant IBM on Monday announced a collaboration to co-create IoT solutions for industry verticals, including automotive, insurance, utilities and industrial automation. The two companies are developing IoT solutions for implementation across Reliance Group companies, addressing key segments such as user-based insurance (Reliance general insurance), asset and vehicle tracking (Reliance commercial finance), tower monitoring (Reliance communications) and transformer maintenance (BSES & Reliance energy).

Business Brief

TeamLease Skills University to cater to hundreds of Bank jobs

Ahmedabad : TeamLease Skills University is offering Diploma and Certificate programs in Banking and Insurance which are of short duration and will lead to jobs in the Banks. Recently 5 banks, 3 micro finance and 2 housing finance organizations visited university for the recruitment of jobs available at their organization. 'Banks today are looking for hundreds of graduates, especially Commerce, Arts, Science background, who can work in banking operations and sales,' Vikrant Pande, Provost of TeamLease Skills University said. TLSU, in partnership with ASPIRETM KNOWLEDGE AND SKILLS INDIA (P) LTD., PUNE will offer these courses in Gujarat. 'Our idea is to give take jobs to people and not people to jobs. These jobs are in all cities and towns of Gujarat, hence the candidate can hope to find a job where he resides,' said Mihir Chatterjee, Vice President of Aspire Knowledge and Skills, which has tied up with various nationalized banks and micro finance companies for jobs.

CEAT launches high mileage tyre 'Milaze X3' with 1 Lakh km range

New Delhi, CEAT Limited, a leading Indian tyre manufacturer launched its industry first tyre range - 'Milaze X3' boasting superior longevity that will last for more than 1 lakh kilometers. The new generation proprietary wear resistant compound in Milaze X3, ensures superior longevity that gives a longer tyre life. Aligned with CEAT's vision of making mobility safer and smarter every day, 'Milaze X3' is the best in class high mileage tyre suitable to small car, hatchback and entry level sedan. 'Milaze X3' will be available in all metro cities followed by tier I and II cities.

Upgraded 'Milaze X3' tyre has new generation tread compound, optimized shoulder depth, rigid shoulder blocks that gives longer tyre life and ensures safer driving experience. The higher groove depth of tyres also provides high resistance. Tyres also ensure superior load distribution that offers improved riding comfort for safer and pleasant travel. It is the only tyre which lasts upto 1 lakh kilometers with better stability and stronger grip on the roads. Commenting on the launch of tyres, Nitish Bajaj, CEAT Vice President -Marketing, said: "It has been our continuous endeavor to launch new tyres in the industry that can make mobility safer and smarter every day for customers. While introducing new products and services, we focus on innovation quotient that can provide more value to our customers and benefit society and the environment. Milaze X3 is one such product which pushes the boundaries of tyre mileage. At CEAT, we strive hard to make travel more efficient for customers by reducing the cost and time of travel with improved convenience."

Sony launches flagship 'HT- ST5000' soundbar at Rs 1,50,990

New Delhi, Sony India on Monday launched "HT-ST5000" - its flagship 7.1.2 channel soundbar that comes with Dolby Atmos. The soundbar delivers superior audio quality with "S-Force Pro Front" Surround technology while acting as a wireless speaker for music listening. Priced at Rs 150,990, "HT-ST5000" is optimised for Dolby Atmos with two in-built up-firing speakers that produce overhead sound. The soundbar ensures cinema-like audio experience at home with great sound, the company said in a statement. The soundbar uses Digital Signal Processing (DSP) and S-Force PRO front surround with wave front technology to produce three-dimensional sound field. In terms of connectivity, the soundbar supports Bluetooth and NFC for wireless listening streaming music. There is also an option to connect the soundbar to the internet via built-in Wi-Fi for instant access to music services via Chromecast and stream music from devices. It also features 3x HDCP 2.2-compatible HDMI inputs, 1x HDMI ARC output, optical SPDIF, analogue AUX and a USB connection for wired connectivity. The product is available at all Sony Centres and major stores.

Lenovo launches new 'Tab 4' series range

Bengaluru, Expanding its tablet portfolio, Lenovo on Monday launched four new devices in its Tab 4 series in India. Tab 4 8" (Rs 12,990), Tab 4 8 Plus" (Rs 16,990), Tab 4 10 Plus - 3GB variant" (Rs 24,990) and Tab 4 10 Plus - 4GB variant" (Rs 29,990) will be available on Flipkart. The devices are equipped with fingerprint quick-login feature to keep data secure with multi-user and multi-space functionality. Tab 4 is designed to be a one-stop solution for multiple-user functionality which is relevant for an Indian family," said Bhaskar Choudhuri, Director, Marketing, Lenovo India, in a statement. The 8-inch Tab 4 8" comes with 2GB RAM and 16GB internal storage, while the 10-inch Tab 4 10 Plus" features 3GB+16GB configuration. Both run on 1.4GHz Qualcomm Snapdragon Quad-Core processorPowered by 2.0GHz Qualcomm Octa-Core processor, Tab 4 8 Plus" and Tab 4 10 Plus" come with 4GB RAM and 64GB internal storage. The devices claim to offer up to 20 hours battery backup for normal usage.

AI plans cost management blitz, aims to save around Rs 500 cr

Copenhagen, National passenger carrier Air India plans to "renegotiate" its agreements with vendors and suppliers to save operational costs of up to Rs 500 crore (\$780 million) with in the shortest possible time period. The ambitious short-term target to be achieved in 12-weeks time has been set by the company's new Chairman and Managing Director, Rajiv Bansal. "There is always scope to cut and manage costs. My focus is to manage cost but not by inconveniencing the passengers in anyway," Bansal told IANS in an exclusive interaction soon after Air India's inaugural New Delhi-Copenhagen non-stop flight landed here. "Internally, we are looking to optimise our leases with our vendors and services providers ... renegotiations might be needed to fully optimise our agreements," he said. The mega cost saving plan envisages at least "one major initiative per week" to be taken on expenditure optimisation. The cost savings measures which have been identified range from anywhere between Rs 10 crore and a maximum of Rs 50 crore per year. "We must continue to chip away at the cost factor. My approach is to take one important initiative a week in this regard. It may be for as low as Rs 10-20 crore," Bansal explained. "For example we will be looking for bulk discounts and re-negotiation of some international contracts on the back of prevailing low interest rates globally." The idea is to take one initiative every week which brings savings in small amounts on yearly operating expenses. "The central government, though busy in consultations over the privatisation prospects of the debt ridden airline has agreed to provide the initial support required for the savings initiative."

Xiaomi Mi A1: Moto G5s Plus gets real competition

New Delhi, When it comes to mid-segment smartphones with loads of impressive features, Xiaomi's name pops up first -- and why not? The China-based manufacturer rules the low- and mid-segment smartphone market in the country. While every other brand is trying to dislodge Xiaomi from the top slot, the Chinese conglomerate has launched the Mi A1 that offers a rear dual-camera system that runs Android Nougat 7.1.2 OS to deliver a near-stock Android experience at only Rs 14,999. This segment is ruled by Motorola's "G" series which has been a favourite owing to its stock Android experience and performance. Nokia 6 is also fighting for a space by offering a secured stock Android OS. Can Xiaomi again prove to be the leader? Let's find out. Mi A1 comes with a design that is similar to other Xiaomi devices -- slim, beautiful and easy to hold. The ergonomically placed volume rocker,

power buttons and fingerprint scanner (at the back) keeps the design simple yet attractive -- somewhat similar to the iPhone 7. For Xiaomi's followers, the Mi device running on Android Nougat 7.1.2 and an "Android Oreo" update before the end of this year is a treat. The device comes with Google Assistant, arguably the best voice assistant currently available. No bloatware with clean and smooth performance by Qualcomm's Snapdragon 625 processor, coupled with 4GB RAM, does wonders for the phone. For us, time with Mi A1 was the best ever. Motorola's biggest reason in leading this segment was the operating system and camera quality. With Nokia 6 already making it difficult for the Lenovo-owned brand to keep up the high numbers, Xiaomi launched this device to make a further dent in the sales of Motorola. Moto kicked Nokia out of the competition with the launch of G5s to directly compete with Xiaomi's

dual-camera system. Mi A1 has a pair of 12MP sensors where one is a wide-angle lens and the other a telephoto lens. Both combine to shoot photos with DSLR-like "bokeh" effects. Just like other premium devices, there is a "Portrait Mode" meant for shooting photos with blurred background. As a package, the phone clicks beautiful photos in the right lighting conditions. Nothing remarkable in the camera but the output does justice to the dual-camera system. When we clicked pictures with the "Portrait Mode", it immediately detected the subject and blurred the background with Phase Detection Auto-Focus (PDAF) and face-detection features. Android in its purest form consumes very less battery. Our tests showed exactly why the company chose to keep the battery at just over 3,000mAh. In our daily usage that included light gaming, connected to multiple social media accounts with some music playback and moderate calling time, the device gave us a day-long back-up. In the under Rs 15,000-segment, Mi A1 supports USB Type-C charging port that took a little less than two hours to charge the device.

Krishnapatnam Port's Container Terminal to offer deepest draft on the East coast of India

Mumbai, Krishnapatnam Port, the country's largest all-weather; deep water port on the east-coast of India, in its quest to become best port globally has increased its draft for container terminal to 16 meters. With the new milestone, Krishnapatnam Port Container Terminal now shares the honor of being one of the deepest draft container ports on the east coast of India. Krishnapatnam Port already enjoys the status of having 18.5 meter draft, deepest in India for its bulk terminal. The port has started offering transshipment services, with coastal operator Shreyas Shipping running feeder services between Krishnapatnam Port and Kolkata/Haldia port. There is a special coastal berthing facility at Krishnapatnam that has been made available for transshipment cargo and coastal transshipment vessels. With the new achievement, Krishnapatnam Port has not only surpassed Chennai and other ports in terms of the deepest draft but has also been able to match the global standards. The port will now be able to accommodate Ultra Large Container Vessels, leading to a spurt in the cargo volumes handled. On the new facility, Ms Vinita Venkatesh, Director, KPCT said, "The deep draft availability is the latest fac-

ility we are making available for the shipping lines in keeping with our customer centric approach to provide infrastructure ahead of demand. This will enable liner companies to increase vessel size and gain higher market share at KPCT. "With the new deepened draft and availability of coastal berth facility for transshipment cargo, we are now offering a 360 degree holistic wharf side of products for our customers. The large vessels can now make calls to Krishnapatnam Port to load or discharge hinterland as well as transshipment speedily." She further added. Our terminal also offers high load and discharge rates that facilitate speedy turnaround of the vessels.

Two accused in Malegaon 2008 blast case get bail

Mumbai, A Special NIA court on Tuesday granted bail to Sudhakar Chaturvedi and Suhakar Dwivedi, two prime accused in the September 2008 Malegaon blast case, on grounds of parity. The two were granted bail along with a surety of Rs 500,000 each and other conditions. Chaturvedi and Dwivedi, alias Dayanand Pandey, had filed for bail after the Supreme Court granted bail to Lt. Col. Prasad S. Purohit, one of the main accused in the case, last month. Earlier, another prime accused in the case, Sadvhi Pragnya Singh Thakur, had been released on bail by the Bombay High Court on health and other grounds after nearly nine years in custody. A powerful bomb exploded near the crowded Nooraji Mosque in Malegaon on the evening of September 29, 2008, killing six and injuring 100 others, around 300 km north of Mumbai in Nashik district. It was the second such blast in the Muslim-dominated powerloom town which was earlier shaken by a similar blast on September 8, 2006, which claimed 37 lives and injured more than 250. Initially, the (Malegaon 2008) case was probed by the Maharashtra Police and the Anti-Terrorist Squad, and later in April 2011 it was taken over the National Investigation Agency. The investigators had charge-sheeted 14 accused in the case, including two - Ramchandra Kalsangra and Sandeep Dange - who are absconding so far.

CHANGE OF NAME
I have changed my old name from **DESAI YAS** to New Name **DESAI YASH**
Add. : 2, Varahi Society, D-Cabin, Sabarmati, Ahmedabad-380019

Tender Notice
Geology & Mining Department wants to carry out, (DGPS Survey) Geological and topographical exploration for different Sandstone & Black Trap bearing areas in Surendranagar Districts. Interested Consultant/ Companies are Requested to Visit Our District Geologist Office Bahumali bhavan, First Floor, 105-106, Kherali road, Surendranagar. For Collection of Tender Document during office hours Dt. 18.09.2017 to Dt. 25.09.2017 15:00 hrs. Tender Fee : Rs 500/- (Non-Refundable and Rs 5,000/- D.D. Deposit)
Asst. Geologist, Surendranagar
☎️: 079-2511191/191-1

Surbhi Industries Limited
CIN NO. L17110GJ1992PLC017672
Reg. : "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail, Ring Road, Khatodara, SURAT GUJARAT 395002,
Email: surbhics7743@gmail.com
NOTICE
Notice is hereby given that 25th Annual General Meeting of SURBHI INDUSTRIES LTD will be held on Friday, September 29, 2017 at 10:00 AM at "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail Ring Road, Khatodara, SURAT GUJARAT 395002 to transact the businesses as mentioned in the notice dated 12th August, 2017. The notice of the 25th AGM and Annual Report for the period 2016-17 have been sent to the shareholders at their Registered Address available with the company and are also available on the website of the company www.surbhi.com

Notice is further given pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the LODR, 2015 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, 23rd September, 2017 to Friday, September 29, 2017 (both days inclusive) for the purpose of ensuing 25th Annual General Meeting of the company.

As per the Section 108 of the Companies Act, 2013 read with the Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the company has provided its shareholders the facility to cast their vote by electronic means (E-voting) on all the resolution set forth in the notice. The details are required pursuant to the provision of the Companies Act, 2013 and rules are given under:

1	Date of completion of sending of Notices :	2nd September, 2017
2	Date & Time of commencement of voting through electronic means :	Tuesday, 26th September, 2017 at 10:00 AM IST
3	Date & Time of end of voting through electronic means :	Thursday, 28th September, 2017 at 5:00 PM IST
4	Voting through Electronic means shall not be allowed beyond :	Thursday, 28th September, 2017 at 5:00 PM IST
5	The Notice of 25th AGM is available on Company's website & on CDSL website:	www.surbhi.com www.evotingindia.com
6	Cut-off date for determining rights of entitlement of E-voting :	Friday, 22nd September, 2017
7	Contact details of person responsible to address the grievances connected with the electronic voting :	Ashwin Patel, Sr. Assistant Email : surbhics7743@gmail.com Add: "SURBHI HOUSE", 2nd Floor, F.P.No.206, B/h Old Sub-jail, Ring Road, Khatodara, Surat, Gujarat-395002, Contact: 9979577377

Facility for voting through ballot paper shall be made available at the AGM and the members who have not cast their vote through remote e-voting shall be able to vote at the AGM. Members who have cast their vote through remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as on the cut-off date i.e. Friday, 22nd September, 2017 may obtain user ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com

Any person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut off date i.e. Friday, 22nd September, 2017 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in general meeting.

For, and On behalf of the Board
Sd/-
RAVJIBHAI PARBATHAI PATEL
Managing Director
(DIN: 00023332)
Place : Surat
Date : 02.09.2017

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House", Durgam Chattram, L.O.C. Petrol Pump Lane, Shivajinagar Shivajinagar, Hyderabad-500016, India. Telephone: 080-26000000. Fax: 080-26000001. E-Mail: csindia@jindalworldwide.com. Website: www.jindalworldwide.com
NOTICE OF CANDIDATURE TO MEMBERS OF THE COMPANIES ACT, 2013
Pursuant to the provisions of Section 103 of the Companies Act, 2013 read with the Rule 15 of the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014, notice to members is hereby given that the Company had received notices of candidature in writing from Mr. Anil Agrawal and Dr. Venkatesh Agrawal proposing the candidature of Mr. Manojesh Jha Thakur & Dr. Shrikant Jha for appointment as the Independent Directors of the Company, respectively, alongside the deposit of requisite amount of Rs. 1,00,000/- (Rupees One Lakh only) each. The agenda item relating to appointment of the said Independent Directors & their particulars has been included in the Notice of AGM to be held on 27th September, 2017 which forms part of the Annual Report 2016-2017 of the Company and also the notices of candidature are available on the website of the Company.
By order of the Board of Directors
Jindal Worldwide Limited
Sd/- (Mr. Anil Agrawal)
Managing Director (080-60160001)

GUJARAT INDUSTRIAL DEVELOPMENT CORPORATION
(A Govt of Gujarat Undertaking)
Office of the Superintending Engineer (CG)
1st Floor, Narmada Commercial Complex
M.G. Road, Panch Sattli, Bharuch-392001
Phone : (026242) 242432/242442 Fax: (026242)241902

PUBLIC NOTICE
Public is hereby informed that Environmental and CRZ Clearance for the Development of Petroleum, Chemical and Petro-chemical Investment Region (PCPIR) by Gujarat Industrial Development Corporation has been accorded by Ministry of Environment, Forest and Climate Change, New Delhi. The copy of the Environmental and CRZ Clearance is available with Gujarat Pollution Control Board and may also be seen on the website of the Ministry of Environment, Forest and Climate Change at <http://www.envfor.nic.in>.

Sd/-
Superintending Engineer (CG)
G.I.D.C., Bharuch
No. INF/BCH/414/2017-18

Gujarat Livelihood Promotion Company (GLPCL)
Government of Gujarat
E-Tender (Request for Proposal) Notice Hiring Of Agency For Technical Support Agency (TSA) For GLPCL For Existing / Proposal Project Implementation Agencies (PIAs).

RFP Notice No. GLPC/STP/DDU-GKT/8754/2017
GLPCL has decided to seek services of an agency for Hiring Of Agency For Technical Support Agency (TSA) for GLPCL For Existing / Proposed Project Implementation Agencies (PIAs).
Proposal in the form of BIDs is requested from agencies, willing to bid for offering the services of Technical Support. The RFP document can be downloaded from the websites www.nprocure.com from 13:30 Hrs 20th September, 2017 onwards.

Important Dates :
a) Last Date & Time for Submission of Bids: 27.09.2017, 15:00 hrs
b) Technical Bid Opening Date & Time : 27.09.2017, 16:00 hrs
Interested bidders are requested to download the tender document from the above mentioned websites.
Further details can be obtained from the office of GUJARAT LIVELIHOOD PROMOTION COMPANY LIMITED, 3rd floor, Block No. 18, Udyog Bhavan, Gandhinagar, Gujarat - 382011. Phone : +079-23248513;
e-mail: md@glpc.co.in, apmstp@glpc.co.in
INF/1717/17-18

GUJARAT WATER SUPPLY & SEWERAGE BOARD
SECTOR-10/A, GANDHINAGAR
SHORT NOTICE INVITING ON LINE TENDER
Tender ID No. 278406
GWSSB invites on-line tender through e-tendering for "Providing cleaning services, mechanized environmental support services (up keeping) with maintenance for Jalbhavan Sankul, GWSSB, Sector 10 A, Gandhinagar for 12 month.
Estimated Amount : Rs.16,97,400.00. With experience in similar works to participate in above tender may view the detailed tender notice & download the Tender documents from web site.
<https://www.nprocure.com>
Last date of submission of on-line tender is 09.10.2017. Pre-bid Meeting on 25.09.2017
Last date Physical Submission 17.10.2017 by RPAD/Speed Post.
INF/1715/17-18

GOVERNMENT OF GUJARAT
NARMADA, WASTER RESOURCES, WATER SUPPLY & KALPSAR DEPARTMENT
E-TENDER NOTICE NO. 11 OF 2017-18
In the Name and on behalf of Governor of Gujarat State, the Executive Engineer, Kadana Division No. 1, Diwada Colony, Taluka: Kadana, Dist: Mahisagar Pincode No. 389250 (Phone No. 02675-237674) invited on line tender for work Sr.No. 1 to 18 of costing from Rs 4.68 to 14.59 Lakhs from the Registered contractors in form B.1. The Bid Document of works will be available on Web site <https://nwr.nprocure.com> or www.statetender.com dt. 22.9.2017 to 6.10.2017 at 18.00 Hrs.
More details are available on web site or personally visit during working hours please.
(INF/Godhra/470/17)

GUJARAT WATER SUPPLY AND SEWERAGE BOARD
TENDER NOTICE NO. 5 of 2016-17 (3rd Attempt)
Executive Engineer, P.H. Mech. Dn. Godhra, G.W.S.S.B., Mangal Building, Nr. Panchal Hospital, Ankleshwar Mahadev road, Godhra invites on-line- tender from appropriate class of Govt. approved registered/having work experience bidders for the construction M.S. Platform for storage Tank, SITC of Solar base P.m/c with PV Panels, mounting, Dual Hand Pump (Modified) etc. complete including M & R for 5 years under Action Plan-2016-17 for jurisdiction of Panchmahal district. Estimate cost of Tender Rs. 148.18 lakhs. The tender I.D. is 277172 The Tender downloading Dt. 25.09.2017 up to 18.00 Hrs. For further details of Tender Notice. Scope of Work & Specification & further any Amendments made will be disburse only on Web site log on to www.nprocure.com & www.gwssb.gujarat.gov.in & also details available during office hours at above office address.
(INF/Godhra/469/17)

Arvind Fashions and Anup Engineering set to become independent of parent Arvind Limited



From L to R - Mr. Kulin Lalbhai, Executive Director, Arvind Ltd., Mr. Jayesh Shah, CFO, Arvind Ltd, Mr. Sanjay Lalbhai, CMD, Arvind Ltd and Mr. Punit Lalbhai, Executive Director, Arvind Ltd.

Mumbai, Arvind Limited, India's largest textile and branded apparel player, announced its decision today to demerge its Branded Apparel and Engineering businesses from the parent company.

The Branded Apparel business will be demerged into the entity Arvind Fashions Limited. At 25% CAGR, the branded apparel business is one of the fastest growing apparel and accessory businesses in the country. It has a rich portfolio of international and owned brands. The portfolio of brands includes US Polo Association, Arrow, Flying Machine, Tommy Hilfiger, Gap, Calvin Klein, Hanes, Gant, Nautica, Izod, Ed Hardy, Elle, Cherokee, The Children's Place and Aeropostale. It also owns the value chain

'Unlimited' and is the franchise partner of the world's largest beauty retailer 'Sephora'. Shareholders of Arvind Limited will be entitled to 1 equity shares of Arvind Fashions Limited for every 5 shares held by them.

The Engineering business will be demerged into an entity which will be named Anup Engineering. This business is engaged in the manufacturing of critical process equipment. Anup has been consistently growing at 25% and delivering a robust financial performance. Shareholders of Arvind Limited will be entitled to 1 equity shares of Anup Engineering Limited for 27 shares held by them.

On completion of the process, both the companies will be listed on BSE and NSE.

Commenting on the de-

velopment, Sanjay Lalbhai, Chairman and Managing Director of Arvind Limited said, "In last few years, Arvind has nurtured a diverse set of businesses.

Two years ago, we demerged Arvind Smart Spaces as an independent company, and its performance has exceeded expectations. We are very pleased to announce that Arvind Fashions and Anup Engineering will now also pursue their independent courses. Arvind Fashions has already demonstrated an industry-leading track record in the branded apparel and accessory space. Anup has demonstrated an impeccable trajectory on customer delight, topline growth and profitability. Financial independence will help unlock the full potential of these businesses."

The order is for design,

LANXESS once again in leading position of climate protection scoring

Mumbai, November 2017: At the United Nations World Development Information Day, the international climate protection initiative CDP (formerly Carbon Disclosure Project) honored specialty chemicals company LANXESS.

The Cologne-based company once again achieved the highest score in this year's evaluation and is therefore listed in the CDP's Climate A List. With this list, CDP recognizes companies' efforts to cut emissions, mitigate climate risks and develop the low-carbon economy. As part of the Climate A List, LANXESS is among the top five percent of several thousand

companies surveyed by the initiative.

The list of the best and the full set of company results are available on the initiative's website: www.cdp.net/en/scores-2017. LANXESS Board member Hubert Fink comments on the award: "As a globally active chemical company, we are committed to climate protection. Re-admission to the Climate A List confirms the effectiveness of our efforts in this area."

Commenting on the achievement, Neelan Jan Banerjee, Senior Executive Director, LANXESS India said, "It is a matter of pride for us at LANXESS to be included in the Climate A List. As this listing reiterates our com-

mitment to doing business across the globe in a sustainable manner and gives us the confidence that we are on the right path in addressing our sustainability goals and targets."

Even beyond climate protection, LANXESS's business activities, products and corporate initiatives contribute effectively to each of the 17 Sustainable Development Goals, which the United Nations draws attention to every year on October 24. They include clean water solutions as well as an educational initiative that has already supported hundreds of thousands of children, young people and young adults around the world.

Business Brief

Babymoon Vacation on rise in India: Cox & Kings Survey

Mumbai, To understand the demands and choices of the upcoming traveller's segment of 'Babymooners', Cox & Kings, the oldest and leading tour operator has released its survey titled 'Decoding the Babymoon Trend'. Babymoon is a term that refers to a brief vacation taken by would be parents to relax/travel before the baby is born.

Cox & Kings spoke with close to 1000 women comprising both pregnant women and new mothers. The survey was conducted in metro cities including Mumbai, Delhi, Bangalore and Kolkata. Interestingly the survey has revealed that 82% of the pregnant women wish to go on a Babymoon and the most preferred time is the second trimester.

About 72% of the new mothers had opted for a Babymoon during their pregnancy. 'Relaxation' being the primary reason for women to take a babymoon, they feel it offers a great window to have a child-free getaway.

Given a choice, 65% of women wish to take an international babymoon trip. The would-be mothers are quite clear about who they want to accompany with 77% of them wanting to go with their husbands only and not the entire family. This comprehensive survey by Cox & Kings has shed light on vital insights of 'Babymoon vacations'.

'Beach Destinations' are the most preferred for 88% of the women as it offers leisure beach walks and scenic views. The topmost priorities for the couple while planning the babymoon trip are safety, duration of travel and medical help.

Idea offers Unlimited Calling and 1GB data at just Rs. 179

Ahmedabad, 'Indians love to talk' - and to celebrate this, Idea has launched an Unlimited Calling recharge for just Rs. 179 with 1GB data. While there are about 400 million data users and growing at a fast pace, there are around 600 million users who exclusively use their mobile phones for making calls. The new recharge from Idea is targeted at all voice users. Idea customers can now make unlimited Local and STD calls and also get 1GB data for just Rs. 179.

The new recharge pack is available for prepaid customers using any type of handset, across the country. Idea prepaid customers who recharge online on www.ideacellular.com or using the MyIdea App will get additional 1GB data free.

Idea has released an ad campaign to promote this offer and the TVC went on air on 4th November. This is an integrated 360 degree campaign, spanning across television, radio, OOH and digital.

According to Mr. Sashi Shankar, Chief Marketing Officer, Idea Cellular, "In today's world of absolute connectivity, a phone call from an old friend still brings a smile to our face, and this is the creative concept of the campaign. With our Rs. 179 recharge we will enable customers to continue their conversations non-stop."

In true Idea style, the TVC is fun and light-hearted with a catchy play of words on 'baat'. It features people from all walks of life, enjoying their phone conversations as they go about their daily lives.

Coal India to legally examine show cause notices served to subsidiary

Kolkata, Coal India is going to "legally" examine the show cause notices issued by the Odisha government to its subsidiary - Mahanadi Coalfields Ltd - carrying penalty of Rs 20,169 crore for violating mining plans, environmental norms and other regulations, a top company official said on Wednesday.

"We have to get it examined legally and we have to see what are the legal provisions," Coal India Chairman Gopal Singh said on the sidelines of the 7th Asian Mining Congress here.

The respective deputy directors of mines in the Talcher, Rourkela and Sambalpur circles had issued 24 notices on October 31 to the officers of mining projects of Mahanadi Coalfields. The subsidiary received those on November 1. "The show cause notices have been issued for a total amount of Rs 20,169 crore towards compensation under section 21(5) of the Mines & Mineral Development Regulations (MMDR) Act, 1957, for production in violation of mining plan, Environmental Protection Act 1986, Water (Prevention and Control of Pollution) Act, 1974, and Air (Prevention and Control of Pollution) Act, 1981..." Coal India on Monday had said in a regulatory filing.

Vodafone launches the best postpaid plan in India with new red plans

Mumbai, Postpaid just got a lot more attractive for consumers. Vodafone India, one of India's leading telecommunications service providers, today announced the launch of its new set of RED postpaid plans that packs in unprecedented telecom and value added benefits under three types of plans - RED Traveler, RED International and RED Signature.

Speaking about the launch of the new Vodafone RED post-paid plans, Aneesh Khosla, Associate Director - Consumer Business, Vodafone India, said, "We are delighted to announce the launch of our new Vodafone Post Paid RED plans that guarantee our consumers a host of unprecedented benefits. These plans have been structured to provide our customers with the best telecom & non telecom benefits that cater to the ever evolving needs of our customers.

The New Vodafone postpaid plans under RED Traveler come with Free National Roaming and the guarantee that a consumer will never be charged for a call made from anywhere in India to anywhere in India. With Inbuilt Free data quotas up to 200GB and a Data roll over feature that allows consumers to carry forward unused data, Vodafone further guarantees that its postpaid consumers will never waste unused data. Furthermore, consumers opting for RED International will enjoy Free ISD minutes to USA, Canada, China, Hong Kong, Thailand, Malaysia and Singapore.

Note ban has been all pain and no gain: Tharoor

Thiruvananthapuram, Demonetisation has been all pain and no gain, senior Congress leader and Thiruvananthapuram Lok Sabha member Shashi Tharoor said on Wednesday, summing up the effects of the note ban on its first anniversary.

Addressing the media at the state party headquarters, Tharoor said: "Today is a sad day for the country as lots of trouble was thrust upon the people a year back. Figures point out that around 135-150 people died either while standing in the bank queue, or after being denied medical treatment as they had only the demonetised currency. Several marriages got postponed due to this, many lost jobs and the worst affected were the daily wage earning labourers," said Tharoor.

He pointed out that whatever benefits Prime Minister Narendra Modi had listed on account of the note

ban had not taken place.

"They (BJP) said many things would happen, and what actually happened was counterfeiting increased. On the black money front, what actually happened was just 0.013 per cent of black money has come back, as against what then Attorney General Mukul Rohatgi informed the Supreme Court that the black money in the country was Rs four lakh crore," said Tharoor.

He slammed the BJP which he said appears to have gone into a celebration mood on account of the "gains of demonetisation".

"When we see them celebrating, I actually do not know whether to cry or to laugh. Our former Prime Minister Manmohan Singh had predicted that the GDP would be down by two per cent, and now the figures released by the Centre state that the GDP has fallen by 2.1 per cent. In short, today

is a day of mourning and to mark this I removed my picture and have put black on my Twitter profile," added Tharoor. Tharoor pointed out "the BJP was the biggest gainer on account of demonetisation as they were able to pump in money for the Uttar Pradesh Assembly election campaign", and added that the "real impact of the note ban will now be out in the open during the Gujarat elections".

"While Himachal Pradesh does not have much of industries, in Gujarat, that's not the case, as it's always known to be

the engine of the Indian economy. There is going to be a strong backlash," said Tharoor. He termed demonetisation and the Goods and Services Tax as "like two shots being fired".

"The first one was demonetisation and the second shot came through GST. We (UPA) were the ones who first spoke about GST and what we had envisaged was a 'good and safe tax' regime, which would have given solace to the poor and weaker sections of the society, but today what we have is different layers of slabs," added Tharoor.

GCX announces plan for 'Cloud and Fiber Initiative' across fastest growing economies

New Delhi, Global Cloud Xchange (GCX), a subsidiary of Reliance Communications (RCOM), on Wednesday announced its "Cloud and Fiber Initiative" which includes the construction of the new EAGLE submarine cable system which will deliver latest subsea cable technology to meet growing cloud infrastructure and capacity demands from global enterprises and over the top (OTT) players.

"Nearly half the world's population is reachable

within a short distance from India's borders, giving India a strategic edge in the new digital era," said Bill Barney, CEO, RCOM and Chairman & CEO, GCX.

"The 'Cloud and Fiber Initiative' levels the playing field for India's tech companies to compete in the new digital order and to play a pivotal role in the anticipated hyper growth of technology expansion across the Emerging Markets Corridor," he added.

A company statement said plans are underway

with key telco and OTT partners from across major growth markets to ensure that the "Cloud and Fiber Initiative" delivers infrastructure and bandwidth required to support the next wave of economic growth driven by the Cloud revolution.

"Digital transformation of industries are driving accelerated growth of Cloud services in the Asia Pacific region," said Manoj Menon, Managing Director, Frost &

Sullivan Asia Pacific.

"China along with the emerging economies of India, Indonesia and Thailand are the front runners of this growth," he added.

Tapping on India's prime geographic location, the "Cloud and Fiber Initiative" will deliver a strategic edge to businesses with high speed transit from India West into Europe and East into the exponentially growing markets across Asia Pacific, the company said.

BHARAT SANCHAR NIGAM LIMITED
(ELECTRICAL WING)
PRESS NOTICE No. 06/17-18
PRESS NOTIFICATION FOR INVITING e- TENDER

E- Tender in the prescribed form are hereby invited by the O/o the Executive Engineer (E) BSNL Electrical Division, 6th Floor, Doorsanchar Bhawan Bldg, Ghod-dod Road, Opp Panjrapol, Karimabad, Surat Phone No 0261-2262100, Fax 2243500 Email: eelers@bsnl.com, on the behalf of

[1] Round the clock operation & comprehensive maintenance of EMS for TE Bldg Textile market, Surat (SSA SURAT) 2 nd Call [2] Round the clock operation & comprehensive maintenance of EMS for TE Bldg MAHIDHARPURA, Surat (SSA Surat) 2 nd Call

[1] e-47/EEE/BSNL/SRT/2017-18 [2] e-51/EEE/BSNL/SRT/2017-18

Tender documents can be downloaded from the Web Site www.tenderwizard.com / BSNL. Estimated cost of the work [1] Rs. 32.66,160/- [2] Rs. 1863840/- Cost of Bid Documents : Rs 590/- i/c 18% GST (Non refundable, EMD [1] Rs. 65,323/- [2] Rs. 37,277/- Date & time of opening of all e-tender will be 27.11.2017 at 12=00 Hrs.

Executive Engineer (Elect)
BSNL, Electrical Division, Surat

BHARAT SANCHAR NIGAM LIMITED
NOTICE INVITING E-TENDER

The Executive Engineer (E), BSNL Electrical Division-II, Vadodara, 2nd Floor, E-4 S/Otrs, T.E. Bldg., Subhanpura Compound, Vadodara-390 023, invites on behalf of the BSNL sealed item rate tenders for following works.

Sr. No.	NIT No. & Name of work	Dt. of closing
1	06/EEE/ED-II/(VDR)/BSNL/2017-18 Round the Clock Operation & Comprehensive Maintenance of E/M/S for T.E. Bldg Subhanpura and Comprehensive Maintenance of E/M/S for RLU T.E. Bldgs. Under BSNL Elct. Sub Division-III, Vadodara.	27.11.2017
2	07/EEE/ED-II/(VDR)/BSNL/2017-18 S.I.T.C. of 1 No. 10 Passengers Lift at T.E. Building., Alkapuri, Vadodara. (Against scrapping)	27.11.2017

For further details kindly visit our web site at www.gujarat.bsnl.co.in and www.tenderwizard.com/bsnl

Sd/- Executive Engineer (E) BSNL Electrical Division-II Vadodara

YURANUS INFRASTRUCTURE LIMITED
CIN - L74110GJ1994PLC021352
Reg. Office: 201, Maulik Arcade, Above Karnavati Pagarkha Bazar, Mansi Cross Road, Vastrapur, Ahmedabad - 380 015
E-mail Id: info@yuranusinfra.com. Website: www.yuranusinfra.com
Tel No./ Fax No. 079-26733353

NOTICE

The meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 14th November 2017 at 6:00 PM at the Registered office of the Company at 201, Maulik Arcade, Above Karnavati Pagarkha Bazar, Mansi Cross Road, Vastrapur, Ahmedabad - 380 015, inter alia, to consider & approve unaudited financial results for the quarter and half-year ended on 30.09.2017 and to transact other business. For further details please refer the weblink <http://www.yuranusinfra.com> & <http://www.bseindia.com/stock-share-price/yuranus-infrastructure-ltd/yuranus/536846/>

For, Yuranus infrastructure Ltd.
Date : 08.11.2017. Place : Ahmedabad.
sd/- Mohit Desai Managing Director

CHANGE OF NAME
I have changed my old name from **JITENDERKUMAR BEBOMAL ALIAS KANAYOMAL** to new name **JITENDRA KANAIYALAL KHANCHANDANI**.
Add. : F/501, Aatrey Green Hansol, Sardarnagar, Ahmedabad 230

CHANGE OF NAME
I have changed my old name from **MEMAN SOHANABAHEN SATTARBHAI** to new name **MEMAN SOHANA JAVED**.
Add. : 10, Aarif Twin Bungalows, Mehsana 229A

CHANGE OF NAME
I have changed my old name from **AVNI NATVARLAL PARIKH** to new name **AVANI NIRAVBHAI SHAH**.
Add. : 6-124, Sundarnagar Apt, Naranpura, Ahmedabad 227

CHANGE OF NAME
I have changed my old name from **MEERCHANDANI NEHPARVINKHANAM SALIMBHAI** to new name **MEER PARVIN SALIMBHAI**.
Add. : Plot No.669/1, Sector-7/B, Gandhinagar xxx

CHANGE OF NAME
I have changed my old name from **MEMAN MAHMADJAVED RASULBHAI** to new name **MEMAN JAVED RASULBHAI**.
Add. : 10, Aarif Twin Bungalows, Mehsana 229

CHANGE OF NAME
I have changed my old name from **MEERCHANDANI NEHPARVINKHANAM SALIMBHAI** to new name **MEER PARVIN SALIMBHAI**.
Add. : Plot No.669/1, Sector-7/B, Gandhinagar xxx

પથરીની સારવાર
ઓપરેશન વગર
લીથોટ્રીપ્સી દ્વારા
સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછા દરે
પારંગત-પારદર્શક-વિશ્વસનીય સારવાર
પરિમલ હોસ્પિટલ (Estd.-1982)
પુનીતમાર્ગ, ઝઘડીયા ઢિગ પાસે, મહિનગર, અમદાવાદ-૮.
Ph: 84600 65008, 98240 19394

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House" Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad-380015 • E-Mail Id: csjindal@jindaltextiles.com
Website: www.jindaltextiles.com • Phone: 079-71001500-557(Ext) CIN: L17110GJ1986PLC008942

NOTICE OF DISPATCH OF POSTAL BALLOT & REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given to all the members of the Company pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013, (the "Act"), read with Rule 20, 22 of the Companies (Management and Administration) Rules, 2014, (the "Rules") including any statutory modification or re-enactment thereof for the time being in force and pursuant to the provisions of the SEBI (LODR) Regulations, 2015, that:

- DISPATCH:** The Notice of Postal Ballot dated 28th October, 2017 along with Postal Ballot Form have been duly dispatched to all the members whose names appear in the Register of Members as on close of working hours on 01st November, 2017, (a) in electronic mode via E-mail to all the members whose E-mail Ids were registered in the records of the Registrar and Transfer Agent of the Company/Depositories on 7th November, 2017 and; (b) in physical mode via registered post, along with a prepaid postage self-addressed Business Reply Envelope to all the members of the Company whose E-mail Ids were not registered with the Registrar and Transfer Agent of the Company/Depositories, at their registered addresses on 8th November, 2017, for seeking approval of agenda items as appended below by means of Postal Ballot including voting by electronic means:

Item No.	Particulars of Agenda	Type of Business-Resolution - Manner of Approval Proposed
1.	To consider and approve the proposal of sub-division/ splitting of Face Value of Equity Shares from Rs. 10/- each to Rs. 5/- each of the company as per Section 61(1)(d) of the Companies Act, 2013 subject to approval of the members of the company by way of postal ballot u/s 110 of the Act.	Special Business- Special Resolution - Postal Ballot
2.	To consider and approve Alteration of 'Capital Clause' in Memorandum of Association as per the Sections 13 and 61 and all other applicable provisions, if any, of the Companies Act, 2013; subject to approval of the Members of the Company by way of Postal Ballot u/s 110 of the Act.	Special Business- Special Resolution - Postal Ballot

2. E-VOTING: Members holding shares either in Physical form or in dematerialized form, as on the cut-off date of Wednesday, 01st November, 2017, may cast their vote electronically on the Special Business as set out in the Notice of Postal Ballot through voting system of Central Depository Service (India) Limited (CDSL) ("remote e-voting"). All the members are informed that:

Remote E-Voting Period Commences On **Thursday, 09th November, 2017 (9:00 A.M.)**
Remote E-Voting Period Ends On **Friday, 08th December, 2017 (5:00 P.M.)**
The Cut-off date for determining the eligibility of members to vote either by Postal Ballot Form or electronic means: **Wednesday, 01st November, 2017**

Notice of Postal Ballot dated 28th October, 2017 along with Postal Ballot Form is available on the website of:

- Company: http://www.jindaltextiles.com/balot/Postal_Ballot_Notice%20_Form_2017.pdf
- Bombay Stock Exchange Limited: www.bseindia.com
- National Stock Exchange Limited: www.nseindia.com

In case of any Queries; members may contact to:

- Connected to Voting by Postal Ballot: CS Kiran Geryani, Company Secretary & Compliance Officer at the Registered Office address of the Company, or may write at csjindal@jindaltextiles.com.
- Connected with voting by Electronic Means: Members may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available on www.evotingindia.com under help election or write an email to helpdesk.evoting@cdsl.com or csjindal@jindaltextiles.com or csdshac@gmail.com.

Members may note that:

- Any Postal Ballot received from the members after 5.00 P.M. on 08th December, 2017 (Friday) will not be valid and it will be considered that no reply from the concerned Member has been received and voting by post or by electronic means shall not be allowed beyond the said date. The remote e-voting mode shall be disabled by CDSL after the aforesaid date and time for voting and once the vote on a resolution is casted by the member, the member shall not be allowed to change it subsequently.
- Any member of the Company may obtain the Login ID and password by sending a request at helpdesk.evoting@cdsl.com or csjindal@jindaltextiles.com. If a person is already registered with CDSL, for e-voting then existing user ID & password can be used for casting vote.
- Members can opt only one mode of voting i.e. either physical Postal Ballot Form or electronic voting. In case Members cast their vote through both the modes, voting done through electronic voting shall prevail and voting done through physical Postal Ballot Form shall be treated as invalid.
- Members, who have received the Postal Ballot Notice by E-mail and who wish to vote through physical Postal Ballot Form or in case of non-receipt of Postal Ballot Notice & Form or in any case if a member is desirous of obtaining a duplicate Postal Ballot Form, may send an E-mail to csjindal@jindaltextiles.com or csdshac@gmail.com for obtaining a duplicate thereof. The Company shall dispatch the same along with postage prepaid self-addressed Business Reply Envelope to the Member.
- Resolutions passed by the Members through postal ballot is deemed to have been passed as if they have been passed at the General Meeting of the Members of the Company.

Date: 8th November, 2017
Place: Ahmedabad

On Behalf of the Board of Directors
Sd/- (Mr. Amit Agrawal) Managing Director - DIN:00169061

Sharekhan re-launches new look branch at Navrangpura

Ahmedabad, Sharekhan, the preferred savings and investment partner for investors, announced the re-launch of its branch in Navrangpura, Ahmedabad today. This is Sharekhan's ninth branch in Ahmedabad with the other branches in Vastrapur, Paldi, Maninagar, Satellite and SG Highway. Sharekhan has had a presence in Gujarat since 2001, when it opened its first branch in Surat. On the occasion of the re-launch of the branch, Jaideep Arora, CEO, Sharekhan said, "With a growing customer base in Gujarat, it is important that Sharekhan provides enhanced services to support the growing requirements of our customers. Sharekhan serves more than two lakh customers in Gujarat. We are adding increasing numbers of mutual fund customers, especially through new SIP clients, every month. We will continue to invest in the Gujarat market with the aim of becoming the most preferred savings and investment partner for our customers."

Anahita Vora, Cluster Head - Gujarat, Sharekhan, said "We are pleased to re-launch the new look branch. Gujarat is a growing market of traders and investors."

એલઆઈસીની સેવા માટે પણ આધાર જરૂરી કરાયો

બેંક ખાતા અને મોબાઇલ ફોન ઉપરાંત તમામ સરકારી યોજનાઓમાં આધારને લિંક કરાયા બાદ વધુ એક નિર્ણય

આધારનું મહત્વ વધ્યું

- બેંક ખાતાઓ અને મોબાઇલ નંબરને પહેલાથી જ આધાર સાથે લિંક કરવા કહેવામાં આવ્યું છે
- તમામ સરકારી યોજનાઓમાં આધારને લિંક કરવા માટે કહેવામાં આવ્યું છે
- આધારને વીમા પોલિસીઓ માટે જોડી દેવાની બાબતને ફરજિયાત કરી દેવામાં આવી છે
- એલઆઈસી સહિત તમામ જીવન વીમા અને સામાન્ય વીમા કંપનીઓને મોકલી દેવામાં આવેલી સુચનામાં કહ્યું છે કે તેમને આ દિશાનિર્દેશને અમલી કરવા માટે વહેલી તક આગળ આવવું પડશે
- કંપનીઓ પેમેન્ટ કરતા પહેલા પોલિસી હોલ્ડર્સના આધાર અને નંબર જમા કરવા માટે કહેશે
- વીમા કંપનીઓને જોડી દેવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે નિર્દેશોમાં કાયદાકીય તકાત છે. હવે લાઈફ અને અન્ય વીમા કંપનીઓને વહેલી તકે નિયમો લાગુ કરવા પડશે. કેટલીક વીમા કંપનીઓ તો પહેલાથી જ તમામ પ્રકારની પોલિસી માટે પેન નંબર માંગે છે. જ્યારે તેને ફરજિયાત માટેની બાબત ૫૦,૦૦૦ રૂપિયાથી ઉપરના કેશ પ્રિમિયમ માટે હોય છે.

નવી દિલ્હી,
બેંક ખાતાઓ અને મોબાઇલ નંબર ઉપરાંત હવે તમામ સરકારી યોજનાઓમાં આધારને લિંક કરવામાં આવ્યા બાદ હવે વીમા પોલિસીઓ માટે પણ આધારને

જામપરના પટેલ યુવાન પર હુમલો

ખંભાળિયા: બજાણ રોડ પર પાંચ વાડી પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા ભાણવડ તાલુકાના જામપર ગામે રહેતા રવીભાઈ વિનોદભાઈ વીરપરીયા નામના ૨૬ વર્ષના પટેલ યુવાનને મોટરસાયકલ પ્રત્યે બોલાચાલી કરી બાળાળીયાના વણરામભાઈ જેરામભાઈ તથા તેની સાથે રહેલા એક અજાણ્યા શખ્સે બેકામ માર મારી પથ્થરનો છુટો ઘા મારીને લોહ-લોહાણ કરી મુકાબા પોરસણ ફરીયાદ અહીંની પોલીસમાં નોંધાવવામાં આવી છે.

લિંક કરવાની બાબતને ફરજિયાત કરી દેવામાં આવી છે. વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (આઈઆરડી)ની તરફથી આદેશની અસર ચોકસૂંપણે થશે. તેનાથી ફાયદો થશે. આની અસર એ થશે કે કંપનીઓ પેમેન્ટ કરતા પહેલા પોલિસી હોલ્ડર્સના આધાર અને પેન નંબર જમા કરવા માટે કહેશે. આવું નહીં કરવામાં આવતાં ચુકવણીને રોકી દેવામાં આવનાર છે. એલઆઈસીની સેવા માટે પણ આદાર જરૂર છે. આધાર અંગે માહિતી નહીં આપવાની સ્થિતિમાં નુકસાન થશે.

ઉરડા તરફથી આદેશ જારી કરવામાં આવ્યા બાદ પોલીસી ધારકોની અંદર આને લઈને ચર્ચા જોવા મળી રહી છે. હાલમાં જ બેંક ખાતા અને મોબાઇલ નંબર ઉપરાંત સરકારી યોજનાઓમાં આધારને લિંક કરવામાં આવ્યા બાદ વધુ એક મોટી

વ્યવસ્થા હવે અમલી કરવામાં આવી છે. ઉરડાએ પોતાના જાહેરનામામાં વર્તમાન પોલીસીને પણ આધાર અને પેન સાથે લિંક કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આઈઆરડીએ (લાઈફ)ના નીલેશ સાહેબે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે તમામ કંપનીઓને સુચિત કરવામાં આવ્યું છે કે તેમને કાયદાને પાળવાની જરૂર પડશે. વીમા કંપનીઓને જોડી કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે નિર્દેશોમાં કાયદાકીય તકાત છે. હવે લાઈફ અને અન્ય વીમા કંપનીઓને વહેલી તકે નિયમો લાગુ કરવા પડશે. કેટલીક વીમા કંપનીઓ તો પહેલાથી જ તમામ પ્રકારની પોલિસી માટે પેન નંબર માંગે છે. જ્યારે તેને ફરજિયાત માટેની બાબત ૫૦,૦૦૦ રૂપિયાથી ઉપરના કેશ પ્રિમિયમ માટે હોય છે.

જાહેર નોટિસ		જાહેર નોટિસ																																																																																																																								
<p>ICICI Bank ICICI Bank Limited</p> <p>રજિ. ઓફિસ : લેન્ડમાર્ક, રેસ કોર્સ સર્કલ, વલોદરા ૩૮૦૦૦૭. કોર્પોરેટ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧</p> <p>સોનાની હરાણ અને નિમંત્રણ નોટિસ</p> <p>નીચે દર્શાવેલા દેવાદારોને નેમ્બે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ (આઈસીઆઈસીઆઈ બેંક) પાસેથી સોનાના વહેરાણી (સુવિધા) સામે લેવાયેલી રકમ પટે બાકીની રકમ ચુકવી આપવા માટે નોટિસો પાઠવામાં આવી છે. આ સુવિધા હેઠળ તેઓ તેમની બાકીની રકમ ચુકવવામાં નિષ્ણદ રચા છે તેથી તેઓ મુકેલા સોનાના વહેરાણી નંબર ૨૦, ૨૦૧૭ના રોજ હરાણ થવા પડવાની અમને ફરજ પડી છે. આ હરાણ મારકેટ વધારાની રકમ ઉપજશે તો તે રકમ સંબંધિત બાકીદારોને પરત આપવામાં આવશે અને હરાણ પછી રકમ વધવાની બાકી હશે તો તેની વ્યૂહાત્મક કાર્યવાહી પાસેથી થોડુંક કમી કરવામાં આવશે. આગાઉથી જાણ કર્યા વિના નીચે દર્શાવેલા ખાતા પેઠી ક્રોડ પણ ખાતુ હટાવવાની આઈસીઆઈસીઆઈ બેંકને સત્તા છે. વધુમાં આઈસીઆઈસીઆઈ બેંકને હરાણની તારીખ આગાઉથી જાણ કર્યા વિના બદલવાનો પણ અધિકાર છે.</p>																																																																																																																										
<table border="1"> <thead> <tr> <th>બેંક ખાતા નં</th> <th>સાંબંધિત નામ</th> <th>અવકાશિત નામ</th> </tr> </thead> <tbody> <tr> <td>198106001214</td> <td>બેંક નામદાર</td> <td>બેંક નામદાર</td> </tr> <tr> <td>198106001126</td> <td>બેંક નામદાર</td> <td>બેંક નામદાર</td> </tr> <tr> <td>048605005246</td> <td>વિરવે પ. વલ્લભી</td> <td>વિરવે પ. વલ્લભી</td> </tr> <tr> <td>048605002834</td> <td>સુરેશભાઈ મહેનદાસ રામણી</td> <td>સુરેશભાઈ મહેનદાસ રામણી</td> </tr> <tr> <td>048605005242</td> <td>અરવિંદભાઈ સમરભાઈ રામણી</td> <td>અરવિંદભાઈ સમરભાઈ રામણી</td> </tr> <tr> <td>171106002104</td> <td>મહાદેવભાઈ મેઘ, ઉપાધી</td> <td>મહાદેવભાઈ મેઘ, ઉપાધી</td> </tr> <tr> <td>171106003071</td> <td>નરસિંહભાઈ મહેનદાસ રામણી</td> <td>નરસિંહભાઈ મહેનદાસ રામણી</td> </tr> <tr> <td>171106006082</td> <td>પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ</td> <td>પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ</td> </tr> <tr> <td>170805002902</td> <td>સમીર પ. વલ્લભી</td> <td>સમીર પ. વલ્લભી</td> </tr> <tr> <td>170805001937</td> <td>કમલેશભાઈ મ. અમીરભાઈ</td> <td>કમલેશભાઈ મ. અમીરભાઈ</td> </tr> <tr> <td>170805005111</td> <td>કમલેશભાઈ પુલકાંત સોલંકી</td> <td>કમલેશભાઈ પુલકાંત સોલંકી</td> </tr> <tr> <td>170805011188</td> <td>શૈલેશભાઈ ગાડા</td> <td>શૈલેશભાઈ ગાડા</td> </tr> <tr> <td>170805011201</td> <td>સરજાનભાઈ અરવિંદભાઈ</td> <td>સરજાનભાઈ અરવિંદભાઈ</td> </tr> <tr> <td>170805011208</td> <td>કમલેશભાઈ મહેનદાસ રામણી</td> <td>કમલેશભાઈ મહેનદાસ રામણી</td> </tr> <tr> <td>2011060000194</td> <td>મહેશભાઈ મેઘ, ઉપાધી</td> <td>મહેશભાઈ મેઘ, ઉપાધી</td> </tr> </tbody> </table>	બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ	198106001214	બેંક નામદાર	બેંક નામદાર	198106001126	બેંક નામદાર	બેંક નામદાર	048605005246	વિરવે પ. વલ્લભી	વિરવે પ. વલ્લભી	048605002834	સુરેશભાઈ મહેનદાસ રામણી	સુરેશભાઈ મહેનદાસ રામણી	048605005242	અરવિંદભાઈ સમરભાઈ રામણી	અરવિંદભાઈ સમરભાઈ રામણી	171106002104	મહાદેવભાઈ મેઘ, ઉપાધી	મહાદેવભાઈ મેઘ, ઉપાધી	171106003071	નરસિંહભાઈ મહેનદાસ રામણી	નરસિંહભાઈ મહેનદાસ રામણી	171106006082	પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ	પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ	170805002902	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી	170805001937	કમલેશભાઈ મ. અમીરભાઈ	કમલેશભાઈ મ. અમીરભાઈ	170805005111	કમલેશભાઈ પુલકાંત સોલંકી	કમલેશભાઈ પુલકાંત સોલંકી	170805011188	શૈલેશભાઈ ગાડા	શૈલેશભાઈ ગાડા	170805011201	સરજાનભાઈ અરવિંદભાઈ	સરજાનભાઈ અરવિંદભાઈ	170805011208	કમલેશભાઈ મહેનદાસ રામણી	કમલેશભાઈ મહેનદાસ રામણી	2011060000194	મહેશભાઈ મેઘ, ઉપાધી	મહેશભાઈ મેઘ, ઉપાધી	<table border="1"> <thead> <tr> <th>બેંક ખાતા નં</th> <th>સાંબંધિત નામ</th> <th>અવકાશિત નામ</th> </tr> </thead> <tbody> <tr> <td>211060001966</td> <td>સુરેશભાઈ મહેનદાસ રામણી</td> <td>સુરેશભાઈ મહેનદાસ રામણી</td> </tr> <tr> <td>211060002895</td> <td>ઉપાધી કમલેશભાઈ મહેનદાસ</td> <td>ઉપાધી કમલેશભાઈ મહેનદાસ</td> </tr> <tr> <td>030805005922</td> <td>વિરવે પ. વલ્લભી</td> <td>વિરવે પ. વલ્લભી</td> </tr> <tr> <td>1379605003882</td> <td>સમીર પ. વલ્લભી</td> <td>સમીર પ. વલ્લભી</td> </tr> <tr> <td>171205002674</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> </tr> <tr> <td>171205004566</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> </tr> <tr> <td>171205004529</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> </tr> <tr> <td>1707050022718</td> <td>સમીર પ. વલ્લભી</td> <td>સમીર પ. વલ્લભી</td> </tr> <tr> <td>170705005189</td> <td>સમીર પ. વલ્લભી</td> <td>સમીર પ. વલ્લભી</td> </tr> <tr> <td>170705005196</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> </tr> <tr> <td>170705005206</td> <td>સમીર પ. વલ્લભી</td> <td>સમીર પ. વલ્લભી</td> </tr> <tr> <td>2011060000194</td> <td>મહેશભાઈ મેઘ, ઉપાધી</td> <td>મહેશભાઈ મેઘ, ઉપાધી</td> </tr> </tbody> </table>	બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ	211060001966	સુરેશભાઈ મહેનદાસ રામણી	સુરેશભાઈ મહેનદાસ રામણી	211060002895	ઉપાધી કમલેશભાઈ મહેનદાસ	ઉપાધી કમલેશભાઈ મહેનદાસ	030805005922	વિરવે પ. વલ્લભી	વિરવે પ. વલ્લભી	1379605003882	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી	171205002674	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ	171205004566	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ	171205004529	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ	1707050022718	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી	170705005189	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી	170705005196	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ	170705005206	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી	2011060000194	મહેશભાઈ મેઘ, ઉપાધી	મહેશભાઈ મેઘ, ઉપાધી	<table border="1"> <thead> <tr> <th>બેંક ખાતા નં</th> <th>સાંબંધિત નામ</th> <th>અવકાશિત નામ</th> </tr> </thead> <tbody> <tr> <td>2488050000264</td> <td>દેવકાંત મહેનદાસ મેઘ</td> <td>દેવકાંત મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>656305000185</td> <td>વેળાવળી સુભાષભાઈ ચૌધરી</td> <td>વેળાવળી સુભાષભાઈ ચૌધરી</td> </tr> <tr> <td>084805001045</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> <td>અરવિંદભાઈ સમરભાઈ</td> </tr> <tr> <td>084805001046</td> <td>વેળાવળી સુભાષભાઈ ચૌધરી</td> <td>વેળાવળી સુભાષભાઈ ચૌધરી</td> </tr> <tr> <td>0153050010815</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>3388050000052</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>2398050000284</td> <td>કમલેશભાઈ મહેનદાસ મેઘ</td> <td>કમલેશભાઈ મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>215705001903</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>215705003642</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> <td>વલ્લભી મહેનદાસ મેઘ</td> </tr> <tr> <td>1184050044890</td> <td>સુભાષભાઈ મહેનદાસ મેઘ</td> <td>સુભાષભાઈ મહેનદાસ મેઘ</td> </tr> </tbody> </table>	બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ	2488050000264	દેવકાંત મહેનદાસ મેઘ	દેવકાંત મહેનદાસ મેઘ	656305000185	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	084805001045	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ	084805001046	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	0153050010815	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ	3388050000052	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ	2398050000284	કમલેશભાઈ મહેનદાસ મેઘ	કમલેશભાઈ મહેનદાસ મેઘ	215705001903	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ	215705003642	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ	1184050044890	સુભાષભાઈ મહેનદાસ મેઘ	સુભાષભાઈ મહેનદાસ મેઘ
બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ																																																																																																																								
198106001214	બેંક નામદાર	બેંક નામદાર																																																																																																																								
198106001126	બેંક નામદાર	બેંક નામદાર																																																																																																																								
048605005246	વિરવે પ. વલ્લભી	વિરવે પ. વલ્લભી																																																																																																																								
048605002834	સુરેશભાઈ મહેનદાસ રામણી	સુરેશભાઈ મહેનદાસ રામણી																																																																																																																								
048605005242	અરવિંદભાઈ સમરભાઈ રામણી	અરવિંદભાઈ સમરભાઈ રામણી																																																																																																																								
171106002104	મહાદેવભાઈ મેઘ, ઉપાધી	મહાદેવભાઈ મેઘ, ઉપાધી																																																																																																																								
171106003071	નરસિંહભાઈ મહેનદાસ રામણી	નરસિંહભાઈ મહેનદાસ રામણી																																																																																																																								
171106006082	પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ	પરવલ્લિકા કમ્પોઝિટીયલ ગ્રુપ																																																																																																																								
170805002902	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી																																																																																																																								
170805001937	કમલેશભાઈ મ. અમીરભાઈ	કમલેશભાઈ મ. અમીરભાઈ																																																																																																																								
170805005111	કમલેશભાઈ પુલકાંત સોલંકી	કમલેશભાઈ પુલકાંત સોલંકી																																																																																																																								
170805011188	શૈલેશભાઈ ગાડા	શૈલેશભાઈ ગાડા																																																																																																																								
170805011201	સરજાનભાઈ અરવિંદભાઈ	સરજાનભાઈ અરવિંદભાઈ																																																																																																																								
170805011208	કમલેશભાઈ મહેનદાસ રામણી	કમલેશભાઈ મહેનદાસ રામણી																																																																																																																								
2011060000194	મહેશભાઈ મેઘ, ઉપાધી	મહેશભાઈ મેઘ, ઉપાધી																																																																																																																								
બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ																																																																																																																								
211060001966	સુરેશભાઈ મહેનદાસ રામણી	સુરેશભાઈ મહેનદાસ રામણી																																																																																																																								
211060002895	ઉપાધી કમલેશભાઈ મહેનદાસ	ઉપાધી કમલેશભાઈ મહેનદાસ																																																																																																																								
030805005922	વિરવે પ. વલ્લભી	વિરવે પ. વલ્લભી																																																																																																																								
1379605003882	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી																																																																																																																								
171205002674	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ																																																																																																																								
171205004566	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ																																																																																																																								
171205004529	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ																																																																																																																								
1707050022718	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી																																																																																																																								
170705005189	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી																																																																																																																								
170705005196	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ																																																																																																																								
170705005206	સમીર પ. વલ્લભી	સમીર પ. વલ્લભી																																																																																																																								
2011060000194	મહેશભાઈ મેઘ, ઉપાધી	મહેશભાઈ મેઘ, ઉપાધી																																																																																																																								
બેંક ખાતા નં	સાંબંધિત નામ	અવકાશિત નામ																																																																																																																								
2488050000264	દેવકાંત મહેનદાસ મેઘ	દેવકાંત મહેનદાસ મેઘ																																																																																																																								
656305000185	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	વેળાવળી સુભાષભાઈ ચૌધરી																																																																																																																								
084805001045	અરવિંદભાઈ સમરભાઈ	અરવિંદભાઈ સમરભાઈ																																																																																																																								
084805001046	વેળાવળી સુભાષભાઈ ચૌધરી	વેળાવળી સુભાષભાઈ ચૌધરી																																																																																																																								
0153050010815	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ																																																																																																																								
3388050000052	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ																																																																																																																								
2398050000284	કમલેશભાઈ મહેનદાસ મેઘ	કમલેશભાઈ મહેનદાસ મેઘ																																																																																																																								
215705001903	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ																																																																																																																								
215705003642	વલ્લભી મહેનદાસ મેઘ	વલ્લભી મહેનદાસ મેઘ																																																																																																																								
1184050044890	સુભાષભાઈ મહેનદાસ મેઘ	સુભાષભાઈ મહેનદાસ મેઘ																																																																																																																								

દરજા (http://jewel-auction.procurementiger.com) વેબસાઇટ મારફતે તા. ૨૦ નવેમ્બર, ૨૦૧૭ના રોજ બેંકે ૧૨-૩૦ કલાકથી ૩-૩૦ કલાક સુધી ઓનલાઇન યોજાશે. વધુ માહિતી, નિયમો અને સરતો તથા હરાણમાં ભાગ લેવા માટે નોંધણી કરવાના સરકારના પરીદર્શનને વેબસાઇટ પર લોગ ઓન કરવું અથવા ઓફલાઇન પોલેન્ટો સંબંધિત સમાચાર પત્રિકા સંપર્ક કરવો. સમય મર્યાદાને લીધે હરાણ તે જ દિવસે પૂરી ન થાય તો તે નિયમો અને સરતોને અધારે તે પછીના દિવસે હરાણ થશે તેની નોંધ લેવી. ગ્રહસ્થ મુદ્દા થયેલ હશે તો આ હરાણને બંધની તમામ સરતો તેના કાનૂની વારસદારને લાગુ પડશે.

સહી/ અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિ. વતી

UNICK FIX-A-CORP & PRINTERS LTD.

SR. NO	PARTICULARS	3 MONTHS ENDED 30.9.2017	PRECEDING 3 MONTHS ENDED 30.6.2017	CORRESPONDING 3 MONTHS ENDED IN THE PREVIOUS YEAR 30.9.2016	YEAR TO DATE FIGURES FOR CURRENT PERIOD ENDED 30.9.2017	YEAR TO DATE FIGURES FOR THE PREVIOUS YEAR ENDED 30.9.2016	PREVIOUS YEAR ENDED 31.3.2017
	(Refer Notes Below)	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Income form Operations (a) Net Sales/Income from Operations (Net of excise duty) (b) Other Operating Income (Total Income form Operations (Net) Expenses	853.18	647.94	693.90	1501.12	1381.59	2784.88
2	a.Cost of materials consumed b.Purchase of Stock in trade c.Changes in inventories of finished goods	0.00	0.00	0.00	0.00	0.00	0.00
	d.Work in progress and stock-in-trade e.Employees benefits Expenses f.Depreciation & Amortisation expenses g.Other Expenses(Any item exceeding 10% of the total expenses relating to continuing operations to be shown separately Total Expenses	387.52	273.80	314.99	661.32	670.32	1264.00
3	Profit/(Loss) from operations before Other Income,finance cost & Exceptional Items (1-2)	466.16	374.14	378.91	839.80	711.27	1520.88
4	Other Income	3.32	7.31	10.44	10.63	13.61	30.57
5	Profit / (Loss) from ordinary activities before Finance cost & Exceptional Items (3+4)	147.13	96.91	110.70	244.04	229.78	456.32
6	Finance costs	18.30	17.44	25.12	35.74	57.32	107.49
7	Profit/(Loss) from ordinary activities after finance costs but before exceptional items (5-6)	128.83	79.47	85.58	208.30	172.46	348.83
8	Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00	0.00
9	Profit/(Loss) from Ordinary Activities before tax (7+8)	128.83	79.47	85.58	208.30	172.46	348.83
10	Tax Expense	41.83	25.78	27.50	67.61	55.61	124.80
11	Net Profit/(Loss) from Ordinary Activities after tax (9-10)	87.00	53.69	58.08	140.69	116.85	224.03
12	Extraordinary Item (net of tax expense)	0.00	0.00	0.00	0.00	0.00	0.00
13	Net Profit/(Loss) for the Period (11-12)	87.00	53.69	58.08	140.69	116.85	224.03
14	Share of Profit/(Loss) of associates*	0.00	0.00	0.00	0.00	0.00	0.00
15	Minority Interest*	0.00	0.00	0.00	0.00	0.00	0.00
16	Net Profit/(Loss) after taxes,minority interest and share of profit/(Loss) of associates (13+14+15)	87.00	53.69	58.08	140.69	116.85	224.03
17	Paid-up equity share capital (Face Value of Rs.10/- each)	548.50	548.50	548.50	548.50	548.50	548.50
18	Reserve Excluding Revaluation Reserve as per Balance Sheet of Previous Accounting Year.	87.00	53.69	58.08	1099.40	851.53	958.71
19i	Earning Per Share (before extraordinary items) (of 10/-each) (not annualised)	1.59	0.98	1.06	2.56	2.13	4.08
	a.Basic						
	b.Diluted						
19ii	Earning Per Share (after extraordinary items) (of 10/-each) (not annualised)	1.59	0.98	1.06	2.56	2.13	4.08
	a.Basic						
	b.Diluted						

Note:-

- (1) The above unaudited financial results were reviewed by the audit committee and taken on record by the board of directors on 9th Nov,2017.
- (2) The Statutory Auditor of the Company have carried out a limited review of the results for the quarter ended 30th Sep,2017.
- (3) The Company has only one business segment namely Printing.
- (4) No Investor Complaint has been received during the quarter ended 30.09.2017. Also there is no outstanding Complaint as on 30.09.2017.
- (5) As there are no extra ordinary items for the period the basic and diluted EPS before and after extraordinary items is identical.

BY ORDER OF THE BOARD
FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD
Bhupen Navit Vasa
MANAGING DIRECTOR.
DIN:00150585

Place : Ahmedabad
Date : 09.11.2017

સ્પોર્ટ્સ અપડેટ

શ્રીલંકાની ક્રિકેટ ટીમ પહેલી ટેસ્ટ રમવા માટે કોલકતા પહોંચી

કોલકતા,
દિનેશ ચંદીમલના નેતૃત્વવાળી શ્રીલંકાની ટીમ ભારતના છે અઠવાડિયાના પ્રવાસ માટે કોલકતા પહોંચી છે. પ્રવાસની શરૂઆત ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝથી થશે જેની પહેલી મેચ ૧૬ નવેમ્બરથી કોલકતાથી શરૂ થશે. શ્રીલંકાની ટીમ વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમની વિરુદ્ધ ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ રમશે. છ અઠવાડિયાના લાંબા પ્રવાસ માટે શ્રીલંકા ટીમ પોતાના નવા ક્રોય શિલાન સમરવીરા વિના જ ભારત પહોંચી છે. સમય પર વીજળ નહીં મળવાને કારણે સમરવીરા ટીમની સાથે આવ્યા નથી શ્રીલંકા ક્રિકેટના સુત્રોના જણાવ્યા અનુસાર એક બે દિવસમાં સમરવીરાને ભારત આવવા માટે વીજળ મળી જશે તેમને ચાર નવેમ્બર જ ટીમના બેટિંગ ક્રોય બનાવવામાં આવ્યા હતાં બેટિંગ ક્રોય બન્યા બાદ સમરવીરા શ્રીલંકાની ટીમની સાથે કોઈ પણ તાલિમ કેમ્પ આયોજીત કરી શક્યા ન હતાં કારણ કે ક્રોય બન્યા બાદ તેમની પાસે સમય ખુબ ઓછો હતો. શ્રીલંકાની ૧૫ સભ્યોની ટીમે આજે નેડેસ પર અભ્યાસ કર્યો હતો તે બોર્ડ અધ્યક્ષ એકાદમીની વિરુદ્ધ બે દિવસીય અભ્યાસ મેચ પણ રમશે. આ મેચ ૧૧ નવેમ્બરથી શરૂ થશે. શ્રીલંકાએ ભારતમાં આખરેવાર ૨૦૦૮માં ટેસ્ટ મેચ રમી હતી ત્રણ મેચોની તે સીરીઝ ભારતે ૨-૦થી જીતી હતી. ભારતે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાને તેની જ ધરતી પર ત્રણ ટેસ્ટ મેચોમાં ૩-૦થી પરાજય આપ્યો હતો અને ત્યારબાદ વનડે અને એક ટી ટવેન્ટી મેચમાં પણ કબી ન સ્વીપ આપી હતી. શ્રીલંકાની ટીમે જો કે પાકિસ્તાનની વિરુદ્ધ સાત પ્રદર્શન કર્યું અને સુપર ૮માં ટેસ્ટ સીરીઝ ૨-૦થી જીતી લીધી હતી પરંતુ ત્યારબાદ તે વનડે સીરીઝ ૦-૫થી ગુમાવી બેટી હતી. મહેમાન ટીમ આ ભારતીય પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચોની સાથે ત્રણ વનડે મેચ અને આટલી જ ટી ટવેન્ટી મેચ રમશે. ત્રણેય સીરીઝ મળી કુલ નવ મુકાબલા રમાશે.

રાકેશ અસ્થાનાની નિમણૂક મામલે ૧૩મીએ સુનાવણી

નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે આદેશ કરતા કહ્યું છે કે સીબીઆઈના ખાસ નિર્દેશક તરીકે ગુજરાત કેન્દરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકાર ફેંકી દાખલ કરવામાં આવેલી અરજી પર તે ૧૩મી નવેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરશે. ન્યાયામુર્તિ જે ચેલેન્જર અને ન્યાયમુર્તિ એસ અબ્દુલ નજરની પીઠ સમક્ષ લાવવામાં આવ્યા બાદ આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. એનજીઓ કોંગ્રેસ કોજ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણે સમગ્ર મામલામાં હવેલી સુનાવણીની માંગ કરી હતી.

પ્રશાંત ભુષણે કહ્યું હતું કે આ મામલો ખાસ સીબીઆઈ નિર્દેશક તરીકે એક વ્યક્તિની નિમણૂક સાથે સંબંધિત છે. તેઓ આને પડકાર ફેંકી રહ્યા છે. અરજીમાં અસ્થાનાની નિમણૂકને ગેરકાયદે અને મનમાની તરીકે જણાવેલ અનેક તર્કદાર દલીલો કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સીબીઆઈ એક મામલાની તપાસ કરી રહી છે. જેમાં

સંજેલીમાં રાજવી પરિવારના સભ્યનું આકસ્મિક નિધન થતા નગરમાં શોકની લાગણી

સંજેલી,
સંજેલી નગરમાં રાજવી પરિવારના પપુદાદા ઉર્ફે દિગ્વીજયસિંહ મોહનસિંહ ચૌહાણ ઉ. ૪૫ નું તા. ૧૧ ને બુધવારના રોજ પોતાના ખેતરમાં આવેલ કુવામાં અકસ્માત રીતે પડી જતા કુવામાં પાણીમાં ડુબી જવાથી મરણ થયું હતું જેની જાણ સુરેન્દ્રસિંહ સોલંકીએ સંજેલી પોલીસ મથકે જાણ કરી હતી.

સંજેલીનાગર એ રજવાડા વખતનું ગામ છે અને સંજેલી ખાતે રાજવી પરિવાર રહે છે. બુધવારના રોજ બપોરના ૪.૦૦ વાગ્યાના સુમારે પપુ દાદા ઉર્ફે દિગ્વીજયસિંહ મોહનસિંહ ચૌહાણનું પોતાના ખેતરમાં આવેલ કુવામાં અકસ્માત રીતે પડી જતાં પાણીમાં ડુબી જતાં મોત નીપજ્યું હતું જેઓ સંજેલી નગરમાં આવેલી ડો. શિલ્પન આર. જોષી હાઈસ્કૂલના ટ્રસ્ટી કેશવ એજ્યુકેશનમાં ટ્રસ્ટી પુષ્પસાગર કિનારે આવેલ સાઈબાબાના મંદીરના પ્રમુખ તેમજ જીલ્લા વિશ્વ શિક્ષુ પરિષદના સંયોજક ગોરશંક દળના પ્રમુખ હતા જેઓ સમાજ દરેક કાર્યોમાં અગ્રેસર

નામ બદલેલ છે
મેં મારું નામ વિદ્યા પુરુષોત્તમ જોષી હતું તે બદલીને વિદ્યા પુરુષોત્તમ જોષી રાખેલ છે.
સરનામું : ૮૬/૧, રાવલ શેરી, છબીલા હનુમાન રાયપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ
CIN: U51909GJ2014PTC078496
રજી. ઓફિસ : સત્યાગ્રહ ઘાવણી, લેન નં.૨૧, ઠાંગલા નં. ૫૦૮, ખેડપુર કોસ રોડ પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫, ગુજરાત.
ઇમેલ : virtuoustradecorp@gmail.com
રિજીસ્ટ્રેશન કાર્યકર, નોર્થ વેસ્ટ રિજીસ્ટ્રેશન ઓફિસ સત્યાગ્રહ ઘાવણી, લેન નં.૨૧, ઠાંગલા નં. ૫૦૮, ખેડપુર ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫ (ગુજરાત) ખાતે આવેલી છે. (અરજદાર)

વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ કે જેની રજીસ્ટ્રેશન ઓફિસ સત્યાગ્રહ ઘાવણી, લેન નં.૨૧, ઠાંગલા નં. ૫

US companies commit continued investments in India

New Delhi, Representatives of around 45 American companies met Prime Minister Narendra Modi at this year's Global Entrepreneurship Summit (GES) in Hyderabad and expressed their commitment to continue investing in India, a top Indian American business leader has said.

These representatives were part of a delegation of the US India Strategic Partnership Forum (USISPF), a newly set-up non-profit organisation focused on deepening business relations between the US and India and enhancing the strategic relationship between the two countries.

"I can't talk about the specifics (of the meeting with Modi) because it was off the record. But basically the companies did meet with the Prime Minister and they showed their commitment to continued investment into India," USISPF President Mukesh Aghi told IANS in an interview.

The US looks at building its relationship with India on two broad principles. "One principle is that economic prosperity of India is good for America. And the second principle is a militarily strong India is good for regional stability," Aghi said.

If India became economically more prosperous and there was more dispo-

able income, people would tend to buy more US goods, or send more of their kids for education to the US, he said.

"If you look at this year, the enrollment of Indian students in the US went up by 12 per cent. So we have 186,000 Indian students in the US," he stated.

"That's one. Two, if you look at companies like Amazon, look at Uber, look at WhatsApp or Google, you know they have a tremendous market share in the Indian market. Their businesses grow because consumer spending is growing in India because of economic prosperity."

On the defence side, Aghi said that if India be-

came more prosperous, it would spend more money on defence.

"If you look at the last three years, the procurement with India has gone up to \$15 billion," he said.

"We are talking Make in India also from the manufacturing perspective of defence equipment. So, I think those principles are driving this relationship."

On the current business environment in India, Aghi referred to the World Bank's Ease of Doing Business rankings which saw India jumping from the 130th rank to 100th.

"When this government came in 2014, India's ranking was 142. And now it has

come to 100. I think that is a positive sign and we will keep on urging the government to go to below 50. That should be the ambition," he stated.

About the economic reforms being undertaken by the Indian government, he said these have been certified by credit rating agency Moody's, which has upgraded India's sovereign rating to Baa2 from its lowest investment grade of Baa after 14 long years.

"What the government is doing is the right stuff — which seems to send a strong message to investors also. Moody's ranking is a positive sign, very positive," he said.

On what were the key takeaways for USISPF from this year's GES, which was held on the theme "Women First, Priority for All", Aghi said: "I think the number one takeaway is that start-ups and entrepreneurship are important for job creation. That's what India needs."

He also stressed on the involvement and engagement of women entrepreneurs and women workers for the growth of GDP and economy.

"You know, a McKinsey report shows that by 2025, if you engage more women workers, it will have an impact of \$12 trillion on the global economy," the USISPF president said.

IANS

Business Brief

Key Indian equity indices open in green

Mumbai, Key Indian equity indices on Monday opened on a higher note with healthy buying in consumer durables, auto and healthcare stocks.

At 9.16 a.m., the wider Nifty50 of the National Stock Exchange (NSE) traded higher by 44.65 points or 0.44 per cent at 10,166.45 points.

The barometer 30-scrip Sensitive Index (Sensex) of the BSE, which opened at 32,968.02 points, traded at 32,957.44 points — up 124.50 points or 0.38 per cent — from Friday's close. The Sensex touched a high of 33,008.47 points and a low of 32,955.49 during the intra-day trade so far. The BSE market breadth was bullish — 1,054 advances and 343 declines. On Friday, the benchmark indices were dragged lower by growing concerns over the country's widening fiscal deficit, coupled with negative global cues and profit booking in auto, metal and oil and gas stocks.

The wider Nifty50 declined by 104.75 points or 1.02 per cent to close at 10,121.80 points, while Sensex closed at 32,832.94 points — down 316.41 points or 0.95 per cent.

Shine launches India's largest career skills and courses marketplace

Ahmedabad : Shine.com, the most innovative and currently the second largest online job portal in India introduces www.shinelearning.com, a professional courses & certifications marketplace for working professionals. Being a part of Shine.com, Shine Learning uses data (both recruiters' and candidates') to map demands of various skill sets across industries, predict emerging skill shortage areas and provide courses basis that. Shine Learning uses an algorithm that not only forecasts emerging skill sets but also recommends courses to candidates after analyzing their resumes and application history. It's almost like having a virtual course counsellor, empowering users to make an informed decision.

ShineLearning.com aims at equipping the working professionals with skills that would enable them to be ready for the future job opportunities and stay relevant. The platform offers industry and government recognized certifications, course recommendations, unbiased user reviews and a variety of 500+ courses from leading vendors across the globe.

"Innovation is what will give us a competitive edge in today's dynamic market. The objective was to prepare India for the future. Today's working professionals are exposed to a plethora of opportunities, however, there is a vacuum at both employee and recruiter ends in terms of required skillset. With Shine Learning our focus was to tap into the growing e-learning category as the industry displays huge growth prospects. Our aim is to enable our audience to build a career and adopt looking at the industry through a larger lens," said Mr. Zairus Master, CEO, Shine.com.

Shine Learning focuses on upgrading skill sets, enabling candidates to build a career in the longer run. The portal is one of its kind, integrating predictive analysis and data science to provide most in-demand up-skilling courses which cater to different industries and increases employability.

Ahmedabad Branch of ICAI to organise Mega Summit 2017 on 22nd & 23rd Dec'17

Ahmedabad, The Ahmedabad branch of Western India Regional Council (WIRC) of the Institute of Chartered Accountants of India (ICAI) has organised Mega Summit 2017 on the theme "Be The Change" on 22nd and 23rd December, 2017 at University Convention Hall. Dr Subramanian Swamy will be Key note speaker and he will deliver his speech on the topic "Indian Economy & the way forward".

Giving details about the conference, CA Chintan Patel, Chairman, Ahmedabad branch of WIRC of ICAI and Conference Director said "The renowned faculties across the country will address the participants on Income Tax, GST, Benami Property and other contemporary issues during Two Days conference. Ahmedabad branch has organised various activities and seminars on different topics during the year and this Mega Summit 2017 is the biggest amongst all with around 2,000 participants."

He further said "The Mega Summit 2017 will have eminent faculties like Dr Girish Ahuja, CA Gautam Nayak, CA Rashmin Sanghvi, Adv.K.Vaitheeswaran, CA Rakesh Agarwal, CA Khushroo Pantkey and more. The major topics to be discussed will be recent changes in International Taxation, Audit Documentation & Working Papers from SME perspective, recent important case laws on income from business & profession etc."

Facebook opens new office in London, to hire 800 people

London, Facebook has opened a new office in London and has announced that it would hire 800 people which will take the total strength of its employees in Britain to 2,300 workers by the end of 2018, the media reported on Monday.

The new seven-storey office building in central London will make the British capital Facebook's largest computer engineering base outside of the US, The Telegraph reported.

"Today's announcements show that Facebook is more committed than ever to the UK and in supporting the growth of the country's innovative start-ups," said Nicola Mendelsohn, Facebook's Vice President for Europe, the Middle East and Africa.

Facebook opened its first office in London 10 years ago. The new building will house developers and sales staff. Google, Apple and Snap, the parent company of Snapchat, have expanded their operations in London since the Brexit vote last year, the report added.

"It's a sign of confidence in our country that innovative companies like Facebook invest here, and it's terrific news that they will be hiring 800 more highly skilled workers next year," Chancellor Philip Hammond said.

May in Brussels for key Brexit talks

Brussels, British Prime Minister Theresa May will meet key European Union (EU) figures on Monday here for talks on Brexit which could determine whether the UK is able to move on to negotiations on trade.

The Prime Minister, accompanied by the Brexit Secretary David Davis, will meet European Commission president Jean-Claude Juncker, with Downing Street saying "plenty of discussions" lie ahead, reports the BBC. It has described the meeting as an "important staging post" on the route to the "crucial" summit with the other 27 leaders in the middle of the month when it hopes trade talks can begin.

The timings of May's visit marks a deadline set by Donald Tusk, the president of the European Council, for her to come forward with an improved offer on the terms of the UK's withdrawal from the EU.

The UK is hoping to start talks about a free trade agreement but the EU has said that it will only recommend this can take place when it deems "sufficient progress" has been made on the other issues.

RBI expected to hold key interest rate

Mumbai, The Reserve Bank of India (RBI) is expected to keep its key interest rate unchanged at its penultimate monetary policy review of the fiscal on Wednesday owing to higher inflation in October and a surge in oil prices, even as the reversal in the decline of GDP growth during the second quarter has eased pressure on the central bank to cut rates.

At its previous bi-monthly policy review here in October, the RBI had maintained status quo on its repo, or short term lending rate for commercial banks, at six per cent, citing risks to inflation and uncertainties on the external and fiscal fronts.

The central bank had earlier, in August reduced the repo, or its repurchase rate by 0.25 percentage points to six per cent.

According to the minutes of October's Monetary Policy Committee (MPC) meeting, Governor Urjit Patel said: "We have to be

vigilant on account of uncertainties on the external and fiscal fronts; this calls for a cautious approach."

Japanese financial services major Nomura said in a report that input cost pressures are marginally higher now, which along with higher food inflation is likely to push retail inflation slightly above the RBI's target of four per cent in November and beyond.

"We expect a hawkish hold from the RBI..and policy rates to remain unchanged through 2018," it said.

Data released in November showed that India's annual rate of inflation based on wholesale prices (wholesale price index) rose to 3.59 per cent in October due to an exponential rise in food prices.

In addition, the consumer price index (CPI), or retail, inflation for October rose to 3.58 per cent from 3.28 per cent in September.

Domestic credit rating agency ICRA said the MPC would leave the repo rate

unchanged at six per cent "in a non-unanimous decision in the December 2017 policy review, given the expectation of a further rise in the CPI inflation in the coming months".

On the other hand in October, the central bank lowered the country's growth projection for 2017-18, pegging the Gross Value Added (GVA) to 6.7 per cent, from earlier estimate of 7.3 per cent.

Declaring that inflation is expected to rise from the then-level of around 3.3 per cent "and range between 4.2-4.6 per cent in the second half of this year", Patel said the MPC remains committed to keeping headline inflation close to four per cent "on a durable basis".

Five members of the six-member MPC voted in favour of maintaining the key lending rate.

The MPC had expressed concern about the upside risks to inflation and that implementation of farm loan waivers by states may result in fiscal slippages re-

sulting in upward pressure on prices.

"Although the domestic food price outlook remains largely stable, generalised momentum is building in prices of items excluding food, especially emanating from crude oil. The possibility of fiscal slippages may add to this momentum in the future," it said.

Breaking a five-quarter slump, a rise in the manufacturing sector's output pushed India's growth rate higher to 6.3 per cent during the second quarter ending September, official data showed last week.

On a sequential basis, GDP growth for the second quarter went up to 6.3 per cent from 5.7 per cent reported during the first quarter of 2017-18.

On the oil price front, the Indian basket, comprising 73 per cent sour-grade Dubai and Oman crudes, and the balance in sweet-grade Brent, regained the \$60 a barrel level in November and closed trade on November 30 at \$61.60.—IANS

Godrej forays into attainable premium furniture segment with 'Script'

Mumbai, Godrej has announced the launch of a new home furniture brand, 'Script' — a attainable premium brand that is inspired by contemporary lifestyle and promises to offer 'freedom of living'. A pioneer and leader in the furniture segment, Godrej has once again disrupted the furniture segment by launching India's first attainable premium home furniture brand. With an investment of 50cr in the new venture, the plan is to launch 3 stores across 3 cities in the first year and focus on further expanding the brand in metros.

Script is pegged as a lifestyle extension from the house of Godrej. Backed by an extensive design thinking method, Script will be tapping into a market size that is estimated to be 10,000+ crores.

On the occasion, Mr. Jamsheed Godrej, MD & Chairman Godrej & Boyce said, "Godrej has always been celebrated for offering

innovations that use cutting edge technology and best in class manufacturing methods with a purpose of providing a great experience to our consumers. Script is a brand that strengthens our commitment to the latter.

Anil Mathur, COO Godrej & Boyce said, "We have always believed in going beyond the mundane and therefore consistently provided extraordinarily innovative products to our customers. Script is an earnest endeavour in the same direction. It doesn't merely attempt to satisfy customers but delight them through finest design and technological features.

Commenting on the launch, Mr. Rajat Mathur, Business Head Script said, "Script is a new perspective on furniture and accessory design that is inspired by contemporary living. Currently there is limited number of international and national branded furniture players in the market.

Want to upgrade Royal Enfield community with new 650 cc twins: Eicher CEO

By Anand Singh

Panaji, Royal Enfield, known for its iconic 350 cc Bullet, is now all set to upgrade to the next level of performance bikes — Interceptor and Continental GT — both powered by 650 cc twin engines. And the company wants country's market for high-power motor cycles to grow.

In a candid interview with IANS here, Siddhartha Lal, the CEO and Managing Director of Eicher Motors, the mother company of Royal Enfield, said the two new motorcycles will "upgrade" the Royal Enfield community with performance-oriented features.

"Our team here...most of them are riders and we try to talk to our customers, dealers most of the time, and what we understood was that a lot of our customers were delighted with

what they currently have and it's absolutely perfect for them," Lal said.

"But certainly there is a set of customers who now have been riding bikes for five-ten years and are now looking at the next level of performance... they like Royal Enfield, they like what we stand for, they like our style, but they want a bit more performance," he said.

The Interceptor and Continental GT 650 cc twins were unveiled in Goa last month during the Royal Enfield's ninth annual Ridermania.

Both motorcycles are powered by the all-new 650 cc, air-cooled parallel twin engines with oil cooler for enhanced performance. The fuel injected motor claims to deliver 47 PS of power at 7,100 rpm and a peak torque of 52 Nm at 4,000 rpm.

"It is really to start up with a motorcycle that, we

believe, our community is interested in. We have 2.5 million customers since we started this new generation of motorcycles in 2009-2010," he said.

He pointed out that "there is a good number here (in India), who are interested in getting to the next level of performance and that is what it is about."

Elaborating on the need to bring 650 cc motorcycles, Lal said: "That's obvious... company has to progress and for us the decision was (if you are making a new motorcycle) to go down or go up. Currently we have our products between 350 cc and 500 cc. We could have gone down to 250 cc or gone up above 500 cc. Or we could have gone parallel in the way we went with Himalayan (with 411 cc)."

"But we decided that we don't want to go down where there are a lot of other players," he said, add-

ing: "We want to grow the market in the same way we grew the market of 350 cc, which didn't exist before Royal Enfield."

Lal, optimistic of growing the market for 650 cc motorcycles in India, said that in the old days it was a very small market and in the last one decade "we have grown the market."

"We grew the market with 350 cc and 500 cc; we will do the same with the 650 cc. It doesn't exist in India; the 650 cc market is very tiny in India, as very few motorcycles sell here and we think with the 650 cc we can grow that market," he said.

Commenting on the export plans of the new offerings, Lal said: "Very importantly, we think that this

motor cycle will be absolutely spot on for markets outside of India, because the average speed, highway speed and riding speeds in markets outside of India are normally higher."

"So we are looking for slightly higher level of performance than today. And these motorcycles will certainly help us get into the mainstream in the export market," he said.

"In the international market we have an open field; we have people coming down from other emerging markets like Latin America and Southeast Asia," he said.

Both new motorcycles have been engineered and fine-tuned for enhanced agility that can handle different terrain

and speeds with ease while retaining the classic style. They are equipped with front and rear disc brakes with ABS, 18-inch front and rear Pirelli tyres and twin shock absorbers.

The gearbox is augmented by its "slip/assist" clutch that facilitates easy riding in traffic with a light feel and prevents wheel-hop when downshifting gears — also a first for Royal Enfield.

The chassis has been developed from the ground up by the team at Royal Enfield's UK Technology Centre and Harris Performance.

(Anand Singh was in Panaji at the invitation of Royal Enfield. He can be contacted at anand.s@ians.in)

Tata Projects bags order worth Rs 5,612 cr

New Delhi, Infrastructure firm Tata Projects on Monday said that it has secured a \$850 million contract (Rs 5,612 crore) to design and build a part of India's longest sea-bridge, the Mumbai Trans-Harbour Link.

According to the Hyderabad headquartered Tata Group company, it has bagged the contract in a joint venture with Daewoo E&C of South Korea.

"While the Tata JV emerged as the lowest bidder for both the sea packages 1 & 2, it was awarded only one of the packages (package 2) as provided in the tender conditions," the infrastructure firm said in a statement. "The package awarded to Daewoo-Tata Projects JV involves construction of a 7.8 km long bridge section across the Mumbai Bay including Shivaji Nagar Interchange at Navi Mumbai at contract value of Rs 5,612 crore (\$850 million), which is a complex stretch."

Kult launches 'Ambition' smartphone at Rs 5,999

New Delhi, Domestic telecom brand Kult from the Optiemus group on Monday launched a budget smartphone "Ambition" for Rs 5,999.

The device that comes with 5-inch, ON-CELL HD IPS display will be available on Amazon.in, starting December 11.

"Kult Ambition" is best suited to the needs of a youngster who is a 24X7 digital native, seeking to serve all his entertainment and information needs through his device," Nitesh Gupta, Director, New Product Development, Kult, said in a statement. The phone is powered by MediaTek MTK6737 chipset coupled with 3GB RAM and 32GB internal storage which can be expanded up to 32GB via microSD card slot. There is 13MP rear auto focus (AF) camera with flash and 5MP selfie camera with flash.

The device runs Android Nougat 7.0 operating system (OS) out of the box.

Micromax launches 'Canvas Infinity Pro' with dual-selfie cameras

New Delhi, Expanding its "Canvas Infinity" series, domestic smartphone maker Micromax on Monday launched "Canvas Infinity Pro" with edge-to-edge display and dual-selfie cameras for Rs 13,999.

The dual-selfie camera system has 20 MP + 8MP sensors and the phone sports a 16MP primary camera. The device will be available on Flipkart, starting December 6.

"We believe that 'Infinity Pro' is a complete package

and our consumers will be delighted with the pricing as well. We are known to bring products within the range of millions of Indians and this is another step in that direction," Shubhodhip Pal, Chief Operating Officer, Micromax Informatics said in a statement.

"Canvas Infinity Pro" features 5.7-inch "Full Vision" display with 18:9 aspect ratio.

Some key features of the cameras are Portrait Mode, Face Beauty, Auto Scene Detection and Face Gallery and

Tale Album.

The device is powered by octa-core Qualcomm Snapdragon 430 processor coupled with 4GB RAM and 64GB onboard storage and runs Android 7 Nougat operating system (OS).

A 3,000mAh battery powers the device that, the company claimed, will provide a stand-by time of 420 hours.

The smartphone is equipped with a fingerprint sensor with "0.2 sec unlock time and a 360 degree acceptance angle".

Hasina seeks Cambodia's help on Rohingya crisis

Phnom Penh, Bangladesh Prime Minister Sheikh Hasina on Monday called for Cambodia's support in developing a sustainable solution to the Rohingya crisis and the minorities persecution in Myanmar's Rakhine state.

Hasina made the remarks during a discussion with her Cambodian counterpart Hun Sen in Phnom Penh on Monday, bdnews24.com reported.

"We have discussed some of the emerging security challenges facing our region and expressed our common resolve to fight terrorism and extremism," Hasina said during a joint statement.

"We have also discussed the Rohingya crisis that threatens the peace and sta-

bility of our region. Bangladesh continues to shelter more than 1 million Rohingyas, among them around 630,000 who fled atrocities in Myanmar and took shelter in Bangladesh recently."

Hasina asked for Hun Sen's support for a durable solution as Bangladesh continued bilateral talks to return Rohingyas safely to their homeland.

"We highly appreciate Bangladesh (for giving shelter to the Rohingya refugees)... even though it has a population of over 160 million, it took the issues of refugees on its shoulder," said the Cambodian leader.

Bangladesh let in a wave of Rohingya refugees since late August, when the Myanmar military launched

a crackdown in Rakhine state over insurgent attacks.

The refugees in Cox's Bazar said the military and locals shot and killed people indiscriminately, raped women, looted and set fire to Rohingya homes.

Bangladesh and Myanmar signed an agreement on November 23 on the repatriation of recent refugees to their homeland. The agreement specified the formation of a joint working group to begin the repatriation process within two months.

The Bangladesh government also attempted to enlist international support for the Rohingya crisis. The UN, EU, US, UK and other parties expressed their appreciation for Bangladesh's efforts on the Rohingya crisis.

—IANS

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House", Opp D-Mart, I.D.C. Petrol Pump Lane, Shivajinagar, Shyamal 132 Pl
Pune Road, Satellite, Ahmedabad. Gujarat 380015 • Call: 079-110221000 • Fax: 079-71191300
E-Mail: cs@jindalworldwidelimited.com Website: www.jindalworldwidelimited.com

NOTICE
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI Listing Obligations and Disclosure Requirements Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on **Tuesday, 12th December, 2017 at 4.00 pm** at the Registered Office of the Company inter alia, (a) To consider and approve the Unaudited Standalone Financial Results along with the Limited Review Report by the Auditor's of the Company for the quarter ended on 30th September, 2017, (b) To approve the Record date for the purpose of dividend/dividend split off Face Value of Equity Shares of the Company and (c) To transact various other business items. The said information is available on the website of the Company (www.jindalworldwidelimited.com), SEBI Limited (www.sebiindia.com) and NSE Limited (www.nseindia.com).

By Order of the Board of Directors
Sd/- (Mr. Anil Agrawal)
Managing Director (DIN- 00189061)

Date: 04th December, 2017
Place: Ahmedabad

CHANGE OF NAME
I have changed my old name from **KHARAGIYA SURESHBHAI NAGJIBHAI** to New Name **BHARVAD SURESHBHAI NAGJIBHAI**
Add. : 98-85-1, Bhamariya Chapra, Ghatlodia, Ahmedabad 292

CHANGE OF NAME
I have changed my old name from **PAREKH NERISA RAHIMBHAI** to New Name **MEMON NERISABANU MOHAMMADUMAIR**
Add. : 151, Ravaiwas, Kalol, Gandhinagar 292A

CHANGE OF NAME
I have changed my old name from **MANSURI MOHAMMEDMATIN MOHAMMEDSHAFI** to New Name **MANSURI ABDULLMATIN MOHAMMEDSHAFI**
Add. : 1453, Saonini Ploce, Kalupur, Ahmedabad 292B

સ્પોર્ટ્સ અપડેટ

દિલ્હી ટેસ્ટ રોયલ્સ તબક્કામાં પ્રવેશી : ભારત વધુ મજબૂત

નવી દિલ્હી, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટ પછે ૨૫૬ રન દાવ રિકલેન્ડરના જવાબમાં પ્રવાસી શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં નવ વિકેટ ૩૫૬ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન ચાંદીમલ ૧૪૭ રન સાથે મેદાનમાં હતો. જ્યારે છેલ્લી વિકેટ તરીકે તેની સાથે સંદાકન શુચ્ચ ૨૫ રન સાથે રમતમાં છે. તે પહેલા ઓલરાઉન્ડ મેચ્ચેસ પૂર્ણ કરી હતી. તે ૧ ૧ ૧ રન કરી આઉટ થયો હતો. મેચ્ચુસ અને ચાંદીમલે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૮૧ રન કર્યા હતા. તેમની લાંબી ભાગીદારીના કારણે શ્રીલંકાને સસ્તામાં આઉટ કરવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું હતું. જો કે શ્રીલંકા હજુ પણ ૧૮૦ રન પાછળ છે અને તેની એક વિકેટ હાથમાં છે. આ ટેસ્ટ મેચમાં પરિણામની શક્યતા હજુ પણ રહેલી છે. ભારતે ગઈકાલે બીજા દિવસે સાત વિકેટ ૫૩૬ રન બનાવીને દાવ રિકલેન્ડર કર્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ ૨૪૩ રન કર્યા હતા. ૨૮૭ બોલમાં ૨૫ ચોગ્ગા સાથે કોહલીએ આ રન બનાવ્યા હતા. કોહલીએ સતત બીજા બેટ્સી સદી ફટકારી હતી. આ ઉપરાંત રોહિત શર્મા ૬૫ રન કરીને આઉટ થયો હતો. ભારતના જંગી જુમલા સામે શ્રીલંકાની ફરી એકવાર કંગાળ શરૂઆત થઈ હતી અને બે વિકેટ મારત ૧૪ રને ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ સ્થિતિ સુધરી હતી. રમત બંધ રહી ત્યારે મેચ્ચુસ ૫૭ અને કેપ્ટન ચાંદીમલ ૨૫ રન સાથે રમતમાં હતા. ગઈકાલેના સ્કોરથી આ બંને બેટ્સમેનોએ રમત આજે સોમવારે ત્રીજા દિવસે આગળ વધારી હતી. બંનેએ મક્કમ બેટિંગ કરીને સદી કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૮ ટેસ્ટ મેચો જીતી છે. ૮ ટેસ્ટ મેચો ડ્રો થઈ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પછા હાર થઈ છે. એકદરે ૨૬ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હંડ ટૂ હંડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઈતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજા બાજુ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આ ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતની ટીમ શ્રેણી ૨-૦ થી જીતવા માટે સજજ છે. અત્રે નોંધનીય છે કે નાગપુરમાં રમાયેલી બીજા ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઈન્ડિંગ અને ૨૩૮ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઈન્ડિંગ અને ૨૩૮ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી.

વેલિંગ્ટન ટેસ્ટ : ન્યુઝીલેન્ડનો ઈનિંગ્સ અને ૬૭ રને વિજય

વેલિંગ્ટન, વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે એક ઈન્ડિંગ અને ૬૭ રને વિન્ડિંગ ઉપર આજે જીત મેળવી હતી. વિન્ડિંગની ટીમ આજે તેના બીજા દાવમાં ૩૫૮ રન કરીને આઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બેટિંગ કરવાની પૂર્ણ ફરજ પડી ન હતી. ન્યુઝીલેન્ડ તરફથી તમામ બોલરોએ જીતમાં ભૂમિકા ભજવી હતી. બોલ્ટે બે, ગ્રાન્ડોએ બે, વાગનેરે બે વિકેટ ઝડપી હતી જ્યારે હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કરીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. વાગનેરની મન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હત. પ્રથમ ઈન્ડિંગમાં વાગનેરે સાત અને બીજા ઈન્ડિંગમાં બે વિકેટો ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચના ગઈકાલે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે વેસ્ટઈન્ડિઝે તેના બીજા દાવમાં લડાયક બેટિંગ કરીને બે વિકેટ ૨૧૪ રન કર્યા હતા. આજે સ્કોરને આગળ વધાર્યા બાદ વિન્ડિંગની ટીમના બેટ્સમેનો ફરી એકવાર સુઝેલીમાં મુકાઈ ગયા હતા અને એક પછી એક ઝડપથી વિકેટો ગુમાવી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય અસરકારક સાબિત થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી-મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બંને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે. બંને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજા વનડે મેચ કાર્થરસ્ટથ ખાતે રમાનાર છે. ત્રીજા મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝની ટીમનો દેખાવ કંગાળ રહેતા ટીમના સમર્થકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ઘરઆંગણે ન્યુઝીલેન્ડે શ્રેણીમાં ભવ્ય દેખાવ કર્યો હતો.

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટ માત્ર ૫૩ ૧/૨૦

એડિલેડ, એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં રમત બંધ રહી ત્યારે ચાર વિકેટ ૫૩ નર કર્યા હતા. ઓસ્ટ્રેલિયા હવે ઈંગ્લેન્ડ ઉપર ૨૬૮૨૫ની લીડ ધરાવે છે અને છ વિકેટ હાથમાં છે. આ ડેન્ટાઉટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ ૨૨૭ રન કરીને ઓલાઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં આઠ વિકેટ ૪૪૨ રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કોઈ બેટ્સમેન મેદાન પર ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ટ ત્રણ વિકેટ ઝડપી હતી. ગઈકાલે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં આઠ વિકેટ ૪૪૨ રન કરી દાવ રિકલેન્ડર કર્યો હતો. શોન માર્શે અપનામ ૧૨૨ રન કર્યા હતા જેમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. દિવસ દરમિયાન શોન માર્શે બેટિંગ કરી હતી. આ ઉપરાંત પેનીએ ૫૭ રન કર્યા હતા. ક્રમિસે ઝડપથી ૪૪ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓવરરને સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી. ગઈકાલે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના આઠ વિકેટ ૪૪૨ રન દાવ રિકલેન્ડરના જવાબમાં ઈંગ્લેન્ડે એક વિકેટ ગુમાવીને ૨૮૨ રન કર્યા હતા. કૂક ૧૧ રન સાથે રમતમાં હતો. આ બંને બેટ્સમેનોએ આજે પોતાની ઈન્ડિંગને આગળ વધારી હતી પરંતુ ઈંગ્લેન્ડના કોઈપણ બેટ્સમેન મેદાન પર ટકી શક્યા ન હતા.

રાહુલની તાજપોશીનો તપ્તો તૈયાર થયો : ઉમેદવારીપત્ર દાખલ કર્યું

નવી દિલ્હી, રાહુલ ગાંધીની કોંગ્રેસના પ્રમુખ તરીકે તાજપોશીનો તપ્તો તૈયાર થઈ ગયો છે. કોંગ્રેસ પ્રમુખ પદના ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ તેના પહેલા જાહેર કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સામે મોટા પડકાર ઉભા થઈ ગયા છે. કોંગ્રેસના પ્રમુખ પદ માટે આજે રાહુલ ગાંધીએ સવારે ઉમેદવારી દાખલ કરી હતી. આની સાથે જ તેમના પાર્ટી પ્રમુખ બનવા માટેનું કોંગ્રેસ ડાઉન શરૂ થઈ ગયું હતું. ઉમેદવારી નોંધાવતી વેળા પ્રસ્તાવક તરીકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ રહ્યા હતા. ઉમેદવારીપત્ર દાખલ કરતી વેળા રાહુલ ગાંધીની સાથે મનમોહનસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અહેમદગ પટેલ, સુશીલ કુમાર શિંદે સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરના પહેલા રાહુલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિશીતને મળ્યા હતા. શિલા દિશીતનું ગળે લગાવી

સ્વાગત કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાહુલના પ્રસ્તાવક તરીકે સોનિયા ગાંધી રહેશે. ઉમેદવારીપત્ર વેળા ઉપસ્થિત રહેશે પરંતુ ઉમેદવારી નોંધાવી ત્યારે કમલનાથ, મોહસીના કિડવાઈ, નારાયણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી દાખલ કરવા માટે રાહુલ ગાંધી સવારે ૧૦.૩૦ વાગે દિલ્હીમાં પાર્ટી ઓફિસ ઉપર પહોંચ્યા હતા. પાર્ટી સમર્થકો પહેલાથી જ પહોંચવા લાગ્યા હતા. તેમની પાર્ટી પ્રમુખ તરીકે તાજપોશી હવે માત્ર ઔપચારિકતા રહી છે.

રાહુલ ગાંધી ઉમેદવારી પત્ર ભરવા માટે જતા પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પ્રણવ મુખર્જીને મળવા માટે પહોંચ્યા હતા. સોનિયા ગાંધી છેલ્લા ૧૮ વર્ષથી કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા છે. બીજા બાજુ પ્રમુખની ચૂંટણીને લઈને તમામ તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથ, શીલા દિશિત, તરૂણ ગોગોઈએ

રાહુલ માટે ઉમેદવારી પેપરના સેટ દાખલ કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ માટે આશરે ૮૦ સેટ દાખલ કરવામાં આવનાર છે. ઉમેદવારી પત્ર દાખલ કરવા બદલ ગુલામ નબી આઝાદ સહિત પાર્ટીના તમામ નેતાઓએ રાહુલને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધી હવે પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી શકશે કે કેમ તે બાબત પર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી કરે તેવી શક્યતા નહીત છે. તેમની વરણી સર્વસંમતિથી કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટી મુખ આશાવાદી દેખાઈ રહી છે.

કોંગ્રેસના પ્રમુખ બનવાની દિશામાં રાહુલ ગાંધી આગળ વધી ગયા છે. આજે ઉમેદવારીપત્રના સેટ દાખલ કર્યા બાદ કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાહુલ ગાંધીના પ્રસ્તાવક બંનેલા મનમોહનસિંહે કહ્યું હતું કે, રાહુલ પાર્ટીના ડાર્લિંગ નેતા છે. રાહુલ

ગાંધી મુખ જ લોકપ્રિય અને કુશળ નેતા તરીકે ઉભરી આવશે. મનમોહનસિંહે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાર્ટીની પરંપરાને આગળ વધારશે. બીજા બાજુ કોંગ્રેસ માટે આજના દિવસને ઐતિહાસિક ગણાવીને રણદીપ સૂરજેવાલાએ રાહુલને ચોથા ઉમેદવાર ગુલામના હું, રાહુલ ગાંધી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે,

વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા શશી કપૂરનું નિધન : શોકનું મોજુ



મુંબઈ, વિતેલા વર્ષોના સુપર સ્ટાર અભિનેતા અને પદ્મભૂષણથી સન્માનિત શશી કપૂરનું લાંબી માઈગ્રી બાદ આજે અવસાન થતાં બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી શશી કપૂરની તબિયત સારી ન હતી. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કે ઓવર પજા સન્માનિત કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ સાથે સંબંધિત તકલીફ તેમને સતત તીવ્ર રહી હતી. સતત તબીબી દેખરેખ હેઠળ શશી કપૂર ૧૮મી માર્ચ ૧૯૩૮ના દિવસે જન્મેલા શશી કપૂરે અભિનેતા તરીકે ૧૭૫મી વધુ ફિલ્મોમાં ભૂમિકા કરી હતી. કલયુગ, વિજૈતા, ઉત્સવ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. આ ઉપરાંત ૧૯૮૧માં રજૂ થયેલી અમિતાભ બચ્ચન અભિનિત અજૂબા ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. શશી કપૂરે રશિયન ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. શશી કપૂરે બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. રાજકપૂરની આગ ફિલ્મ જે વર્ષ ૧૯૪૮માં રજૂ કરવામાં આવી હતી અને ૧૯૫૧માં રજૂ કરાયેલી આવારા ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે હતા. શશી કપૂરે ૧૯૬૧માં રજૂ થયેલી ધરમપુત્ર નામની ફિલ્મમાં અભિનેતા તરીકે એન્ટ્રી કરી હતી. ૧૯૮૦ સુધી બોલીવુડમાં શશી કપૂરનું પ્રભુત્વ રહ્યું હતું. શશી કપૂરે અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં જોડી ફિલ્મી હતી જેમાં તમામ સુપરહિટ ફિલ્મો દિવાર,

સમર્થન આપ્યું હતું. જ્યારે તે નોકરીની તલાશમાં હતા ત્યારે તેઓ શશી કપૂરને મળવા માટે જતાં હતા. તે વખતે સુધી શશી કપૂરની સ્થિતિ ખુબ મજબૂત હતી. શશી કપૂરે તમામ નિર્દેશકોને તેને મળાવ્યા હતા. શશી કપૂરની લોકપ્રિયતાને લઈને તમામ અભિનેત્રીઓની તેમની સાથે કામ પણ માટે તૈયાર રહ્યાં. ૨૦૧૧માં પદ્મભૂષણથી ભારત સરકારે તેમને સન્માનિત કર્યા હતા. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કેથી સન્માનિત કરવા હતા. પુદ્ધી રાજ કપૂર અને રાજ કપૂરને પણ આ સન્માન મળ્યું હતું. આજે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.

ઓખી વાવાઝોડા સાથે-સાથે..

- ★ નવસારીના દરિયાકાંઠાના સાતથી વધુ ગામનો એલર્ટ કરી દેવામાં આવ્યા
- ★ ગિર સોમનાથ, અમરેલી, દિવ, સહીતના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી કરાઈ
- ★ ૫૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- ★ ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વાવાઝોડું નબળુ પડશે
- ★ ડીપ ડ્રેશનની પરિસ્થિતિ સર્જાશે
- ★ દરિયામા એકથી લઈને ત્રણ ફૂટ સુધી મોજા ઉછળશે
- ★ માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સુચના
- ★ વિવિધ બંદરો ઉપર ૨ નંબરનુ સિગ્નલ લગાવ્યું
- ★ દરિયામા માછીભરી કરવા ગયેલી અંદાજિત ૬૦૦ જેટલી બોટોને પરત લાવવાની કામગીરી પૂરજોશમાં આરંભાઈ
- ★ તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી
- ★ તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી માટે તમામ સાધનો સાથે સુસજ્જ રહેવા તાકીદ કરવામાં આવી
- ★ રાજ્યના મોટાભાગના વિસ્તારોમા વરસાદી વાતાવરણ છવાયું
- ★ વરસાદ અને ડીપ ડ્રેશનની પરિસ્થિતિ ડિસેમ્બર સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી
- ★ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ ૬ ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી
- ★ લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુમા વેરેલા વિનાશની અસર ગુજરાતમાં જેમ બને અને આઈ થાય એ માટે તમામ પગલા લેવા તંત્રની કવાયત યુધ્ધના ધોરણે શરૂ

હવે ભારતીય ખેલાડીઓના વેતનમાં છ ગણી વૃદ્ધિ કરાશે

મુંબઈ, છેલ્લા ઘણા વર્ષથી બીસીસીઆઈ દુનિયાના સૌથી અમીર ક્રિકેટ ખેલાડી તરીકે છે. પરંતુ હજુ સુધી તેના ખેલાડીઓને સૌથી વધારે પગારની ચુકવણી કરવામાં આવતી નથી. સુત્રોની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો હવે ટૂંક સમયમાં જ ક્રિકેટરો પણ દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ થઈ જશે. વિરાટ કોહલી અને તેની ટીમના સાથીઓના પગાર હવે દુનિયાના બીજા ક્રિકેટરો કરતા વધારે થઈ જશે. એમ માનવામાં આવે છે કે, ભારતના ટોપ પ્લેયર્સ હવે ઓછામાં ઓછા ઓસ્ટ્રેલિયા અથવા બ્રિટિશ ખેલાડીઓ જેટલા પગાર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને પગાર તરીકે ભારતીય ખેલાડીઓ કરતા વધારે નાણા મળે છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ બીસીસીઆઈમાં એપોઈન્ટમેન્ટ વહીવટી સમિતિએ કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટન એમએસ દિવસે અને મુખ્ય કોચ રવિ

કેપ્ટન સ્ટિવ સ્મિથને વર્તમાનમાં બે મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર અથવા તો આશરે ૧૨ કરોડ રૂપિયા મળે છે જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન રુટને પણ આટલી જ રકમ મળે છે. સીઓએ સાથે જોડાયેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, આ બેંકક આશરે ચાર કલાક સુધી ચાલી હતી જેમાં ભારતીય ખેલાડીઓના પગાર અને તેમને મળનાર ભથ્થાઓના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. ઓસ્ટ્રેલિયા અને બ્રિટિશ ખેલાડીઓના મુદ્દે વાતચીત થઈ હતી. બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના પગાર ભારતીય ખેલાડીઓની સરખામણીમાં ખુબ વધારે છે તે બાબતને લઈને શંકા નથી પરંતુ આગામી દિવસોમાં ભારતીય ખેલાડીઓના પગાર પણ ખુબ વધે તેવા સંકેત સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

રસોઈના મુદ્દે પત્નીને પતિએ સળિયાથી ફટકારી

સુરત, ડીડોલી સાઈ શક્તિનગર સોસાયટીમાં રહેતી એક પત્ની પર લોખંડના સળિયા વડે હુમલો કરી પતિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ ડીડોલી પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પત્નીને જમવાને કેમ બનાવ્યું નહીં? તેમ જણાવી પતિએ હુમલો કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર રાજ્યના નાલંદા ગામના વતની સાથે હાલ ડીડોલી સાઈ શક્તિ નગર શુભવાટિકા પાસે રહેતા પંકજ રાજકુમાર પટેલના લગ્ન આ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે



દમણમાં કેલન એનજીઓ અને ડો. રમણીકલાલ મેડીકલ સિલ્વિફોર્સ ટ્રસ્ટના મહિલા સેન્ટરના મેડીકલ ડોક્ટરો આટા ચક્કી પ્રદાન કરેલ છે. દમણના આરોગ્યવિભાગના આલ્લા ફળિયામાં રહેતી એક મહિલાએ કેલન એનજીઓ પાસેથી ઈલેક્ટ્રીક આટા ચક્કી માગી હતી કેલન એનજીઓના ઉપાધ્યક્ષ અમી પટેલે આ મહિલાની આપણી કરવા માટે ઈલેક્ટ્રીક આટા ચક્કી આપી હતી. (તસ્વીર:- અશોક જોષી, વલસાડ)

સારોલી ગામે આદેડ વ્યક્તિના માથામાં વજનદાર પથ્થર ઝીંકી આદેડની હત્યા

સુરત, સુરત-કોટદરા રોડ પર સારોલી ગામે ખુલ્લી જગ્યામાં આવેલ જાડીમાંથી રવિવારે સાંજે અંદાજે ૫૦થી ૫૫ વર્ષના અજાણ્યા આદેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોજના સાડાચાર વાગ્યા દરમિયાન સારોલી ગામના બ્લોક નં. ૨૦ નાવા હળપતિ વાસની સામે આવેલ ખુલ્લી જગ્યાની જાડીમાં મરણ

રીંગરોડ પર રાહદારીના મોબાઈલની ચીલઝડપ

સુરત, રિંગરોડ પર આવેલી મહાવીર માર્કેટ પાસેથી પસાર થતા એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટર સાર્કલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં રહેત પાટિયા શ્રીનાથધામ ખાતે વસતા સરોતે રાજકુમાર ગુપ્તા ગતરોજ રિંગરોડ મહાવીર માર્કેટ પાસેથી પસાર થતા હતા ત્યારે કાળા કલરની મોટર સાર્કલ પર આવેલા બે અજાણ્યા

કોટક મહાનંદા બેન્ક લીમીટેડ

૧૫૯-૦૬, વિભવ ભવ્યા કોમ્પ્લેક્સ, પાંચમો માળ, સીએસસી રોડ, કાલીના સાંતાક્રુઝ(ઈ) મુંબઈ-૪૦૦૦૬૮

કલ્પા નોટીસ (સ્થાવર મિલકત માટે)
(પરિશિષ્ટ IV મુજબ નિયમ ૮ (૧) ની સાથે સુરક્ષિત વ્યાજ (એન્ફીસેમ્પ્ટર) નિયમો, ૨૦૦૨)


કોટક મહાનંદા બેન્ક લિમિટેડ અધિકૃત અધિકારી, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૮૪ ના સંદર્ભ, ૨૦(બી) સી, સી ૩, જી.બી.કે. બાંદ્રાકુર્લા સેક્ટર-૧, બાંદ્રા (ઈ), મુંબઈ ૪૦૦૦૧૫ ૧ ખાતે રજિસ્ટર્ડ ઓફિસ આવેલ છે અને તેની શાખા (ભવ્ય વિનયભવ કોમ્પ્લેક્સ, પાંચમો માળ, સી.એસ.સી. રોડ, સાંતાક્રુઝ પૂર્વ, મુંબઈ-૪૦૦૦૬૮ સિક્યુરિટી ડેપોઝિટ અને રિસ્ક સ્ટ્રક્ચર અને ફાઇનાન્સિયલ એસેસમેન્ટ એન્ફીસેમ્પ્ટર ઓફ સિક્યુરિટી વ્યાજ એક્ટ, ૨૦૦૨ ("સરકેસિસ એક્ટ") હેઠળ અને હેઠળ આપવામાં આવેલી સત્તાઓ ઉપયોગ કરીને સિક્યુરિટી વ્યાજ (એન્ફીસેમ્પ્ટર) નિયમો, ૨૦૦૨ની કલમ ૧૩(૨) અને ૧૩(૧) સાથે ફીજીલાઈટ ૨૦૧૭ના રોજ કરાયેલી ડિમાન્ડ નોટિસ પાટીને જે (૧) શ્રી મહેન્દ્રકુમાર સંભાલાલ રાણા લોટ નંબર ૩૦૩૫, માધવ બાગ - ૧, વાઘવાડી રોડ, ભાવનગર, ગુજરાત ૩૬૪૦૦૧ ("દેવાદાર"). (૨) શ્રી ઈમિલિયાને એમ રાણા અને માર્ગેટી મેલક ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ૩૦૩૫, માધવ બાગ - ૧, વાઘવાડી રોડ, ભાવનગર, ગુજરાત ૩૬૪૦૦૧ ("સહ-દેવાદાર") ને હિસાબ આપવા માટે ખાતે ખાતે અચેક ડેપોઝિટ ઓફ આપ્યા હતા. નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. ૦૬ જુલાઈ ૨૦૧૭ના રોજ. ૧, ૫૫, ૨૫, ૫૫૪. ૪૬ / - (૩. એક કરોડ પંચોતે વાળ પચસીસ હજાર, સાતસો ચોપન અને છતાલીસપાસો) વધુ વ્યાજ અને અન્ય ચાર્જીસ સાથે સંકળિત વ્યાજના પગલે કરારના હેઠળ ૦૫ જુલાઈ ૨૦૧૭ સુધી તે ડિમાન્ડ નોટિસ પ્રાપ્ત થયાના ૬૦ દિવસની અંદર ("બાકી રકમ") ચુકવવાની.

ઉપરોક્ત દેવાદાર/સહદેવાદાર લેનારાઓ રકમ ચુકવવા માટે નિષ્ફળ ગયા છે, દેવાદાર/સહ દેવાદાર લેનારાઓ અને સામાન્ય રીતે જરૂર જ નતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે જણાવેલી મિલકતની સાંકેતીક કબજામાં નીચે આપેલા સત્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૮-૧૧-૨૦૦૭ના ઉપર જણાવેલા નિયમોના નિયમ ૮ સાથે સરકેશી એક્ટની કલમ ૧૩(૪) હેઠળ વાંચો. અહીં દેવાદાર/સહદેવાદારને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સામાન્ય રીતે જરૂર જ નતાને અમલક સાથે વ્યવહાર ન કરવાની વેતણણી આપી છે અને અમલક સાથેના કોઈ પણ વ્યવહાર ક્રોડ નહ-ના બેંક મિલિટેડના ચાર્જ હેઠળ રહેશે, જેની શાખાનું સરનામું વિનયભવ કોમ્પ્લેક્સ પાંચમો માળ, પાંચમો માળ, સીએસસી રોડ, સાંતાક્રુઝ પૂર્વ, મુંબઈ-૪૦૦૦૬૮, તારીખ ૦૬ જુલાઈ ૨૦૧૭ના રોજ કરારના હેઠળ વ્યાજ અને અવેજી વ્યાજ, આક્રમિક મૂલ્ય, ખર્ચ અને ખર્ચ વગેરે સાથે.

CHANGE OF NAME
I have changed my name from **JEEGARKUMAR BAKULBHAI SOLANKI** to **JIGARKUMAR BAKULBHAI SOLANKI**. Add.: C/112, Sanmukh Apartment, B/h. Krushnanagar, Makarba Road, Vejalpur, Ahmedabad-380051. C073

CHANGE OF NAME
I have changed my name from **ANSARI MOHAMMED IBRAHIM MOHAMMED ILYAS** toname name **ANSARI JULAYA MOHAMMED IBRAHIM MOHAMMED ILYAS**. Add.: 118/629, (G.H.B.) B/h Nutan Bharti Vidhyalay Bapunagar, Ahmedabad. 305

Dec 31 deadline to link Aadhaar with banks, PAN goes
New Delhi, The December 31 deadline to link the 12-digit Aadhaar number with bank accounts and Permanent Account Number (PAN) has been lifted, the government announced on Wednesday.



Union Minister for Finance and Corporate Affairs Arun Jaitley making a statement about the provision of financial resolution and deposit insurance bill 2017, regarding protecting the interest of depositors and removing any misgivings in this regards, in New Delhi.

A notification to this effect was issued on Tuesday by the Department of Revenue under the Finance Ministry. According to the notification, the words "submit the Aadhaar number and PAN by December 31, 2017" were now substituted by "submit the Aadhaar number, PAN or Form No 60 by such date as may be notified by the Central government."

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015
E-Mail: csjindal@jindaltextiles.com; Website: www.jindaltextiles.com
Phone: 079-71001500-557(Ext.) CIN: L17110GJ1986PLC008942

NOTICE OF 'RECORD DATE' FOR THE PURPOSE OF SUB-DIVISION/STOCK SPLIT OF FACE VALUE OF EQUITY SHARES FROM RS. 10/- EACH TO RS. 5/- EACH
NOTICE is hereby given to the members of the Company that pursuant to the Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and other applicable provisions of the Companies Act, 2013, the Company has fixed "Wednesday, 27th December, 2017" as the RECORD DATE for the purpose of Sub-Division of Face Value of Equity Shares of the Company from Rs. 10/- each to Rs. 5/- each as per Section 61(1)(d) of the Companies Act, 2013 & for ascertaining the eligibility of the Shareholders/Members entitled to receive the Sub-divided Equity Shares of Rs. 5/- each in lieu of the Existing Equity Shares of Rs. 10/- each. Consequently, the shares having Face Value of Rs. 10/- each shall automatically stand cancelled & be of no effect on and from the said Record Date (viz. 27th December, 2017).
The Company hereby undertakes that it will set-up Auto Corporate Action with both the Depositories CDSC & NSDL for execution before beginning of the day (BOC) on the trading day succeeding the Record Date.
On Behalf of the Board of Directors
Date: 13th December, 2017 Jindal Worldwide Limited
Place: Ahmedabad Sd/- (Amit Agrawal)
Managing Director DIN:50169061

Public Notice
This is to inform that to the General Public at large that My Client Mr. Kanjibhai Vashrambhai Desai, Rio At & Post-Deesa, Tal:- Deesa, Dist:- B.K, Gujarat is Owner and Occupant of "The Residential House Out of Revenue Survey No.185, Part-C, Plot No.32, total measuring 138-00 Sq. Meter situated at "Sarthak Bungalows" in the sim of Rajpur, Tal:-Deesa, Dist. Banaskantha, State:-Gujarat. The "Said Property" sold by Mrs. Mithiben Naranbhai Prapajai to Mr. Tulsiibhai Pittambarbhai Thakkar by registered sale deed serial No.885 dated 08/02/2011. There after said property sold by Mr. Tulsiibhai Pittambarbhai Thakkar to My Client Mr. Kanjibhai Vashrambhai Desai by registered sale deed serial No.1300 dated 05/03/2014. That Original Registered Sale Deed No.885 dated 08/02/2011 with Registration Receipt has been lost/misplaced and my client has made the best efforts to find out the same.
Further you inform that My Client is mortgaging the said property to Deewan Housing Finance Corporation Ltd (DHFL) as a security against the financial facilities available to be availed by him.
Any person whoever has found the said Original Sale Deed and for any person having any right, title, claim, share of intolup to the said property by way sale, exchange, mortgage, let, maintain, assessment, trust, possession or otherwise of what so ever nature hereby required to make the same in writing along with the documentary evidence to the undersigned at the address mentioned below within 14 days from the date of publication failing. Which it shall be deemed to have been waived and given up and our client shall proceed further without reference to such claims, if any received afterwards.
This notice issued by me and herewith mention Address for invite objections.
(Ramesh K.Tharwani) Ramesh K.Tharwani (Advocate & Notary Palanpur)
Advocate, Palanpur. 34, Aroma Arcade, 3rd Floor, Nr.Cozy, Palanpur, Pin- 385001, Tal-Palanpur, Dist-B.K. Place : Palanpur, Date : 13/12/2017 Mobile No. 99250 99400

Public Notice
This is to inform that to the General Public at large that My Client Mrs. Kamala Bhavard Chaudhary, Rio At & Post-Deesa, Tal:- Deesa, Dist:- B.K, Gujarat is Owner and Occupant of "The Residential House Out of Revenue Survey No.117, Sheet No.44, City Survey No.4663 Paiki, Plot No.3/B Paiki, Municipal Area No.8/1836, total measuring 54-00 Sq. Meter, 581-00 Sq. Ft. and Built Up Area 27-88 Sq.Meter, 300-00 Sq.Ft. situated at "Suryanagar" in the sim of Navsari, Dist. Banaskantha, State:-Gujarat. The "Said Property" sold by Mrs. Sumatiben Somabhai Prapajai to Mr. Hareshkumar Ambalal Padihyar by registered sale deed serial No.2382 dated 27/10/1989. There after said property sold by Mr. Hareshkumar Ambalal Padihyar to Mrs. Bhikhiben Ambalal Padihyar by registered sale deed serial No.1906 dated 22/08/1994. There after said property sold by Mrs. Bhikhiben Ambalal Padihyar to Mr. Umeshbhai Khushalbhai Parmar by registered sale deed serial No.4442 dated 29/12/2005. There after said property sold by Mr. Umeshbhai Khushalbhai Parmar to Mrs. Jadhiben Tribhovnbhai Darji by registered sale deed serial No.271 dated 18/01/2006. There after said property sold by Mrs. Jadhiben Tribhovnbhai Darji to Mr. Parshotambhai Savabhai Geloj by registered sale deed serial No.5603 dated 30/08/2008. There after said property sold by Mrs. Parshotambhai Savabhai Geloj to Mrs. Kamala Bhavard Chaudhary by registered sale deed serial No.5006 dated 24/11/2017. That Original Registered Sale Deed No.(1) 2382 dated 27/10/1989 (3) 1906 dated 22/08/1994 and (3) 4442 dated 29/12/2005 with Registration Receipt has been lost/misplaced and my client has made the best efforts to find out the same.
Further you inform that My Client is mortgaging the said property to Deewan Housing Finance Corporation Ltd (DHFL) as a security against the financial facilities available to be availed by him.
Any person whoever has found the said Original Sale Deed and for any person having any right, title, claim, share of intolup to the said property by way sale, exchange, mortgage, let, maintain, assessment, trust, possession or otherwise of what so ever nature hereby required to make the same in writing along with the documentary evidence to the undersigned at the address mentioned below within 14 days from the date of publication failing. Which it shall be deemed to have been waived and given up and our client shall proceed further without reference to such claims, if any received afterwards.
This notice issued by me and herewith mention Address for invite objections.
(Ramesh K.Tharwani) Ramesh K.Tharwani (Advocate & Notary Palanpur)
Advocate, Palanpur. 34, Aroma Arcade, 3rd Floor, Nr.Cozy, Palanpur, Pin- 385001, Tal-Palanpur, Dist-B.K. Place : Palanpur, Date : 08/12/2017 Mobile No. 99250 99400

Public Notice
This is to inform that to the General Public at large that My Client Mrs. Kamala Bhavard Chaudhary, Rio At & Post-Deesa, Tal:- Deesa, Dist:- B.K, Gujarat is Owner and Occupant of "The Residential House Out of Revenue Survey No.117, Sheet No.44, City Survey No.4663 Paiki, Plot No.3/B Paiki, Municipal Area No.8/1836, total measuring 54-00 Sq. Meter, 581-00 Sq. Ft. and Built Up Area 27-88 Sq.Meter, 300-00 Sq.Ft. situated at "Suryanagar" in the sim of Navsari, Dist. Banaskantha, State:-Gujarat. The "Said Property" sold by Mrs. Sumatiben Somabhai Prapajai to Mr. Hareshkumar Ambalal Padihyar by registered sale deed serial No.2382 dated 27/10/1989. There after said property sold by Mr. Hareshkumar Ambalal Padihyar to Mrs. Bhikhiben Ambalal Padihyar by registered sale deed serial No.1906 dated 22/08/1994. There after said property sold by Mrs. Bhikhiben Ambalal Padihyar to Mr. Umeshbhai Khushalbhai Parmar by registered sale deed serial No.4442 dated 29/12/2005. There after said property sold by Mr. Umeshbhai Khushalbhai Parmar to Mrs. Jadhiben Tribhovnbhai Darji by registered sale deed serial No.271 dated 18/01/2006. There after said property sold by Mrs. Jadhiben Tribhovnbhai Darji to Mr. Parshotambhai Savabhai Geloj by registered sale deed serial No.5603 dated 30/08/2008. There after said property sold by Mrs. Parshotambhai Savabhai Geloj to Mrs. Kamala Bhavard Chaudhary by registered sale deed serial No.5006 dated 24/11/2017. That Original Registered Sale Deed No.(1) 2382 dated 27/10/1989 (3) 1906 dated 22/08/1994 and (3) 4442 dated 29/12/2005 with Registration Receipt has been lost/misplaced and my client has made the best efforts to find out the same.
Further you inform that My Client is mortgaging the said property to Deewan Housing Finance Corporation Ltd (DHFL) as a security against the financial facilities available to be availed by him.
Any person whoever has found the said Original Sale Deed and for any person having any right, title, claim, share of intolup to the said property by way sale, exchange, mortgage, let, maintain, assessment, trust, possession or otherwise of what so ever nature hereby required to make the same in writing along with the documentary evidence to the undersigned at the address mentioned below within 14 days from the date of publication failing. Which it shall be deemed to have been waived and given up and our client shall proceed further without reference to such claims, if any received afterwards.
This notice issued by me and herewith mention Address for invite objections.
(Ramesh K.Tharwani) Ramesh K.Tharwani (Advocate & Notary Palanpur)
Advocate, Palanpur. 34, Aroma Arcade, 3rd Floor, Nr.Cozy, Palanpur, Pin- 385001, Tal-Palanpur, Dist-B.K. Place : Palanpur, Date : 08/12/2017 Mobile No. 99250 99400

GUJARAT THEMIS BIOSYN LIMITED
CIN: L24230GJ1981PLC004878
69/C, GIDC Industrial Estate, Vapi - 396 195, Dist. Valsad, Gujarat
Tel: +91 260 2430027 Fax: +91 260 2400639
E-mail: admin@gtbl.co.in / gtblmumbai@gtbl.in Website: www.gtbl.in

Extract of Unaudited Financial Results for the Quarter and Half year ended September 30, 2017
(Rs in Lakhs)

Particulars	Quarter Ended 30-Sep-17 (Unaudited)	Quarter Ended 30-Sep-16 (Unaudited)	Half Year Ended 30-Sep-17 (Unaudited)
Total Income from Operations	953.31	839.56	1,901.35
Net Profit / (Loss) for the period (before tax and Exceptional items)	112.85	88.29	234.01
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	112.85	88.29	234.01
Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	90.24	78.90	187.99
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	93.02	80.46	190.77
Paid-up equity share capital (Face Value Rs.5/- per share each)	726.40	726.40	726.40
Earnings Per Share (of Rs.5/- each) (Not Annualised)			
(a) Basic	0.62	0.54	1.29
(b) Diluted	0.62	0.54	1.29

NOTICE
The Sandesh Limited (CIN: L22121GJ1943PLC000183) Registered Office: "SANDESH BHAVAN", Last Section Road, B/h. Vasturpur Gann, P.O. Bodakdev, Ahmedabad-380054 (Guj.) Ph: 079-40004000, Fax: 079-40004242, Email: investors@sandesh.com Website: www.sandesh.com

Notice for Loss of Equity Share Certificate(s)
NOTICE is hereby given that the Share Certificate(s) in respect of below mentioned Equity Shares of the company has / have applied to the company for issue of Duplicate Share Certificate(s) in lieu of the original Share Certificate(s).
Name of the Share Holders : Nandkishor P. Mahjan, Mukund R. Gandhi, Folio No.: 24106 No. of Shares : 100, Certificate No.: 013599 Distinctive No.: 0566201 to 0566300
The Company has notified the Stock Exchanges where these shares are listed about the loss of these share certificates. Public is cautioned against purchasing or otherwise dealing with the above mentioned share certificates. Any person having claims / objections in the said shares, should communicate to the Company at the Registered office of the company at the address given above within 15 days from the date of publication of this Notice. After issuance of duplicate share certificates, the original share certificates shall stand cancelled & any person dealing with the original share certificates shall be doing so at his / her own risk as to costs & consequences & the company will not be responsible for it in any way.
Place : Ahmedabad For: The Sandesh Ltd., Date: 12-12-2017 Dhaval Pandya, Company Secretary

NOTICE
1. The above is an extract of the detailed format of Quarterly unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly unaudited Financial Results are available on the Stock Exchange website viz. www.bseindia.com and on the Company's website www.gtbl.in.
2. This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and other recognized accounting practices and policies, to the extent applicable. Beginning April 1, 2017, the Company has, for the first time, adopted Ind AS with a transition date of April 1, 2016.
3. Reconciliation of Net Profit as previously reported under Indian GAAP to Ind AS for the quarter and half year ended September 30, 2016 is as under:

S.No.	Particulars	For the Qtr ended Sept 30, 2016	For the half year ended Sept 30, 2016
	Net Profit after Tax for the Period (as per Indian GAAP)	83.13	195.88
	Benefit/(Charge):		
i	Fair Valuation of Financial Liabilities	(0.20)	19.41
ii	Actuarial (gain)/ Loss on employee defined benefit obligations recognised in Other Comprehensive Income	1.75	1.75
iii	Prior period item	-	(0.10)
iv	Other adjustments	(5.98)	(5.98)
v	Deferred Tax impact of above adjustments	0.20	(1.84)
	Net profit for the Quarter (as per Ind-AS)	78.90	209.11
	Other comprehensive Income (net of tax)	1.57	1.57
	Total Comprehensive Income	80.46	210.67

For GUJARAT THEMIS BIOSYN LTD.
SD/- Dr.DINESH S. PATEL
Chairman
Place : Mumbai
Date : December 12, 2017
DIN:00033273

Twitter introduces new 'thread' feature to link tweets together

San Francisco, After increasing the character count in a tweet, Twitter has found a new way to let people express themselves more by making it simple for them to string several tweets together.

"We've made it easy to create a thread by adding a plus button in the composer, so you can connect your thoughts and publish your threaded tweets all at the same time," Sasank Reddy, Product Manager at Twitter, wrote in a blog late on Tuesday.

"You can continue adding more tweets to your published thread at any time with the new 'Add another Tweet' button. Additionally, it's now simpler to spot a thread - we've added an obvious 'Show this thread' label," he said.

People creatively stitch tweets together to share more information or tell a longer story. Since hundreds of thousands of threads are tweeted every day, this traditional method of tweeting, while effective and popular, can be tricky for some to create and it's often tough to read or discover all

the tweets in a thread. "But we know people also may want to serialise a longer story or thought, or provide ongoing commentary on an event or topic. That's where this update to threads comes in," Reddy explained.

With the new feature, it will be easy for users to thread tweets and find other threads -- to express themselves on Twitter and stay informed. Few weeks ago, Twitter expanded character count to make it easier for people to fit what they are thinking into a tweet.

Now you can follow hashtags on Instagram

San Francisco, Following Twitter's footsteps of searching hashtags and staying connected with hobbies, passions and communities, Instagram on Wednesday launched a similar feature for users to make their interests more discoverable.

"Everyday, millions of people share photos and videos and tag them with relevant hashtags. Hashtags represent the many interests and passions of our community. To make these posts even more discoverable, we're introducing hashtags you can follow," the company said in a blog.

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION
Hiring of one Non-Ac Vehicle
Notice for Invitation of E-Tender. 1. Tender No.: M-DL-VTA-17-18-VHiring. 2. Name of Work: Hiring of one Non-Ac vehicle Tavera / Tata Sumo or similar for the official use of Sr. DME/DL/VTA for the period of Twenty four months. 3. Estimated Cost of Work: ₹ 8,75,851/- 4. EMD: ₹ 17,520/- 5. Engagement Period: 02 Years. 6. Last Date of Submission of Tender: 17/01/2018 at 15:00 Hrs. 7. Date & Time of Opening of Tender: 17/01/2018 at 15:30 Hrs. 8. Website Particulars: www.treps.gov.in. 9. Tender Inviting Authority & its complete address: Senior Divisional Mechanical Engineer (Diesel) Vatra Office of Sr. DME/DL/VTA Diesel Loco Shed, Vatva, Western Railway, Ahmedabad, Gujarat-382445. 10. For more information visit www.westernrailways.com

NOTICE
NOTICE is hereby given that the following share certificates are registered in our / my Name has been lost. Therefore, We have applied for issue of duplicate share certificate to the Wimpilast Ltd. Regd. Office: 32-24 to 7, Village Kachigam, Swami Narayan, Gurukul Road, Nani Daman, Daman-396210. So, general public are hereby warned not to deal with the following securities and if company do not receive any objection within 15 days from the date of publication of this notice on above-mentioned Regd. Address / of the company will proceed for the issue of Duplicate Share Certificate(s) in My / Our Name.
Folio No. 010140, Name of the Share Holders- Daksha Patel, Paresb Patel, Jasu Patel, Distinctive No. 4934001 - 4934100, Certificate No. 51841, Shares- 100
Place : Ahmedabad
Date : 12-12-2017

CHANGE OF SURNAME
I have changed my name from **KASHYAPKUMAR MAGANBHAI BHAGAT** to new name **KASHYAPKUMAR MAGANBHAI PATEL**. Add.: Vaktapur Himmatnagar, Sabarkantha K020

CHANGE OF SURNAME
I have changed my name from **RAJESHKUMAR CHANDULAL BHOJANI** to new name **RAJESHKUMAR CHANDUBHAI PATEL**. Add.: Vaktapur Himmatnagar, Sabarkantha K020A

CHANGE OF NAME
I have changed my name from **SARVAVI NIKUNJKUMAR RAJNIKANT** to new name **PATEL NIKU RAJNIKANT**. Add.: F/202, Prahlad Residency, Naroda, Ahmedabad. 307A

CHANGE OF NAME
I have changed my name from **BHARVAD RAJENDRAKUMAR SOMABHAI** to new name **BHARVAD RAJUBHAI SOMABHAI**. Add.: 272, Krishnanagar, Hebatpur, Ahmedabad. 307

CHANGE OF NAME
I have changed my minor son's name from **DARSH DHAIVAT PATEL** to new name **DARSH KHUSHBU MENER**. Add.: 36-421, Raghukul apartment, Naranpura, Ahmedabad. 306

DECO-MICA LIMITED Corporate Identify Number : L20299GJ1988PLC010807
Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380 015

Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter ended on September 30, 2017
(Rs. in Lacs)

Sr No.	Particulars	Quarter ended 30/09/17 (Unaudited)	Quarter ended 30/06/17 (Unaudited)	Quarter ended 30/09/16 (Unaudited)	Half Year ended 30/09/17 (Unaudited)	Half Year ended 30/09/16 (Unaudited)
1.	Total Income from Operations (net)	1641.19	1195.14	835.11	2836.33	1831.44
2.	Net Profit / (Loss) from ordinary activities before tax	103.67	19.51	33.27	123.18	55.06
3.	Net profit / (Loss) for the period after tax (after Extraordinary items)	62.91	45.13	21.20	108.04	30.79
4.	Other Comprehensive Income / (Loss)	---	---	(0.96)	0.00	(1.92)
5.	Paid Up Equity Share Capital (face value of Rs.10/- each)	420.00	420.00	420.00	420.00	420.00
6.	Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)	---	---	---	---	---
7.	Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs.10/- each) Basic : EPS (Rs.) Diluted : EPS (Rs.)	1.50	1.07	0.50	2.57	0.73

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's website at www.decocaltd.com

Place : Ahmedabad
Date : 13/12/2017

By Order of the Board of **DECO-MICA LIMITED**
(Shri Vijaykumar Agarwal)
Director

JINDAL WORLDWIDE LIMITED
Regd. & Corp. Off: "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad -380015 • CIN: L17110GJ1986PLC008942 • Ph:079-71001500
E-mail lid: csjindal@jindaltextiles.com • Website: www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter / Half Year Ended 30th September, 2017
(Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. in Lakhs)

S.No.	Particulars	Quarter Ended (Unaudited)			Half Year Ended (Unaudited)	
		3 months ended of C.Y.	Previous 3 months ended of C.Y.	Corresponding 3 months ended of P.Y.	Corr. 6 months ended year to date figures of C.Y.	Corr. 6 months ended year to date figures of P.Y.
		30th Sept, 2017	30th June, 2017	30th Sept, 2016	30th Sept, 2017	30th Sept, 2016
1	Total income from operations (net)	39437.13	36118.61	28110.78	75555.74	55655.74
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	3022.24	2160.07	1958.85	5182.31	3445.27
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	3022.24	2160.07	1958.85	5182.31	3445.27
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	2039.82	1721.17	1615.69	3760.99	2938.70
5	Total Comprehensive income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	2039.82	1721.17	1615.69	3760.99	2938.70
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year i.e 31st March, 2017	26359.05				
8	Earnings per share (of Re. 10/- each) (for continuing and discontinued operations) : 1. Basic : 2. Diluted :	10.17	8.58	8.06	18.76	14.66
		10.17	8.58	8.06	18.76	14.66

Notes:
1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on 12th December, 2017.
2. The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended on 30th September, 2017 alongwith Limited Report will be available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltextiles.com).
3. The figures of the previous period/year have been regrouped/rearranged wherever considered necessary.
4. The company has adopted Ind-AS from 1st April, 2017 and accordingly the said Un-Audited Standalone Financial Results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS-34 - Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and SEBI Circular No. CIR/CFD/FAC/62/2016 dated 5th July, 2016.
Date : 12th December, 2017
Place: Ahmedabad
For and On Behalf of the Board,
JINDAL WORLDWIDE LIMITED
(MR. AMIT AGRAWAL)
Managing Director - DIN : 00169061

Business Brief

Sharekhan launches 'InstaMF'
Mumbai, Sharekhan, the preferred savings and investment partner for investors, announced the launch of InstaMF, its online and paperless mode of investing in mutual funds. In just three steps, InstaMF enables investors to buy mutual funds or start SIPs (Systematic Investment Plan). InstaMF facility is available to investors without the need of opening a demat account with Sharekhan.

Speaking on the occasion of the launch, Jaideep Arora, CEO, Sharekhan said, "InstaMF is in line with Sharekhan's aim of providing digital excellence to investors. A pure online platform, InstaMF will make investing in mutual funds as easy as 1-2-3. Investors can choose any scheme according to their investment horizon and backed by research from Sharekhan."

The InstaMF platform allows investors to open an account in just three steps. In the first step itself, investors will know whether they are KYC compliant or not. In case their KYC is not in place, Sharekhan will get in touch with them within 24 hours to complete the KYC process.

Stefan Groening, Director - Investment Solutions, Sharekhan says, "With the surge in retail interest in equity markets via mutual funds, InstaMF will help the growing investor base to invest with ease. InstaMF also gives the investors access to Sharekhan's Robo advisor - NEO, where they get the best investment advice for their unique financial requirements. InstaMF brings the expertise of Sharekhan to investors so that they can take informed decisions."

SpiceJet to launch six new frequencies

New Delhi, Budget passenger carrier SpiceJet on Tuesday said that it will launch six new frequencies to cater to the surge in demand.

According to the airline, new seasonal flights will be effective from December 22, 2017 and will continue till February 5, 2018.

"The airline will operate the new daily direct flights on the Chennai-Kochi, Chennai-Kolkata and Kolkata-Port Blair routes. SpiceJet will deploy its Boeing 737-800 aircraft on these sectors," the airline said in a statement. "Leisure travel sees a seasonal surge during the winter months owing to the favourable climatic conditions and kick start of the holiday season. These new flights announced by SpiceJet will provide tourists with additional choices and thus enhance their convenience."

ADB lowers India's GDP forecast to 6.7%

New Delhi, The Asian Development Bank (ADB) on Wednesday lowered its Indian GDP forecast for the current financial year to 6.7 per cent citing tepid growth in the first half, demonetisation and transitory challenges posed by implementation of GST.

The multilateral lender also revised its Indian Gross Domestic Product outlook for the 2018-19 fiscal down to 7.3 per cent, from 7.4 per cent, largely due to the hardening of international crude oil prices and stagnant private sector investment in the country.

"Owing to tepid growth in the first half of 2017-18, the lingering effects of demonetisation in November 2016, transitory challenges of a new tax system, and some risks to agriculture stemming from a spotty monsoon in 2017, the economy is now expected to grow by 6.7 per cent, slower than the seven per cent forecast in the Update," the ADB said in a supplement to its Asian Development Outlook (ADO). In its September update, the ADB had downgraded India's growth projection for the current fiscal to seven per cent and also lowered its forecast for the next financial year to 7.4 per cent, from 7.6 per cent.

Equity indices close lower after volatile trade session

Mumbai, After a volatile trade session, the key Indian equity indices on Wednesday provisionally closed on a lower note as investors booked profits in metals, capital goods and banking stocks.

According to market observers, the benchmark indices gave up all their morning gains to close in the red for the second day in a row as traders were cautious ahead of the US Federal Reserve's policy outcome later in the evening.

૨૩ માર્ચથી સમાજ સેવી અન્ના હજારે દિલ્હીમાં ધરણા કરશે



અંક સત્યાગ્રહ હરણ, ગાંધીવાદી હજારેએ કહ્યું કે તે આ મુદ્દાને લઈ વડાપ્રધાનને પત્ર લખી ચુક્યા છે

ફરીદાબાદ, સમાજસેવી અન્ના હજારેએ કહ્યું છે કે તે આગામી ૨૩ માર્ચથી ફરીથી રામલીલા મેદાનમાં ધરણા કરશે. તેમનું આંદોલન કિસાનોની સાથે થઈ રહેલ અન્યાયની વિરુદ્ધ થશે. હજારે કહ્યું કે સરકાર અમને જેલમાં નાખવા ઈચ્છે તો નાખી દે અમે જેલમાં જતા ડરીશું નહીં. અમે પહેલા બે વાર જેલમાં ગયા તો મહારાષ્ટ્રની સરકાર તુટી પડી અને અંકવાર મનમોહનસિંહની કેન્દ્રમાં સરકાર પતન થયું હતું. હજારેએ બંને અરૂણ જેટલી દ્વારા કિસાનોને દાંડે ગણા સમર્થન મૂલ્ય આપવાની વાત પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને પહેલા નીતિ પંચથી વાત કરવી જોઈતી હતી, ત્યારે આ વાતને બંનેટમાં સામેલ કરવી હતી. હજારેએ સરકારથી માંગ કરી છે કે જે કિસાન ૬૦ વર્ષની ઉંમર પાર કરી ચુક્યા છે અને તેમના ધરમાં રોજગારના કોઈ સાધન નથી તો તેને સરકાર ૫૦૦૦ પ્રતિ માહિને પેશન આપે. ૨૩ માર્ચ સુધી આ શરતને સરકાર તેને માની લેશે તો આંદોલન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સરકાર જ્યારે ઇલોગપતિઓના દેવા માફ કરી શકે છે તો લાંબી પસીનો વહેવડાવતા કિસાનોના દેવા માફ કરવામાં તેમને શું પરેશાની છે તેમણે કહ્યું હતું કે જનલોકપાલ, કિસાનોની સમસ્યા અને ચુંટણીમાં સુધારો માટે આ

ઓછા ૧૨ લાખ કિસાનોએ આત્મહત્યા કરી લીધી છે. મેં જાણવા માગું છે આ કાલખંડમાં કેટલાક ઇલોગપતિઓએ આત્મહત્યા કરી. ભૂતપૂર્વ પર રોક લગાવવા માટે હજારે જન લોકપાલની રજના કરવાની માંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે લોકસભામાં બાલ વિરોધ પક્ષનો કોઈ નેતા નથી આથી સમિતિની રચના થઈ શકતી નથી આવામાં લોકપાલની નિયુક્તિ પણ થઈ શકતી નથી. તેમણે તેના માટે વર્ષ ૨૦૧૧માં ૧૨ દિવસના ઉપવાસ કર્યાં હતાં તેમની માંગોને યુપીએ સરકારે સંધ્યાકાળ રીતે સ્વીકાર કર્યાં હતાં. ત્યારબાદ હજારેએ ફરીથી અનશન કર્યાં હતાં. આ દરમિયાન તેમને સમગ્ર દેશમાંથી સમર્થન પણ મળ્યું હતું ત્યારબાદ યુપીએ સરકારે લોકપાલ વિધેયક પસાર કર્યું હતું. હજારેના સાથીએ જણાવ્યું હતું કે મોદી સરકારે લોકપાલની નિયુક્તિ કરી નથી તેમણે કહ્યું કે સરકાર તરફથી તેના માટે જે કારણ આપવામાં આવ્યું છે તે ટેકનીકી છે. તેમણે કહ્યું કે લોકપાલ કાનુન હેઠળ અંક સમિતિ જેમાં વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, લોકસભામાં લોકપાલની નિયુક્તિ પણ થઈ શકતી નથી. તેમણે તેના માટે વર્ષ ૨૦૧૧માં ૧૨ દિવસના ઉપવાસ કર્યાં હતાં તેમની માંગોને યુપીએ સરકારે સંધ્યાકાળ રીતે સ્વીકાર કર્યાં હતાં. ત્યારબાદ હજારેએ ફરીથી અનશન કર્યાં હતાં.

મોડાસામાં હજારત પીર સીધી મુસાર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

મોડાસા, કોમી એકતાપ્રાપ્તિક સમાહ હજારત પીરસીધી મુસાર (ર.હ.) નો ઉર્ષ સંદલ મુબારક ધામ ધુમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. તાર ફેબ્રુઆરીએ સંદલ શરીરની વિધી કરવામાં આવી હતી. તેમાં કુઆન ખવાજા અને યાદર ચલાવવામાં આવી હતી. જ્યારે તા. આ રોજ ઉર્ષ મુબારક ઉજવામાં આવ્યો હતો. જેમાં પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વર્ષોથી નિરંતર પ્રસાદી ઉર્ષ શરીર મનાવવામાં આવે છે. જેમાં શ્રદ્ધાળુઓ ધન્યા પ્રાપ્ત કરે છે. હાજી મ હનીફ બેલીમ. મયુદીન શામ જાકીરભાઈ બેલીમ અકતરભાઈ અસીદ ઈશાદબેલીમ અને સબીરભાઈ બેલીમ સઈદભાઈ બેલીમ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ★

કેજરીવાલના કેબિનેટ મંત્રી જૈનના મહત્વપૂર્ણ દસ્તાવેજ સીબીઆઈને મળ્યા

નવીદિલ્હી, સીબીઆઈને કોઈ અન્ય કેસની તપાસ દરમિયાન દરમિયાન દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ત્રણ સંપત્તીઓના દસ્તાવેજ, બે કરોડ રૂપિયાની ડિપોઝિટ સ્વિસ, તેમની કંપનીની ૪૧ ચેકબુક કબજે કરી છે. હકીકતમાં થયું એવું કે સીબીઆઈની ટીમ ડેલ્હી કાઉન્ટરિસના અંક રજીસ્ટ્રારની તલાશી લેવા ગઈ હતી તો તેમાંથી ૨૪ લાખ રૂપિયા રોકડા અને અડધો કીલો સોનું કબજે કર્યું હતું આ સાથે જ તે લોકસભા સત્યેન્દ્ર જૈનની ત્રણ સંપત્તિઓના દસ્તાવેજ, બે કરોડની ડિપોઝિટ

શિરડી સાથે બાબાનું ટ્રસ્ટ કમિટિ સંભાળશે : સુપ્રીમ

મુંબઈ, મહારાષ્ટ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલ કમિટિ જ હાલમાં શિરડી સાથે બાબા ટ્રસ્ટનું પ્રશાસન સંભાળશે. સુપ્રીમ કોર્ટે કમિટિને ભંગ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. એ યાદ રહે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલ કમિટિના સભ્યો પર અપરાધિક મામલા લંબિત હતાં જેને કારણે હાઈકોર્ટે કમિટિને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે બોમ્બે હાઈકોર્ટના આદેશોની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજ કરી હતી જેમાં કમિટિને ભંગ ન કરવાના આદેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. હાલ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની કમિટિ જ શિરડી સાથે બાબા ટ્રસ્ટની કમાન સંભાળશે. સુપ્રીમ કોર્ટના આદેશને કારણે મહારાષ્ટ્ર સરકારને રાહત મળી છે.

ગોધરામાં જાણીતા કવિ વિનુ બામણિયા દ્વારા નિયમિત યોજાતી પુસ્તક પરબ



(તસ્વીર-દેહીભાઈ મેસવાલા, ગોધરા)

ગોધરા, ગોધરા શહેરના નહેરુબાગ ખાતે ૨૦૧૪થી માતૃભાષા અભિયાન દ્વારા શહેરના જાણીતા કવિ અને 'પરિવેશ' સામયિકના સંપાદક વિનુ બામણિયા 'અતીત' દ્વારા દર માસના પ્રથમ રવિવારે સવારે ૮ (આઠ) થી ૧૨ (બાર) દરમિયાન વિનામુલ્યે પુસ્તક પરબ યોજવામાં આવે છે. પુસ્તક પરબમાં સાહિત્ય, કલા, શિક્ષણ, વિજ્ઞાન જેવા વિવિધ પુસ્તકો એકસાથે આવેલી અથવા તો કાયમી વસાવટ માટે વાચકોને આપવામાં આવે છે. ભોળાભાઈ પટેલ, સુરેશ

આપણી મિસાઈલો ફક્ત રાષ્ટ્રપથ પર દેખાડવા માટે છે, શિવસેનાનો મોદી સરકારને પ્રશ્ન

નવીદિલ્હી, પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા સીમા ભંગ વિરુદ્ધ શિવસેના સાંસદ સમ્પત શહેડાએ ભારે ગોળીબારમાં એક સોના અધિકારી અને ત્રણ જવાન શહીદ થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. આજે શિવસેનાના આરોગ્ય વિભાગે આ અંગે મિસાઈલ મારફત કહ્યું હતું. શુ અમારી મિસાઈલો રાષ્ટ્રપથ પર ફક્ત દેખાડવા અને ભીડની તાલિયો માટે છે. શુ મિસાઈલ્સ રફ જાન્યુઆરીએ વિદેશી મહેમાનેને ફક્ત દેખાડવા માટે છે. તેમણે વધુમાં કહ્યું કે આ સંઘર્ષવિરોધી ભંગ નથી. પરંતુ સીધુ યુદ્ધ છે અને તેનો જવાબ તેવી રીતે જ આપવો જોઈએ અને જો તેનો જવાબ આપીશું નહી તો આ દેશને સમગ્ર વિશ્વમાં નામદ કહેવામાં આવશે.

સોનુ નિગમની જનને ખતરો, ગુમચર એલર્ટ બાદ સુરક્ષા વધારવામાં આવશે

મુંબઈ, બોલીવુડના જાણીતા ગાયક સોનુ નિગમના જીવને જોખમ હોવાનું ધ્યાનમાં રાખી પોલીસ તેમની સુરક્ષા વધારવા જઈ રહી છે. હકીકતમાં મહારાષ્ટ્રના ગુમચર વિભાગે પોલીસને મોકલેલ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક કટ્ટરપંથી સંગઠન સોનુ નિગમની સત્યા કરવાનું કાવતરું રચી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે ગુમચર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ કટ્ટરપંથી સંગઠન અથવા તો કોઈ ઈવેન્ટ અથવા પ્રમોશન દરમિયાન નિશાન બનાવી શકે છે. આવામાં મુંબઈ પોલીસ સહકર્મ થઈ ગઈ છે અને તેની સુરક્ષા વધારવાની કવાયતમાં લાગી છે.

વેસ્ટર્ન ટાઇમ્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

વેસ્ટર્ન ટાઇમ્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો. -જાહેરખબર મેનેજર

INDO-GLOBAL ENTERPRISES LIMITED
 Regd. Office: Dalia Building, Nr V S Hospital, Nr Gopi Restaurant, Ellisbridge, Ahmedabad-380006. Ph: 079-26587363.
 Email: compliance.indoglobal@gmail.com Website: www.indoglobalinc.in
 CIN: L70102GJ1995PLC007814

સાનલુવ્યુ કોર્પોરેશન લિમિટેડ
 રજી. ઓફિસ : ૨૨ - એ, ગવર્નમેન્ટ સોસાયટી, મુમ્બઈના માર્ગે વાડે, સી.યુ. રોડ, અહમદાબાદ-૩૮૦૦૦૬
 Email : inquiry@sambhucorporation.com • Website : www.sambhucorporation.com
 CIN: L15400GJ1993PLC020073

ગોદીસ
 ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ પુરા થતા ત્રિમાસિક ટ્રેડિંગ વિકલેટ ડલોઝર માટેની ભોટી મીટિંગની જાણ

આથી નોટિસ આપી જાણ કરવામાં આવે છે કે મુખ્યત્વે, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ બપોરે ૪:૦૦ કલાકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે નીચે દર્શાવેલી બાબતો અંગે વિચારણા તમા ને મેંજર કરવા કંપનીના ઓફિસ ડિરેક્ટરની મીટિંગ યાજ્ય કરવાશે.

- ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગણનાના અનલોડિંગેડ નાણાકીય પરિણામોની મંજૂરી માટે
- શ્રી ખેપ કેવિલ્સલી CEO અને મેનેજિંગ ડાયરેક્ટરના તરીકે ફરી નિમણૂક, ચેર ઓફિસોની મંજૂરી સહિત
- સભાપતિની પરવાનગીથી અન્ય કોઈ કામ

આ ઉપરાંત જણાવવાનું કે ઓફિસ કમીટીની મીટિંગ આગામી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ને મંગળવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે યાજ્ય કરવાશે.

આ ઉપરાંત જણાવવાનું કે કંપનીના ડિરેક્ટર/ઓફિસર/નિયુક્ત કર્મચારીઓ માટે કંપનીના શેરમાં ટ્રેડિંગ કરવા માટેની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે આગામી ૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ (અને દિવસોને આવી લેવાશે) સુધી બંધ રહેશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વાલી, સાનલુવ્યુ કોર્પોરેશન લિમિટેડ
 Sd/-
 ખેપ કેવિલ્સલી
 ચેરમન
 તારીખ : ૦૩/૦૨/૨૦૧૮
 મેનેજિંગ ડાયરેક્ટર (DIN): 03532474

૨૦૧૬ની ચુંટણીમાં એનડીએની સાથે જ રહીશું : જીતાન રામ માઝી

સમસ્તીપુર, બિહારમાં સમસ્તીપુરના તાજપુર હાઈસ્કૂલના પરિસરમાં આયોજિત સંત રવિદાસ જયંતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનું વિધિવત ઉદ્ઘાટન બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતાન રામ માઝીએ દીપ પ્રગટાવીને કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી જીતાન રામ માઝીએ સંત રવિદાસે બતાવેલા માર્ગોને જીતાનમાં આત્મસાત કરવાની વાત કહી હતી. આયોજિત સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે દેશમાં અનામતની સમીક્ષાની આવશ્યકતા છે આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૬ની ચુંટણીમાં એનડીએની સાથે જ રહીને લડવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી માઝીએ રાષ્ટ્રીય સ્વયં સેવક હિંદના પ્રમુખ મોહન રાવ ભાગવતના તે નિવેદનને સમર્થન આપ્યું જેમાં તેમણે દેશમાં અનામતની સમીક્ષાની વાત કહી હતી.

સ્પોર્ટ્સ અપડેટ
ભારત સામે હારીને પણ દક્ષિણ આફ્રિકાએ રેકોર્ડ બનાવ્યો
સેચુરિયન, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની શાનદાર બોલીંગને કારણે ભારતે એકવાર ફરી દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર સપ્ત પરાજય આપ્યો છે. ભારતે બીજા એક દિવસીય મેચમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટ હરાવ્યું હતું અને આ સીરીઝમાં ૨-૦ની સરસાઈ હાંસલ કરી હતી. જો કે મેચમાં નીમ હારી ગઈ હોવા છતાં તેણે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની ધરતી પર પોતાના સાથી ઓછા સ્કોરના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ પહેલા તેનો પોતાની ધરતી પર ઓછામાં ઓછો સ્કોર ૧૧૯ રન હતો જે તેણે ઈંગ્લેન્ડની વિરુદ્ધ ૨૦૦૮માં એલિથ્રેમ્બેશમાં બનાવ્યો હતો. આ મેદાનમાં કોઈ પણ ટીમનો સાથી ઓછો સ્કોર છે તેના પહેલા ઝિમ્બાબ્વેએ ૨૦૦૯માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ અહીં ૧૧૯ રન બનાવ્યા હતાં.

દેહીવેરીના સહસ્થાપકો દ્વારા અમદાવાદના સ્ટાર્ટ-અપ 'ફૂડમેમરીઝ' માં રોકાણ

અમદાવાદ, ભોગોલિક રીતે અનોખા ભારતીય ભોજન માટા માર્કેટ પ્લેસ 'ફૂડમેમરીઝ' દ્વારા દેહીવેરીના સહસ્થાપકો ભાવેશ મંગલાની અને સુરજ સાહરન તથા મુંબઈના ઈકોનોમીક બો પ્રેક્ટીસના પાર્ટનર્સ ટર્શન ઉપાધ્યાય અને સંજય નોડાની આગેવાની હેઠળની આર ડોકાણકારોના કોન્સોર્ટિયમ પાસેથી સીડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત બેંગલોરની ટોચની વીક્ટીંગ કંપની કીટી સેલ્સ એન્ડ સર્વિસના સ્થાપક સચિન ખંડેલાલ પણ આ ઈન્વેસ્ટર ગ્રુપમાં જોડાયા છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ડો. હરમિતસિંઘ શીખ દ્વારા સ્થાપવામાં આવેલી ફૂડ મેમરીઝ ભારતના આહાર ઉદ્યોગની ટોચની તમામ આદર્શ બ્રાન્ડ અને વાનગીઓ દુનિયાખરના ગ્રાહકોને પુરી પાડે છે. આ ઈન્વેસ્ટર્સ અને સીડ મેનેજમેન્ટથી ફૂડ મેમરીઝની

PUBLIC NOTICE
 Notice is hereby given that the following sub broker/s is no longer affiliated as sub-broker of SMC Global Securities Ltd., Base Reg. No. INB011343937 (Previously SAM Global Sec. Ltd. (INB01107332) & NSE Reg. No. INDF23077431 trading member of Bombay Stock Exchange of India Ltd. & National Stock Exchange of India Ltd. having the registered office at 11/6B, Shanti Chamber, Pusa Road, New Delhi- 110 005. Any person heretofore dealing with below mentioned sub-broker/s should do so at their own risk. SMC Global Securities Ltd. shall not be liable for any dealings with them.
 Sub-Broker Trade Name : DIPAK INVESTMENT
 BSECM SEBI Reg. No. : INS016497120 Date : 1-Jan-2009
 Reg. Office Address : Thumer Chamber, Jelpur Road, Dhoraji Rajkot, Gujarat-360410
 By Order of Board of Director SMC Global Securities Ltd.

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LTD.
 Regd. Off : International Airport Circle, Ahmedabad - 382 475.
 CIN: L55100GJ1991PLC015839
 Phone - (079) 22868642-43 Fax - (079) 22868641
 Email : royalemanorhotels@rediffmail.com
 Website : www.rmhil.com

NOTICE
 Notice is hereby given that Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the meeting of the Board of Directors of the Company will be held on Wednesday, 14th February, 2018 at 3.00 p.m. at the registered office of the company to inter alia to consider, take on record and approve the Unaudited Financial Results of the company for the quarter and nine months ended on 31st December, 2017. This information is also available on the website of the company i.e. www.rmhil.com and on the website of the stock exchange i.e. www.bseindia.com

For ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED
 Sd/-
 Jayant Kumar
 Company Secretary
 Place : Ahmedabad
 Date : 05/02/2018

INDO CREDIT CAPITAL LIMITED
 Regd. Office : 304, Kaling, B/h. Bata Show Room, Nr. Mt. Carmel School, Ashram Road, Ahmedabad 380009
 Web : www.indocreditcapital.com CIN : L65910GJ1993PLC020651
 email : indocredit@rediffmail.com Telefax : 079-26580366

NOTICE
 Notice is hereby given that Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Meeting of the Board of Directors of the Company will be held on Monday, 12th February, 2018 at 11.00 A.M. at the registered office of the company, inter alia to consider, take on record and approve the Unaudited Financial Result of the company for the quarter and nine months ended 31st December, 2017. This information is also available on the website of the Company i.e. www.indocreditcapital.com and on the website of the stock exchange i.e. www.bseindia.com

For INDO CREDIT CAPITAL LIMITED
 Sd/-
 (Hardik H. Joshi)
 Company Secretary
 Place: Ahmedabad
 Date : 05/02/2018

GUJARAT RAFFIA INDUSTRIES LIMITED
 (CIN : L17110GJ1984PLC007124)
 Regd. Office : Plot No 455, Santej-Vadnar Road, Santej, Gandhinagar - 382721
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2017 (Rs. in Lacs)

Sr. No	Particulars	Quarter ended	Year to Date	Corresponding
		31/12/17	Figures ended in Previous year	3 Months ended in the previous year
		Unaudited	Audited	Unaudited
1	Total income from Operations	920.07	3650.52	637.68
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	24.49	102.39	18.77
3	Net Profit / (Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary Items)	24.49	102.39	18.77
4	Net Profit/(Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary Items)	18.29	78.26	14.13
5	Total comprehensive Income/ (Loss) for the period	18.29	78.26	14.13
6	Equity Share Capital (Face Value Rs. 10 each)	499.48	499.48	499.48
7	Reserve (excluding revaluation reserve as shown in the balance sheet of previous year)	-----	-----	-----
8	Earning per Share (of Rs. 10/- each) (for continuing and discontinuing operation)	0.37	1.57	0.28
	(a) Basic	-----	-----	-----
	(b) Diluted	-----	-----	-----

Notes : (1) The above is an extract of the detailed financial results for the Third Quarter ended 31st December, 2017 filed with the Stock Exchange pursuant to regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the website of the Stock Exchange at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.gritpar.com

For, Gujarat Raffia Industries Limited
 Sd/-
 Pradeep Bhutoria
 Managing Director (DIN : 00284808)
 Place : Santej
 Date : 05/02/2018

SAYAJI HOTELS LIMITED
 Regd. Office : Opp. Rajshree Talkies, Near Kala Ghoda, Sayajigunj, Vadodra-390 005 (Gujarat) Ph. 0265-2363030
 Email : cs@sajajigroup.com, Website : www.sajajihotels.com
 CIN : L51100GJ1982PLC005131

NOTICE is hereby given pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting No. 04/2017-2018 of the Board of Directors of the company will be held on Wednesday, 14th day of February, 2018 at Indore, inter alia, to approve the Unaudited Financial Results for the Quarter Ended on 31st December, 2017. Further, pursuant to Regulation 47(2) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, further details of meeting are available on the link of the website of the Company and stock exchange where shares of the Company are listed hereunder:
 Company website: http://www.sajajihotels.com/investor/StockExchangeWebsite: http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=523710&id=A&expandable=0
 For Sayaji Hotels Ltd.
 Sd/
 Amit Sarraf
 Company Secretary
 Place: Indore
 Date: 06.02.2018

INTERNATIONAL HOUSING FINANCE CORPORATION LTD
 CIN: L65910GJ1990PLC014436
 Regd. Office: "Moorti Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundevan, Satellite, Ahmedabad- 380015.
 Ph: 079- 65214174 / 64502351 Email Id: ihfcl@hotmail.com Website: www.ihfcl.com

NOTICE
 Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, the 13th day of February, 2018 at 12:30 p.m. at the Registered Office of the Company, inter alia to consider and approve the Un-audited Financial Results for the 3rd Quarter ended on 31st December, 2017. Further, this information is also available on website of the Company i.e. www.ihfcl.com and on the website of Stock Exchange's at www.bseindia.com.
 International Housing Finance Corporation Ltd.
 Sd/-
 Mr. Sandip B. Padsala
 Managing Director (DIN: 01870595)
 Date: 03/02/2018
 Place: Ahmedabad

B. NANJI ENTERPRISES LIMITED
 CIN: L45201GJ1982PLC005148
 Regd. Office: "Moorti Bunglows", 5 Ashoknagar Co-Operative Housing Society Ltd. B/h. Sundevan, Satellite, Ahmedabad- 380015. Ph: 079- 65214174 / 64502351
 Email Id: bnanji@hotmail.com Website: www.bnanji.com

NOTICE
 Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, the 13th day of February, 2018 at 11:30 a.m. at the Registered Office of the Company, inter alia to consider and approve the Un-audited Financial Results for the 3rd Quarter ended on 31st December, 2017. Further, this information is also available on website of the Company i.e. www.bnanji.com and on the website of Stock Exchange's at www.bseindia.com.
 By Order of the Board
 B Nanji Enterprises Ltd.
 Sd/-
 Mr. Sandip B. Padsala
 Director
 (Din : 00153615)
 Date: 03/02/2018
 Place: Ahmedabad
 Executive Director (DIN: 001870595)

Unison Metals Ltd.
 CIN No : L52100GJ1990PLC013964
 Regd. Office : Plot No. 5015, Phase - IV, Nr. Ramol Cross Road, GIDC, Vatva, Ahmedabad - 382445 • Tel: 079 - 25841512
 • E-Mail : unisonmetals@gmail.com • Web : www.unisongroup.net

NOTICE
 Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that Meeting of Board of Directors of the Company is scheduled to be held on Wednesday, February 14th 2018 at the Registered Office of the Company to inter-alia consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended on 31st December, 2017. Further trading window under Securities & Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015 will remain closed for the Promoters/ Directors/ Officers/ Designated Employees of the Company from 06th February 2018 to 16th February 2018 (Both Days inclusive). This information will also be available on the website of the Company i.e. www.unisongroup.net and on the website of the Stock Exchange i.e. www.bseindia.com.
 For, Unison Metals Ltd.
 Sd/- Mahesh Changrani
 Director
 (Din : 00153615)
 Place : Ahmedabad
 Date : 06/02/2018

Zuma's fate will not affect Brics Summit: Experts

Cape Town, The potential removal of South African President Jacob Zuma is unlikely to impact the 10th Brics Summit scheduled for July, experts said.

The 10th annual diplomatic meeting of the group of major emerging economies -- Brazil, Russia, India,

China and South Africa -- is set to come up in Johannesburg between July 25-27. South Africa's ruling party African National Congress (ANC) on Tuesday had ordered Zuma to step down as the state head after marathon talks over the fate of the leader.

The potential dismissal of the President, according to experts, will not impede the 10th Brics meet in South Africa, which takes over the rotating chairmanship of the group in 2018.

"The Zuma exit (Zexit) will not affect the Brics summit. A new South Africa President will convene the summit and the programmes will continue," Gwinyai Dzinesa, a researcher at the Centre for Conflict Resolution based in Capetown, told Xinhua on Tuesday. The summit scheduled in the Sandton Convention Centre will see South Africa push forward the programmes of development and prosperity.

Zuma had earlier requested a three-month "notice period" before he submits his unconditional resignation, ANC Secretary-General Ace Magashule said. His proposal was shot down by the committee.

South Africa will not allow the summit to abort, said Ngqabutho Nicholas Mabheba, a political commentator at the Zimbabwe Communist Party.

"The Brics mechanism has strengthened cooperation for institutional development, which saw the creation of the New Development Bank (NDB) and the newly launched Africa Regional Centre in Johannesburg," Mabheba

added.

He also said South Africa is willing to see Brics countries help each other with inclusive economic growth, value-added multilateral trade and investment in productive sectors.

Since South Africa joined the group in 2011, the country has scored major achievements.

Gerry Thomas, the chief executive officer of Krispy Kreme, a famous South African food producer, said the summit was important and "its organisation will be an important milestone towards building stronger solidarity and cooperation among the emerging markets." Magashule also said on Tuesday that Zuma has not been given a deadline to resign but was expected to respond to the recall on Wednesday.

As uncertainty over Zuma's future continues, the South African government had to postpone a cabinet meeting scheduled for Wednesday.

added.

He also said South Africa is willing to see Brics countries help each other with inclusive economic growth, value-added multilateral trade and investment in productive sectors.

Since South Africa joined the group in 2011, the country has scored major achievements.

Gerry Thomas, the chief executive officer of Krispy Kreme, a famous South African food producer, said the summit was important and "its organisation will be an important milestone towards building stronger solidarity and cooperation among the emerging markets." Magashule also said on Tuesday that Zuma has not been given a deadline to resign but was expected to respond to the recall on Wednesday.

As uncertainty over Zuma's future continues, the South African government had to postpone a cabinet meeting scheduled for Wednesday.

added.

He also said South Africa is willing to see Brics countries help each other with inclusive economic growth, value-added multilateral trade and investment in productive sectors.

Since South Africa joined the group in 2011, the country has scored major achievements.

Gerry Thomas, the chief executive officer of Krispy Kreme, a famous South African food producer, said the summit was important and "its organisation will be an important milestone towards building stronger solidarity and cooperation among the emerging markets." Magashule also said on Tuesday that Zuma has not been given a deadline to resign but was expected to respond to the recall on Wednesday.

As uncertainty over Zuma's future continues, the South African government had to postpone a cabinet meeting scheduled for Wednesday.

Xiaomi kicks off 2018 with Redmi Note 5, Note 5 Pro in India

New Delhi, Buoyed by its performance in the fourth quarter last year, Chinese smartphone maker Xiaomi on Wednesday launched two devices -- Xiaomi Redmi Note 5 and Note 5 Pro -- in the price-sensitive Indian market.

Redmi Note 5 -- a successor to the highly-acclaimed Redmi Note 4 -- will cost Rs 9,999 for the 3GB RAM and 32GB storage variant and Rs 11,999 for the 4GB RAM and 64GB variant. The device comes with 4000mAh battery and the Qualcomm Snapdragon 625 processor.

Redmi Note 5 Pro will cost Rs 13,999 for the 4GB RAM and 64GB variant and Rs 16,999 for the 6GB RAM and 64GB ROM option.

Housing the dual rear-camera system (12MP+5MP) and a 20MP selfie shooter, Redmi Note 5 Pro is the first Xiaomi smartphone to come with the "Face Unlock" feature. It also has the latest Snapdragon 636 processor.

"Today, we have 57 per cent market share in the online segment in India. Xiaomi is also second biggest offline brand in the country with 9 per cent share."

We shipped nearly 9.6 million Redmi Note 4 handsets in 2017," Manu Kumar Jain, Xiaomi India Managing Director and Global Vice President, told the gathering at the event.

Featuring an 18:9 full HD+ display with rounded corners, Redmi Note 5 Pro gives 12.5 percent more display area compared with smartphones using 16:9 screens.

Xiaomi also launched a smart LEDTV called "Mi TV 4" (55-inch) with 4K panel along with HDR10 in India.

At just 4.9mm slim, the Rs 39,999 TV is the world's thinnest LED TV and comes with an intelligent content-first "PatchWall" software, redesigned for India.

New Delhi, The Jawaharal Nehru University (JNU) administration on Tuesday condemned the strike being observed by the students as "unlawful", a violation of High court and university rules, and appealed to them to "refrain" from their activities.

Since Friday, the university students' union is observing a total 'lock down' of the university and hardly any classes have been conducted since then, while a different group of students has blocked the main road entry to the campus.

The agitation of the students is against a university circular issued on Friday, which proscribed those students who do not comply

Students' strike unlawful, violation of HC order: JNU admin

New Delhi, The Jawaharal Nehru University (JNU) administration on Tuesday condemned the strike being observed by the students as "unlawful", a violation of High court and university rules, and appealed to them to "refrain" from their activities.

Since Friday, the university students' union is observing a total 'lock down' of the university and hardly any classes have been conducted since then, while a different group of students has blocked the main road entry to the campus.

The agitation of the students is against a university circular issued on Friday, which proscribed those students who do not comply

by the new attendance rules from promoting to the next semester, and stipulated withdrawal of their scholarship/fellowship and hostel accommodation.

"JNU administration deplores the continuing agitation against the compulsory attendance rules through unlawful means. The road block along with the main artery of the campus roads has been causing enormous difficulties to children to commute by school buses..." the administration said in a statement.

CHANGE OF NAME
I have changed my daughter's old name from **DHARABEN MANSUKHLAL SAJJA** to New Name **DHARA MANSUKHLAL SAJJA**
Add. : A/101, Abjibapa Flats-1, Vastrapur, Ahmedabad M059

CHANGE OF NAME
I have changed my old name from **DAYABEN RAMANIKBHAI GAJERA** to New Name **DAYA DHARMENDRA VADADORIA**
Add. : A-2, Ratnadeep Complex, Satellite, Ahmedabad-380 015 2207

CHANGE OF NAME
I have changed my old name from **KASIMHUSEN SABBIRHUSEN MOMIN JULAYA** to New Name **KASAMHUSEN SABBIRHUSEN MOMIN**
Add. : 22, Attarwalani Chali, Danilimda,, Ahmedabad 2205

CHANGE OF NAME
I have changed my son's old name from **MOKSHA MANISHKUMAR SHAH** to New Name **MOKSH MANISHKUMAR SHAH**
Add. : MOKSH Manglam Street, Kund Kund Kahanagar, Society, Mahavir Nagar, Himmatnagar C050

CHANGE OF NAME
I have changed my old name from **NATYIK RUSHIKUMAR PATEL** to New Name **NAITIK RUSHIKUMAR PATEL**
Add. : 4, Silindra Apartment, 86 Sardar Patel Colony, Naranpura, Ahmedabad 2206

SHREE NARMADA ALUMINIUM INDUSTRIES LIMITED							
Regd. Office : 95/1, Bharuch-Patej Road, Bholav, Dist: Bharuch, Gujarat - 392001							
Corporate Identity Number : L91110GJ1981PLC004269							
Tel: +91 2642 260624; Fax: +91 2642 240620; E-Mail: nalexhb@yahoo.co.in							
UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2017 (Rs. In Lakhs)							
Sr. No.	Particulars	Quarter Ended					Year Ended
		31/12/2017		31/12/2016		31/12/2016	
		Unaudited	Audited	Unaudited	Audited		
I	Revenue from operations	-	-	-	-	0.01	
II	Profit/(Loss) before Tax	(3.31)	(8.39)	(3.02)	(15.44)	(16.03)	
III	Other Comprehensive Income Items that will not be reclassified to profit or loss	-	-	-	-	-	
IV	Remeasurement of the defined benefit plan	0.10	0.10	0.10	0.30	1.00	
V	Total Comprehensive Income (IX+X)	(3.21)	(8.29)	(2.92)	(15.14)	(15.03)	
VI	Paid up Equity Share Capital (Face value Rs. 10/- per share)	52.96	52.96	52.96	52.96	52.96	
	Earnings Per Share						
	i) Basic & diluted EPS before Extraordinary items for the period (Not Annualised)	(0.63)	(1.61)	(0.58)	(2.96)	(3.08)	
	ii) Basic & diluted EPS after Extraordinary items for the period (Not Annualised)	(0.63)	(1.61)	(0.58)	(2.96)	(3.08)	

NOTES:-

- The Statutory Auditors of the Company have carried out a limited review of the Statement of Financial Results for the quarter ended 31.12.2017 in compliance with regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015. The financial results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 14th February 2018.
- The Company is sick Company under Sick Industrial Companies Act, 1985. The company has received an order from Honourable High Court Gujarat dated 16.05.2008 which is under implementation. Meanwhile a secured creditor filed an application before Debt recovery Tribunal-III, Mumbai (DRT-III). On 05.01.2015 DRT-III, Mumbai passed an ex parte Order for secured creditor with the physical possession of Secured property i.e. factory at Bharuch including that from third party. The secured creditor who was acting in consonance with the understanding for over the period of eight months, suddenly initiated steps for taking Possession without awaiting for further order on 06.08.2015. DRT-II Mumbai has appointed court receiver for the same. The said property is still in the possession of the court receiver. The matter is still pending before DRT-III, Mumbai. The Company is continuously making reasonable efforts to take relief from said order. The management based on various legal opinions believe that going concern is sustainable. Hence the accounts have accordingly been prepared on a going concern basis. The Auditors of the Company have put a "Qualification" on the aforesaid matters in the Limited Review Report for the quarter and nine months ended 30th December 2017.
- No provision for income tax is made in lieu of losses and Deferred tax assets is not recognized in the absence of reasonable/virtual certainty to earn taxable income in future. Since the company is classified as sick company, provisions for MAT Under section 115JB of Income Tax Act, 1961 are not applicable.
- Beginning 1st April 2017, the company has for the first time adopted Indian Accounting Standard (Ind AS) with a transition date of 1st April 2016 and accordingly these financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS 34 Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.
- The Company is primarily engaged in the business of trading in aluminium and accordingly there are no separate reportable segments pursuant to Ind AS-108.
- A reconciliation of financial results to those reported under previous Generally Accepted Accounting Principles (GAAP) is summarised as follows:

Particulars	Q e 3	N e 31	Y e 31
Profit/(loss) after tax as reported under the Previous IGAAP	(3.02)	(13.15)	(16.03)
Net profit/(Net loss) after as per Ind AS			
Other Comprehensive Income	0.10	0.30	1.00
Total Comprehensive Income as per Ind AS	(2.92)	(12.85)	(15.03)

7 The formats for unaudited quarterly results is as prescribed under SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated November 30, 2015, as modified to company with the requirements of SEBI's Circular dated July 5, 2016.

8 There is a possibility that there quarterly financial results may require adjustment before constituting the final Ind AS financial statements as of and for the year ending 31st March 2018 due to changes in financial reporting requirements arising from new or revised standards or interpretations issued by MCA or changes in the use of one or more optional exemptions from full retrospective application of certain Ind AS as permitted under Ind AS 101.

9 The figures of the previous period have been regrouped / reclassified / restated wherever necessary.

For SHREE NARMADA ALUMINIUM INDUSTRIES LTD.

For and on behalf of Board of Directors
Kantilal B. Patel
Chairman and Managing Director and CEO
Milan R Patel
Executive Director and CFO

Place : Bharuch
Date : 14.02.2017

AREX INDUSTRIES LIMITED						
(CIN: L99999GJ1989PLC012213)						
Regd Office: 612, GIDC Estate, Chhatral, Tal.:Kalol, Dist.: Gandhinagar-382 729.						
Phone: +91 2764 233636 Email: mail@arex.co.in Website: www. arex.co.in						
Statement of Standalone Un-audited Financial Results For the Quarter and Nine months ended on 31st December, 2017 (Rs. In Lakhs)						
Sr. No.	Particulars	Quarter Ended			Nine months ended	
		31/12/2017 Unaudited	30/09/2017 Unaudited	31/12/2016 Unaudited	31/12/2017 Unaudited	31/12/2016 Unaudited
1	Income					
	(a) Revenue from operations	969.58	839.92	816.59	2784.88	2619.54
	(b) Other Income	1.48	0.16	0.98	7.20	1.44
	Total Income	971.06	840.08	817.57	2792.08	2620.98
2	Expenses					
	(a) Cost of materials consumed	256.65	270.09	217.04	788.91	759.59
	(b) Purchases of Stock-in-Trade	11.78	2.68	24.34	43.52	32.83
	(c) Changes in inventories of finished goods, work-in-progress and stock-in-trade	(15.28)	27.77	(8.54)	(38.60)	(13.53)
	(d) Employee benefits expense	211.36	200.53	192.96	629.35	600.95
	(e) Finance costs	25.40	26.32	24.09	79.81	72.18
	(f) Depreciation and amortisation expense	74.00	69.00	59.00	221.00	178.00
	(g) Other expenses	253.77	216.51	234.50	719.55	602.47
	Total expenses	817.68	812.90	743.39	2443.54	2232.49
3	Profit before exceptional and extraordinary items and tax (1-2)	153.38	27.18	74.18	348.54	388.49
4	Exceptional items	0.00	0.00	0.00	0.00	0.00
5	Profit before extraordinary items and tax (3 - 4)	153.38	27.18	74.18	348.54	388.49
6	Extraordinary items	0.00	0.00	0.00	0.00	0.00
7	Profit before tax (5-6)	153.38	27.18	74.18	348.54	388.49
8	Tax expense:					
	(1) Current tax	8.70	(0.35)	27.00	60.85	135.00
	(2) Deferred tax	(5.35)	17.10	(1.55)	19.65	(2.70)
9	Profit/(Loss) for the period (7-8)	150.03	10.43	48.73	268.04	256.19
10	Other Comprehensive Income (After Tax)	0.91	2.58	(4.63)	4.70	5.60
11	Total Comprehensive Income (9+10)	150.94	13.01	44.10	272.74	261.79
12	Paid-up - Equity Share Capital [Face Value Rs. 10/- each]	395.87	395.87	395.87	395.87	395.87
13	Earnings per equity share (of 10/- each) (not annualised)					
	(a) Basic	3.79	0.26	1.23	6.77	6.47
	(b) Diluted	3.79	0.26	1.23	6.77	6.47

NOTES:-

- Result for the Quarter and Nine months ended 31st December 2017 are in compliance with Indian Accounting Standards (Ind-AS) notified by the Ministry of Corporate Affairs, Consequently, result for the Quarter and Nine months ended 31st December 2016 have been restated to comply with Ind-AS to make them comparable.
- The above results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meetings held on 14/02/2018
- The Statutory Auditors have carried out a " Limited Review" of the Financial Result for the Quarter and Nine months ended 31st December 2017.
- The Company does not have more than one reportable segment. Accordingly segmental information is not required to be provided
- Reconciliation of profit after tax for the Quarter and Nine months ended 31st December 2016 between Ind-AS complaints result as reported above with result reported in previous year as per Indian GAAP is given below:

Particulars	Quarter ended 31st December 2016	Nine months ended 31st December 2016
Profit / (Loss) after tax under Indian GAAP	48.73	256.19
Measurement of Financial Instruments at fair value through Other comprehensive income	(4.63)	5.60
Total Comprehensive income as per Ind AS	44.10	261.79

For, AREX INDUSTRIES LTD.
Dinesh Bilgi
(DIN:00096099)
Managing Director

Place : CHHATRAL
Date : 14.02.2018

OMKAR INDUSTRIES LIMITED					
Regd. Office: 260, New Cloth Market, Out Side Raipur Gate, Raipur, Ahmedabad - 380 002.					
Website : www.omkarindustries.co.in, Ph NO. : (079) 22120022;					
E-Mail ID : naroda@omkargroup.com CIN : L51909GJ1985PLC007702					
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2017. (In Rupees)					
P	A	R	Quarter ended on 31/12/2017 (unaudited)	Nine Months ended on 31/12/2017 (unaudited)	Corresponding 3 months ended in the previous year 31/12/2016 (unaudited)
Total Income from Operations			21274278	114121439	39724010
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)			35409	151026	67390
Net profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)			35409	151026	67390
Net profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)			26409	111026	47390
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))			26409	111026	47390
Paid-up equity Share Capital			2450000	2450000	2450000
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			2233267	2233267	2064608
Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)					
-Basic			0.11	0.45	0.19
-Diluted			0.11	0.45	0.19

Notes:

- The above is an extract of the detailed format of Third quarter and Nine Months unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Unaudited Financial Results is available on company's website -- www.omkarindustries.co.in.
- The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th February, 2018.
- The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 31st December, 2017 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

For OMKAR INDUSTRIES LTD.
SUBHASHCHANDRA O. AGARWAL
DIRECTOR & CEO
DIN: 00356977

Place : Ahmedabad
Date : 14.02.2018

AMRAPALI INDUSTRIES LTD					
CIN: L91110GJ1988PLC010674					
Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009					
Phone: +91-79-26581329/30, +91-79-26575105/06 Fax: +91-79-26579169/26584313					
Email: ail@amrapali.com Website: www.amrapalispot.com					
STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2017 (Rs. in Lakh except EPS)					
P	A	R	31.12.2017 Un audited	31.12.2016 Un audited	31.03.2017 Audited
Total Income From Operations (net)			2,76,659.96	2,36,998.68	4,93,487.87
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)			(1,226.83)	72.16	192.11
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)			755.84	72.16	192.11
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)			755.84	72.16	164.36
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]			755.84	72.16	164.36
Equity Share Capital			2,570.53	2,570.53	2,570.53
Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)			-	-	(11.57)
Earnings Per Share (of Rs. 5/- each) (for continuing and discontinued operations)					
Basic			1.47	0.14	0.32
Diluted			1.47	0.14	0.32

Note:

The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on February 14, 2018. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the BSE Ltd Website at www.bseindia.com.

For, AMRAPALI INDUSTRIES LTD.
YASHWANT THAKKAR
(Managing Director)
DIN - 00071126

Place : Ahmedabad.
Date : February 14, 2018

JINDAL WORLDWIDE LIMITED						
Regd. & Corp. Off: "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • CIN: L17110GJ1986PLC008942 • Phone: 079-7100 1500						
E-mail Id: csjindal@jindaltextiles.com • Website: www.jindaltextiles.com						
STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter Ended 31st December, 2017 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. In Lakhs except EPS)						
S.No.	Particulars	Quarter Ended (Unaudited)			Year To Date (Unaudited)	
		3 months ended of C. Y.	Previous 3 months ended of C. Y.	Corresponding 3 months ended of P. Y.	Corr. 9 months ended, year to date figures of C. Y.	Corr. 9 months ended, year to date figures of P. Y.
		31st Dec, 2017	30th Sept, 2017	31st Dec, 2016	31st Dec, 2017	31st Dec, 2016
1	Total income from operations (net)	42460.33	39437.13	22935.08	118016.07	78590.83
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary Items)	2345.25	3022.24	1476.23	7527.54	4921.50
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items).	2345.25	3022.24	1476.23	7527.54	4921.50
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1576.88	2039.82	1276.82	5337.85	4215.53
5	Total Comprehensive income for the period (Comprising					

AMRAPALI INDUSTRIES LTD

CIN: L91110GJ1988PLC010674
 Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009
 Phone: +91-79-26581329/30, +91-79-26575105/06 Fax: +91-79-26579169/26584313
 Email: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2017

(Rs. in Lakh except EPS)

PARTICULARS	31.12.2017 Un audited	31.12.2016 Un audited	31.03.2017 Audited
Total Income From Operations (net)	2,76,659.96	2,36,998.68	4,93,487.87
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(1,226.83)	72.16	192.11
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	755.84	72.16	192.11
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	755.84	72.16	164.36
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	755.84	72.16	164.36
Equity Share Capital	2,570.53	2,570.53	2,570.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year)	-	-	(11.57)
Earnings Per Share (of Rs. 5/- each) (for continuing and discontinued operations)			
Basic	1.47	0.14	0.32
Diluted	1.47	0.14	0.32

Note:
 The above results were reviewed by the Audit committee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on February 14, 2018. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the BSE Ltd Website at www.bseindia.com.

For, AMRAPALI INDUSTRIES LTD.
YASHWANT THAKKAR
 (Managing Director)
 DIN - 00071126

Place : Ahmedabad.
 Date : February 14, 2018

ગુજરાત ફોઈલ્સ લિમિટેડ

CIN-L28999GJ1992PLC018570

રજીસ્ટર્ડ ઓફિસ : ૩૪૩૬-૩૪૩૬, ફેઝ-૪, છાત્રાલ, જી.આઈ.ડી.સી., તાલુકો : કલોલ, જિલ્લો : ગાંધીનગર
 કોર્પોરેટ ઓફિસ : ૩૦૮, સીજી હાઉસ, ડો.એ.બી. રોડ, વરલી, મુંબઈ-૪૦૦૦૧૮
 ઈ મેઈલ આઈ.ડી. - rahul.singh@gujaratfoils.com વેબ સાઈટ- www.gujaratfoils.com.

૩૧મી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પુરા થયેલા નવ માસના ગાળા માટેના અનઓડિટેડ નાણાકીય પરિણામો

ક્રમ નં.	વિગતો	રૂપિયા લાખમાં		
		ત્રિમાસિક ગાળાના અંતે		નવ માસના અંતે
		૩૧.૧૨.૨૦૧૭	૩૧.૧૨.૨૦૧૬	૩૧.૧૨.૨૦૧૭
		અનઓડિટેડ	અનઓડિટેડ	અનઓડિટેડ
૧	કામગીરીથી કુલ આવક	૧,૦૧૫.૮૦	૭,૧૮૩.૪૧	૨૦,૩૬૧.૬૧
૨	સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (કરવેરા પહેલાં, અપવાદરૂપ અને / અથવા અસાધારણ વસ્તુઓ)	(૨૭૩.૭૩)	(૬૮૮.૨૨)	(૬,૨૦૨.૭૬)
૩	કરવેરા પહેલાં સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (અપવાદરૂપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	(૨૭૩.૭૩)	(૮૩૭.૦૩)	(૬,૨૦૨.૭૬)
૪	કર બાદના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (અપવાદરૂપ અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	(૩૮૮.૪૫)	(૬૮૮.૨૨)	(૬,૨૮૪.૨૫)
૫	આ સમયગાળા માટે કુલ વ્યાજ આવક સમયગાળા માટે કરવેરા નફા / (નુકસાન) (કર બાદ) અને અન્ય વ્યાજ આવક (કર બાદ)	(૩૮૮.૪૫)	(૮૩૭.૦૩)	(૬,૨૭૮.૪૪)
૬	ઈકિવટી શેર કેપિટલ (ફેસ વેલ્યુ રૂ. ૧૦/- દરેક)	૮૨૦.૧૮	૮૨૦.૧૮	૮૨૦.૧૮
૭	અન્ય ઈકિવટી	(૩૮૮.૪૪)	-	(૬,૬૧૩.૦૮)
૮	શેર ઠીક કમાણી (એ) બેન્ડીક (બી) ડાયલ્યુટેડ	-	-	-

નોંધ :
 ૧ ઉપરોક્ત સેબીના નિયમન ૩૩ હેઠળ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ નવ માસના અંતે નાણાકીય પરિણામોના વિસ્તૃત સ્વરૂપના ઉદ્દેશ્ય છે, જે સેબીના (લિસ્ટિંગ ઓફિસિયલ ગ્રેડેશન એન્ડ ડિસ્ક્લોઝર રિવાયરમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ નો સમાવેશ થાય છે. www.gujaratfoils.com પર સ્ટોક એક્સચેન્જ અને કંપનીની વેબસાઈટ પર નાણાકીય પરિણામો ઉપલબ્ધ છે.

ગુજરાત ફોઈલ્સ લિમિટેડ વતી સહી/-
આલોક કેલ્લાલ સક્લેના
 ઠરાવ કરનાર વ્યવસ્થાપક

સ્થળ : મુંબઈ
 તા. ૧૩.૦૨.૨૦૧૮

AREX INDUSTRIES LIMITED

(CIN: L99999GJ1989PLC012213)
 Regd Office: 612, GIDC Estate, Chhatral, Tal.:Kalol, Dist.: Gandhinagar-382 729.
 Phone: +91 2764 233636 Email: mail@arex.co.in Website: www.arex.co.in

Statement of Standalone Un-audited Financial Results For the Quarter and Nine months ended on 31st December, 2017

(Rs. In Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Nine months ended	
		31/12/2017 Unaudited	30/09/2017 Unaudited	31/12/2016 Unaudited	31/12/2016 Unaudited
1	Income				
	(a) Revenue from operations	969.58	839.92	816.59	2784.88
	(b) Other Income	1.48	0.16	0.98	7.20
	Total Income	971.06	840.08	817.57	2792.08
2	Expenses				
	(a) Cost of materials consumed	256.65	270.09	217.04	788.91
	(b) Purchases of Stock-in-Trade	11.78	2.68	24.34	43.52
	(c) Changes in inventories of finished goods, work-in-progress and stock-in-trade	(15.28)	27.77	(8.54)	(38.60)
	(d) Employee benefits expense	211.36	200.53	192.96	629.35
	(e) Finance costs	25.40	26.32	24.09	79.81
	(f) Depreciation and amortisation expense	74.00	69.00	59.00	221.00
	(g) Other expenses	253.77	216.51	234.50	719.55
	Total expenses	817.68	812.90	743.39	2443.54
3	Profit before exceptional and extraordinary items and tax (1-2)	153.38	27.18	74.18	348.54
4	Exceptional items	0.00	0.00	0.00	0.00
5	Profit before extraordinary items and tax (3 - 4)	153.38	27.18	74.18	348.54
6	Extraordinary items	0.00	0.00	0.00	0.00
7	Profit before tax (5-6)	153.38	27.18	74.18	348.54
8	Tax expense:				
	(1) Current tax	8.70	(0.35)	27.00	60.85
	(2) Deferred tax	(5.35)	17.10	(1.55)	19.65
9	Profit/(Loss) for the period (7-8)	150.03	10.43	48.73	268.04
10	Other Comprehensive Income (After Tax)	0.91	2.58	(4.63)	4.70
11	Total Comprehensive Income (9+10)	150.94	13.01	44.10	272.74
12	Paid-up - Equity Share Capital [Face Value Rs. 10/- each]	395.87	395.87	395.87	395.87
13	Earnings per equity share (of 10/- each) (not annualised)				
	(a) Basic	3.79	0.26	1.23	6.77
	(b) Diluted	3.79	0.26	1.23	6.77

NOTES:-
 1 Result for the Quarter and Nine months ended 31st December 2017 are in compliance with Indian Accounting Standards (Ind-AS) notified by the Ministry of Corporate Affairs, Consequently, result for the Quarter and Nine months ended 31st December 2016 have been restated to comply with Ind-AS to make them comparable.
 2 The above results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meetings held on 14/02/2018
 3 The Statutory Auditors have carried out a " Limited Review" of the Financial Result for the Quarter and Nine months ended 31st December 2017.
 4 The Company does not have more than one reportable segment. Accordingly segmental information is not required to be provided
 5 Reconciliation of profit after tax for the Quarter and Nine months ended 31st December 2016 between Ind-AS complaints result as reported above with result reported in previous year as per Indian GAAP is given below:

Particulars	Quarter ended 31st December 2016	Nine months ended 31st December 2016
Profit / (Loss) after tax under Indian GAAP	48.73	256.19
Measurement of Financial Instruments at fair value through Other comprehensive income	(4.63)	5.60
Total Comprehensive income as per Ind AS	44.10	261.79

For, AREX INDUSTRIES LTD.
Dinesh Bilgi
 (DIN:00096099)
 Managing Director

Place : CHHATRAL
 Date : 14.02.2018



નડીઆદના કોલેજ રોડ પર ચરોતર રૂલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય, માતરના ભુતપૂર્વ ધારાસભ્ય રાકેશ રાવ, જયેશભાઈ મહવાણા, રાકેશભાઈ બ્રહ્મહા હાજર રહેયા હતા અને ચરોતર રૂલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના આયોજક હિતેશ ચાવડા તથા કોલેજના વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. (તસ્વીર:- સાજુદ સૈયદ, નડિયાદ.)

OMKAR INDUSTRIES LIMITED

Regd. Office: 260, New Cloth Market, Out Side Raipur Gate, Raipur, Ahmedabad - 380 002.
 Website : www.omkarindustries.co.in, Ph No. : (079) 22120022;
 E-Mail ID : naroda@omkargroup.com CIN : L51909GJ1985PLC007702

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2017.

(In Rupees)

PARTICULARS	Quarter ended on 31/12/2017 (unaudited)	Nine Months ended on 31/12/2017 (unaudited)	Corresponding 3 months ended in the previous year 31/12/2016 (unaudited)
Total Income from Operations	21274278	114121439	39724010
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	35409	151026	67390
Net profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	35409	151026	67390
Net profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	26409	111026	47390
Total Comprehensive Income for the period (Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	26409	111026	47390
Paid-up equity Share Capital	2450000	2450000	2450000
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2233267	2233267	2064608
Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)			
-Basic	0.11	0.45	0.19
-Diluted	0.11	0.45	0.19

Notes:
 1. The above is an extract of the detailed format of Third quarter and Nine Months unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Unaudited Financial Results is available on company's website - www.omkarindustries.co.in.
 2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th February, 2018.
 3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 31st December, 2017 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

For OMKAR INDUSTRIES LTD.
SUBHASHCHANDRA O AGARWAL
 DIRECTOR & CEO
 DIN: 00356977

Place : Ahmedabad
 Date : 14.02.2018

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLC015839
 Regd. Office: International Airport Circle, Ahmedabad 382475,
 Web: www.rmhil.com, email: royalemanorhotels@rediffmail.com,
 telephone: 079-22868642/43 telefax: 079-22868641

Extract of Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31st December, 2017

(₹ in Lakhs)

Sr. No.	PARTICULARS	Quarter Ended 31/12/2017 (Unaudited)	Year Ended 31/03/2017 (Audited)	Quarter Ended 31/12/2016 (Unaudited)
1	Total income from operations (net)	611.25	1808.33	506.90
2	Net Profit / (Loss) from ordinary activities before tax	85.93	129.76	57.61
3	Net Profit / (Loss) for the period after tax	68.43	101.65	46.61
4	Total Comprehensive Income for the period	-	-	-
5	Equity Share Capital	1693.22	1693.22	1693.22
6	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	1849.17	1849.17	1752.42
7	Earnings Per Share (before extraordinary items) (₹ 10/-each)	0.40	0.59	0.28
	Basic: (₹)	0.40	0.59	0.28
	Diluted (₹)	0.40	0.59	0.28
8	Earnings Per Share (After extraordinary items) (₹ 10/-each)	0.40	0.59	0.28
	Basic: (₹)	0.40	0.59	0.28
	Diluted (₹)	0.40	0.59	0.28

NOTES :-
 1 The above results were reviewed by the Audit Committee & thereafter approved by the Board of Directors at its meeting held on February 14, 2018.
 2 The Previous year's/quarter's figures have been regrouped and/or rearranged, wherever considered necessary.
 3 The above is an extract of the detailed format of Quarterly & Nine Months Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.rmhil.com

By Order of the Board
For Royale Manor Hotels and Industries Limited
Jayesh Dave
 Director
 DIN: 01808753

Place : Ahmedabad
 Date : February 14, 2018

JINDAL WORLDWIDE LIMITED

Regd. & Corp. Off: "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivrangani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • CIN: L17110GJ1986PLC008942 • Phone: 079-7100 1500
 E-mail id: csjindal@jindaltextiles.com • Website: www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter Ended 31st December, 2017 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015)

(Rs. In Lakhs except EPS)

S.No.	Particulars	Quarter Ended (Unaudited)			Year To Date (Unaudited)	
		3 months ended of C. Y.	Previous 3 months ended of C. Y.	Corresponding 3 months ended of P. Y.	Corr. year to date figures of C. Y.	Corr. 9 months ended, year to date figures of P. Y.
		31st Dec. 2017	30th Sept. 2017	31st Dec. 2016	31st Dec. 2017	31st Dec. 2016
1	Total income from operations (net)	42460.33	39437.13	22935.08	118016.07	78590.83
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items)	2345.25	3022.24	1476.23	7527.54	4921.50
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	2345.25	3022.24	1476.23	7527.54	4921.50
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	1576.88	2039.82	1276.82	5337.85	4215.53
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1576.88	2039.82	1276.82	5337.85	4215.53
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year Le 31st March, 2017				26359.05	
8	Earnings per share (F.V. of Re. 5/- each) (for continuing and discontinued operations) :- 1. Basic :	3.93	5.09	3.18	13.31	10.51
	2. Diluted :	3.93	5.09	3.18	13.31	10.51

Notes:
 1 The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on 13th February, 2018.
 2 The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results. Filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results for the quarter ended on 31st December, 2017 alongwith Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltextiles.com)
 3 The figures of the previous period/year have been regrouped/rearranged wherever considered necessary.
 4 During the quarter ended 31st December, 2017 under consideration, the share capital structure of the Company was changed vide a Corporate Action - "Stock Split / Sub-Division" and thus the Face Value of Equity Shares of the Company from Rs. 10/- each was sub-divided into Rs. 5/- each by passing a Special Resolution through Postal Ballot dated 8th December, 2017. The Record Date as fixed by the Board of Directors was 27th December, 2017. Accordingly, in order to have the appropriate comparative figures, the EPS of the Company has been re-determined for respective reporting quarters.
 5 The company has adopted IND-AS from 1st April, 2017 and accordingly the said Un-Audited Standalone Financial Results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS - 34 - Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and SEBI Circular No. CIR/CFD/FAC/62/2016 dated 5th July, 2016.

Date : 13th February, 2018
 Place: Ahmedabad

For and On Behalf of the Board,
JINDAL WORLDWIDE LIMITED
(MR. AMIT AGRAWAL)
 Managing Director - DIN : 00169061

પ્રાંતિજ નગરપાલિકાની ચુંટણીને લઈને ઉમેદવારો દ્વારા ચુંટણી પ્રચાર જોરશોરમાં

પ્રાંતિજ, ગુજરાત માં ૭૫ જેટલી જગ્યાઓએ નગરપાલિકાની ચુંટણીઓ યોજાનાર છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ નગરપાલિકાની ચુંટણીને લઈને ઉમેદવારો દ્વારા ચુંટણી પ્રચાર તેજ થયો છે અને પોતાના વોટના મતદારોને રીઝવવા ભાજપ-કોંગ્રેસ-અપક્ષ હાલ નવાં નવાં નુસખા સાથે એડી ચોટી નું જોર લગાવી રહ્યાં છે. નગરપાલિકાની ચુંટણીને લઈને પ્રાંતિજ ખાતે ચુંટણી નો ગરમવો તેજ થયો છે. તો ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારો મતદારો પાસે મત ની માંગણી કરી રહ્યાં છે તો આ વખતે ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જગ પેલાશે અને તો બીજાબાજુ ભાજપ માં રહેલ અસંતોષ તથા ભાજપનાજ અસંતોષ ઉમેદવારો આ વખતે ભાજપ માટે ભારે પડે તો નવાઈ નહીં તો બીજાબાજુ આ વખતે ભાજપ-કોંગ્રેસ પક્ષ કરતાં વ્યક્તિ ગત ઉમેદવારો ચાલે તો નવાઈ નહીં અને નાતીવાદ, જુથવાદ સહિત ના પાસાઓ આ વખત ની ચુંટણી માં અંગ્રેસર રહેશે

તો આ વખતે કોંગ્રેસ પોતાના મે-૩૮ ઉપર ખાતું પોલશે તો બીજાબાજુ ભાજપ ઉમેદવારો વિકાસ ના કામો ને લઈને મતદારો પાસે વોટ ની માંગણી કરી રહ્યાં છે તો કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારો કામ નહીં થયાં હોવાની સાથે સફાઈ, ગટર સફાઈ, સ્ટ્રીટ લાઈટ તથા ભાજપ સુવિધા, ટ્રાફિક ની સમસ્યા તથા પ્રાથમિક સુવિધાઓ ને લઈને મતદારો પાસે મત ની માંગણી કરી રહ્યાં છે તો આ વખતે ભાજપ-કોંગ્રેસ બ